

॥ हरिःॐ ॥

# समय साथे समाधान

पूङ्य श्रीमोटा

संपादक  
रमेश म. भट्ट

हरिःॐ आश्रम प्रकाशन, सुरत

- प्रकाशक : ट्रस्टीमंडण,  
हरिःअँ आश्रम, स्थापना वर्ष १८५६  
कुक्केत्र महादेवना मंदिरनी बाजुमां,  
जहांगीरपुरा, रांडेर, सुरत-३८५ ००५.  
फोन : (०२६९) २७६५५६४
- हरिःअँ आश्रम, सुरत - नडियाद.
- | आवृत्ति | वर्ष | प्रत | आवृत्ति | वर्ष | प्रत |
|---------|------|------|---------|------|------|
| प्रथम   | १८८३ | २००० | तीज     | २००८ | १००० |
| बीज     | २००१ | १००० |         |      |      |
- पृष्ठ : १०४
- पउतर किंमत : रु. १५/-
- वेचाण किंमत : रु. १०/-
- प्राप्तिस्थान : हरिःअँ आश्रम, सुरत-३८५ ००५  
हरिःअँ आश्रम, नडियाद-३८७ ००१
- मुद्रणशुद्धि : जयंतीभाई जानी, फोन : (०७९) २६६९२७२८
- डिआईनर : मधूर जानी  
बी/८, रीपल एपार्टमेन्ट, नारायणनगर,  
पालडी, अमदावाद-३८० ००७. भो. : ८४२८४०४४४३
- टाईपसेटिंग : अर्थ कॉम्प्यूटर,  
२०३, भौर्य कॉम्प्लेक्स, सी. यु. शाह कॉलेज सामे,  
ઇन्कमटेक्स, अमदावाद-१४, फोन : (०७९) २७५४३६८८
- मुद्रक : साहित्य मुद्रणालय प्रा. लि.  
सिटी मिल कंपाउंड, कंकरिया रोड, अमदावाद-३८००२२  
फोन : (०७९) २५४६८९०९

॥ હરિ:ઓ ॥

## સમર્પણાંજલિ

(ત્રીજ આવૃત્તિ)

પૂજ્ય શ્રીમોટા સાથે સુરતના હરિ:ઓ આશ્રમના

સ્થાપનાકાળ પૂર્વેથી સંકળાયેલ

સદ્ગત બાબુભાઈ રણાંધોડાસ તમાકુવાળા

અને તેમનાં ધર્મપત્ની

સદ્ગત લલિતાબહેન બાબુભાઈ તમાકુવાળા

તેમ ૪

પિતાના દેહાંત બાદ સમગ્ર પરિવારની

અને ધંધાની કાળજ રાખી સાથોસાથ

પૂજ્ય શ્રીમોટા સાથે પ્રેમભાવભર્યો

સંબંધ રાખી આશ્રમના ઉપયોગમાં

જેઓ આવતા રહેલા

એવા તે પરિવારના

જ્યેષ પુત્ર

સદ્ગત અરવિંદભાઈ બાબુભાઈ તમાકુવાળાને

(એમ એ ત્રણે સદ્ગતને)

‘સમય સાથે સમાધાન’ની

આ ત્રીજ આવૃત્તિનું પ્રકાશન સમર્પિત કરતાં

અમો ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.

તા. ૨૫-૧૨-૨૦૦૮

નાતાલ

ટ્રસ્ટીમંડળ,

હરિ:ઓ આશ્રમ, સુરત

॥ હરિઃઽં ॥

## પૂર્વકથન

(પ્રથમ આવૃત્તિ)

પૂજ્ય શ્રીમોટાના આ પુસ્તકમાંના પત્રો વાંચતા પહેલાં કેટલીક બાબત જાણવી જરૂરી છે. સ્વ. બાબુભાઈ તમાકુવાળાને મેનેન્જાઈટીસની જીવલેણ બીમારી આવી હતી. એ દરમિયાન પૂજ્ય શ્રીમોટાએ નામસ્મરણ, પ્રાર્થના તથા અનુષ્ઠાનના નૈમિત્તિક પ્રયોગ કરીને પ્રભુકૃપાનો વિજય અનુભવ્યો. એની એક પ્રકારની અલૌકિક કથા આ પત્રો દ્વારા વ્યક્ત થઈ છે.

પૂજ્ય શ્રીમોટાના પ્રયોગથી કાળ લંબાયો છે. મૃત્યુને પાછું ઠેલાયું છે. આથી, પુસ્તકને ‘સમય સાથે સમાધાન’ તરીકે ઓળખાયું છે, કેમ કે જે સમય મળ્યો એનો હરિસ્મરણમાં ઉપયોગ કરાવીને પૂજ્ય શ્રીમોટાએ જીવાત્માના કર્મક્ષયનો કેવો મહામૂલો ઉપકાર કર્યો છે, એની પણ પ્રતીતિ મળે છે.

ભલે આ પત્રો એક જ વ્યક્તિને અને એના જીવનના વિશિષ્ટ સંદર્ભમાં લખાયા છે, છતાં પ્રભુસ્મરણની શક્તિ તથા પ્રાર્થનામાં રહેલું બળ જિજ્ઞાસુને સમજાય છે અને હરિસ્મરણનો આશ્રય અને સહારો લેનારનું જીવન ધન્ય બને છે, એની પ્રતીતિ થાય છે.

પુસ્તકમાંના પત્રોનો પૂરો સંદર્ભ જળવાય અને સમજાય એટલા માટે સ્વ. બાબુભાઈ તમાકુવાળાનો ટૂંકો પરિચય તથા એમનાં મૌનનિવેદનો આ સાથે જોડ્યાં છે.

રમેશ મ. ભંડ

॥ હરિઃઽં ॥

પૂજ્ય શ્રીમોટાના પ્રયોગ નિમિત્ત બનેલા  
સ્વ. બાબુભાઈ રણાઠોડાસ તમાકુવાળા

બાબુભાઈનો જન્મ તા. ૨૨-૮-૧૯૧૩ના રોજ થયેલો. તમાકુનો વેપાર કરવામાં ઓતપ્રોત બનેલા અને ધંધો ખૂબ સારી રીતે વિકસાવાયેલો. મહેસાણા જિલ્લામાં તથા ચરોતરમાં ધંધા માટે વધુ રોકાણ થતું. સુરતમાં પેઢીનું કામકાજ ભાઈઓ સંભાળતા. પોતાના સરળ સ્વભાવથી અને કુનેહથી સંપ સારો હતો.

પોતાની જ્ઞાતિમાં શ્રી બાબુભાઈ મોભાનું સ્થાન ભોગવતા હતા. જ્ઞાતિની સમસ્યાઓના ઉકેલમાં એમની વિવેકયુક્ત બુદ્ધિથી યશસ્વી બનેલા. ૧૯૫૫-'૫૬ના અરસામાં પૂજ્ય શ્રીમોટા સાથે પહેલી મુલાકાત થઈ, ત્યારથી જ પૂજ્ય શ્રીમોટા પ્રત્યે એમનું આકર્ષણ વધવા લાગ્યું. ૧૯૫૮માં મૌનઓરડામાં બેઠેલા ત્યારે તાપીમાં રેલ આવેલી. એ વખતે એમનો જે અનુભવ હતો, એ એમના શબ્દોમાં હવે પછીનાં પાનાંમાં પ્રગટ કર્યો છે. ૧૯૬૮ તથા ૧૯૭૦ની રેલ વખતે એ મૌનઓરડામાં જ હતા.

એમનાં બધાં જ સંતાનોનાં લગ્ન પૂજ્ય શ્રીમોટાના પુરોહિતપદે સાદાઈથી યોજેલાં અને લગ્નના રિવાજની પરંપરાને ત્યજ દીધેલી. ૧૯૬૦માં પોતાનાં સંતાનની લગ્નવિધિ વખતે તો તેઓ મૌનએકાંતમાં હતા.

૧૯૬૧માં એમનાં પુત્રવધૂ મંજુલાબહેનને માર્ય માસમાં મેનેન્જાઈટીસ થયેલો. ત્રણ મહિના હોસ્પિટલમાં રહ્યાં. એ

દરમિયાન પૂજ્ય શ્રીમોટાની પ્રેરણાથી ઘરમાં ૨૮ દિવસ હરિઃઊંના અખંડ જ્પ કર્યા, પરિણામે આંખનું તેજ ફરીથી મળ્યું, એમાં બાબુભાઈ રોજ કલાક બે કલાક બેસીને સ્મરણ કરતા.

૧૯૬૨માં એમને પોતાને મેનેન્જાઇટીસનો જીવલેણ હુમલો થયો. હોસ્પિટલમાં ૧૮ દિવસ લગી બેભાન રહેલા. એવી અવસ્થામાં પણ એમનું હરિસ્મરણ ચાલતું હતું. ૪૫ દિવસના હોસ્પિટલવાસ દરમિયાન તથા એ પહેલાં તથા પછી પૂજ્ય શ્રીમોટાએ જે પત્રો લખેલા, એ આ પુસ્તકમાં છે. બાબુભાઈનું આયુષ્ય લંબાય, નીરોગી રહે એ માટેનો પ્રાર્થનાભાવથી જે પ્રયોગ પૂજ્ય શ્રીમોટાએ કર્યો એના પરિણામે બાબુભાઈ ઊગરી ગયા અને પૂજ્ય શ્રીમોટાની સૂચના અનુસાર શેષ જીવન પ્રભુના શરણે ધર્યું. એ માટે પ્રતિજ્ઞાબદ્ધ થઈને, નંદરબાર, કુંજરાવ અને પાણસર જેવાં સ્થળોએ એકાંતમાં રહીને પ્રભુસ્મરણ કરતા. એ પછી સુરતના આશ્રમમાં વર્ષે ત્રણ વખત મૌનએકાંતમાં ૮૧ દિવસ બેસવાની વ્યવસ્થા થઈ. આથી, પૂજ્ય શ્રીમોટાની કૂપાથી ૨૭ વર્ષ લગી એ પ્રમાણે મૌનએકાંતની સાધના થયે ગઈ. તા. ૨૦-૮-૧૯૮૮ના રોજ એમનું અવસાન થયું.

● ● ●

॥ હરિઃઽં ॥

## સ્વ. બાબુભાઈનું મૌનનિવેદન - ૧

તા. ૭-૯-૧૯૫૮ થી તા. ૨૮-૯-૧૯૫૮

તા. ૭-૯-૧૯૫૮ના શુભ દિને સવારમાં છ વાગ્યે પૂજ્યનું ગ્રવચન થયું અને પૂજ્યની સાથે મૌનરૂમમાં ગયો. પૂજ્યે મને જે જે સૂચનાઓ આપવાની હતી તે આપી. અમે ખૂબ ખૂબ ભાવનાપૂર્વક ભેટચા અને પ્રેમમસ્તીથી હરિસ્મરણ કરવા પ્રેરણા આપી. સગાંસંબંધી પુત્રપરિવાર બધાંએ મારી ઉપર ખૂબ ખૂબ લાગણી વ્યક્ત કરી. બધાંને પગે લાગ્યો, ભેટચો અને હરિઃઽંની ગર્જના સાથે મૌનરૂમનું બારણું બંધ થઈ ગયું. ઓરડામાં અંધારું થઈ ગયું. ધીમેથી પ્રકાશ મળ્યો એટલે કપડાં ઉતારી વિચારવા લાગ્યો કે પ્રભુકૃપાથી સારો અવસર મળ્યો છે, તો તેનો સદ્ગુરૂપ્યોગ કરી લે. એકવીસ દિવસ મસ્તીથી હરિસ્મરણ કર અને જન્મોજન્મનાં ખોટાં સંસ્કારો અને આવરણોને હઠાવી ખાલી થઈ જા. ઓરડામાં તું એકલો છે. સાથે સૂક્ષ્મ રીતે ગુરુમહારાજ છે. ચેતન છે. સુંદર વાતાવરણ છે. બહાર તો અનેક જાતની ઉપાધિ, મુશ્કેલી, પ્રકૃતિ અને વૃત્તિઓના હુમલા નડતા. હવે તે બધાંમાંથી મનને વાળીને અંતર્મુખ થા અને મસ્તીથી હરિસ્મરણ એકસરખું એકધારું ચાલુ રહે તેવો અભ્યાસ કર અને પછી સ્વસ્થ થઈને ગુરુમહારાજની પ્રતીમા પાસે જઈ પાટલે બેસી ખૂબ ભાવનાપૂર્વક હરિસ્મરણ કર્યું. આખો દિવસ ઘણી જ સરળતાથી હરિસ્મરણ કરતાં કરતાં પસાર થઈ ગયો. આમ, સરળતાથી દિવસો પસાર થવા લાગ્યા. સવારના આઈ વાગ્યે ત્રાટક કરતો અને પછી કુંડીનાં પાણીમાં આંખ ધોઈ આંખે પાટા બાંધી ૧૫ મિનિટ સૂઈ રહેતો. લગભગ આખા દિવસનો કાર્યક્રમ નક્કી કરેલો, તે મુજબ

સરળતાથી વખત પસાર થઈ જતો. જમવામાં ચોખા બંધ કરી દીધા અને પ્રમાણસર જ ખોરાક રાખ્યો. જેથી, આખો દિવસ ચિંતન સ્મરણમાં પસાર થતો. સવારમાં પાંચ વાગ્યે પરવારી નામસ્મરણ માટે બેસતો, તે સાડા છ વાગ્યે ભજનનો પ્રોગ્રામ આવે ત્યાં સુધી ખૂબ ભાવપૂર્વક રહેવાતું. ઘણી વખત તો શરીરને આંચકા લાગતા. જાણે ચેતનનો કરંટ લાગે. ઘણી વખત આંખમાંથી અશ્વુ વહી જતાં હોય. આ રીતે હરિસ્મરણ થતું. ઘણી વખત પ્રાર્થના ખૂબ ભાવપૂર્વક થતી ત્યારે પણ ખૂબ રડતું કે હે પ્રભુ, તારો બાળક તારે શરણો આવ્યો છે. તારાં ચરણકુમળમાં સ્થાન આપજે.

ઘણી વખત તો પૂજ્ય સાથેના પ્રસંગો યાદ કરીને તેમનામાં ખૂબ ખૂબ ભાવ દફાવતો. - કુંભવિધિ - ગુરુપૂર્ણિમા - જ્યાં જ્યાં સાથે ફરતો તે પ્રસંગો - હનુમાન કૂદકાને દિવસે નાદિયાદથી સેવાલિયા થઈને ગળતેશ્વર ગયેલા, ત્યાંનો પ્રસંગ - ચીખોદરા - ઉમરેઠ - કુંજરાવના પ્રસંગો યાદ આવતા અને ખૂબ ભાવ જાગતો.

ચિંતન થતું કે હું કાયમ વિચાર્ય કરું છું કે હરિસ્મરણ એકધારું સતત તેની સળંગતા જળવાઈ રહે અને ઉત્સાહપૂર્વક થાય. પૂજ્યને હૃદયકુમળમાં સ્થાપી સતત એમના સંપર્કમાં જ રહીએ. જેથી, સંસારવહેવારનાં કોઈ પણ ખોટાં કામ બને નહિ અને સાત્ત્વિકતા જળવાઈ રહે. સકળ કાર્ય પ્રભુપ્રીત્યર્થ થાય. એનું છે અને એના વતી ભાવનાથી ઉત્સાહપૂર્વક કરવાનું છે, એવો ભાવ જાગે.

સારુંનરસું બધું સમર્પા ખાલી ને ખાલી રહેવાનો અત્યાસ પાડવો. સંસારવહેવારમાં દરેક સાથે સદ્ગ્રાવ ને સુમેળ કેળવવો, કોઈને ખાતર ઘસાવું પડે તો પ્રેમથી ઘસાવું. આ બધી

સમજણ પડવા છતાં આચરણમાં કેમ નથી ? ઘણી વખત  
 ઉશ્કેરાટના પ્રસંગે આપણે સમજુએ કે શાંતિ રાખવી અને તે  
 પ્રમાણે મનને વાળીએ તેમાં મનને ખૂબ ખેંચી ખેંચીને પકડી  
 રાખીએ, પણ આખરે તો તે છટકી જાય અને કોધ ભભૂકી ઊઠે.  
 પાંચ કર્મન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને  
 અહંનાં અનેક પાસાંની વચ્ચેમાં જીવ કર્દ રીતે સરળતા કરી  
 શકે ? આ બધાંને માટે એકવીસ દિવસ મૌનમાં બેસી હરિસ્મરણ  
 થાય તો ઘણું ઘણું માર્ગદર્શન મળે અને જીવને અભ્યાસ પડે.  
 આ રીતે ચિંતન-સ્મરણમાં દિવસો પસાર થવા લાગ્યા. મને કોઈ  
 જતના વિચારોએ, વૃત્તિએ, વસને કે વિકારે સત્તાવ્યો નથી.  
 ઊંઘ સરસ આવતી. ભોજન પણ ખૂબ ખૂબ સ્વાહિષ લાગતું.  
 પહેલાં ગ્રણચાર દિવસ પછી રાતના શરદી એકદમ લાગતી અને  
 બેત્રણ દિવસ સુધી તો ગળામાંથી બોલાય જ નહિ, પણ પછી  
 ધીમે ધીમે બધું બરાબર થઈ ગયું. તા. ૧૮-૮-૧૯૮૮ના દિવસે  
 ભયંકર રેલ આવી અને મૌનમંદિરમાં કીચડ ભરાઈ ગયો. તે  
 કાઢતાં પ્રાર્થના કરતો કે હે પ્રભુ ! તું મારામાંથી પણ આવો મેલ  
 દૂર કરજે. ઘણી વખત હરિસ્મરણ ખૂબ ભાવપૂર્વક થતું.  
 હદ્યસ્પર્શથી ‘હ’નો ઉચ્ચાર નીકળી ‘હરિઃ’ કંઠેથી નીકળી ‘ઉঁ’  
 બ્રહ્મકમળમાં લય થઈ જતો. આ રીતે સરસ સ્મરણ થતું. જમતાં  
 જમતાં પ્રાર્થના કરતો કે ‘હે પ્રભુ ! મારામાં ચેતનનું અવતરણ  
 થજો. સ્નાન કરતી વખતે મારામાંથી મેલ દૂર કરજો અને મળમૂત્ર  
 ત્યાગ વખતે મારામાંથી વિકાર દૂર થાય એવી પ્રાર્થના કરતો.  
 હે પ્રભો ! અનેક જન્મોનાં સંસ્કારો અને આવરણો હઠાવવાનાં  
 છે. અનેક જન્મો પાખ્યો હોઈશ, અનેક વખતે માતાના ઉદરમાં  
 સંસ્કાર પાખ્યો હોઈશ, તેનું મને ભાન નથી, પણ આ વખતે  
 તો સભાન એકવીસ દિવસને માટે હે પ્રભો ! તારા

મૌનમંદિરરૂપી માતાના ગર્ભમાં પુરાયો છું. જ્યાં તારા ચેતનની જાંખી થાય છે, જ્યાં જ્યપયજ્ઞના મંત્રો વાતાવરણમાં ગુંજે છે, જ્યાં ધૂપ, અગરબત્તી અને ગુલાબના ફૂલની સુવાસ છે. આવા પવિત્ર વાતાવરણમાં એકવીસ દિવસમાં જે સંસ્કાર આપે તેનાથી જીવન ધન્ય બનાવી સદ્જીવન પરત્વે ગતિ કરાવજે એવી નમ્ર પ્રાર્થના હે પ્રભો ! સ્વીકારજે.

આ રીતે પ્રાર્થના, મનન, સ્મરણ કરતાં કરતાં સુંદર વાતાવરણમાં સરળતાપૂર્વક એકવીસ દિવસ પસાર થઈ ગયા. આ રીતે દર વર્ષે મૌનમાં બેસવા સંકલ્પ કર્યો. એનાથી ઘણા ફાયદા છે. પહેલું તો આપણી પ્રકૃતિ અને વૃત્તિ કઈ જાતની છે, તેનું ભાન જાગે છે અને હવે પછી જીવનમાં કઈ રીતે સાત્ત્વિક જીવન જીવવું તેનું ચિંતન થાય.

જીવનમાં દરેક સાથે સદ્ગુરુભાવ અને સુભેળ જાળવવા ભૂમિકા સર્જય અને જે સંસ્કારો પડે તે જીવને ઊંચે લઈ જાય.

નામસ્મરણની સળંગતા જાળવવાનો અત્યાસ થાય.

મનને બહિર્મુખમાંથી અંતર્મુખ થવાનો અત્યાસ થાય અને હંડ્રિયોના એકેએક કરણને શાંતિ મળે જેથી મન પ્રસન્ન રહે.

સદ્ગુરુને હૃદયકમળે સ્થાપી સતત તેમના સંપર્કમાં રહેવાય જેથી જીવન ધન્ય બને. આમ, મૌનમાં બેસવાથી ઘણું ઘણું મળે છે. જીવનનો આખો પ્રવાહ બદલી નાખે છે અને જીવન જીવવાને લાયક બનાવે છે.

પ્રભુ ! બીજું નિવેદન શું કરું ? આજની રાતે ઊંઘમાં જાણે ખૂબ ખૂબ આનંદ મળ્યો અને સવારે અઢી વાગ્યે આંખ ખૂલી ગઈ પછી ખૂબ ખૂબ ભાવ અને પ્રેમાશ્રુ સાથે પ્રાર્થના થઈ કે હે પ્રભુ ! જન્મોથી રખડતો ભટકતો હવે ભાન જાગવાથી તારા શરણે આવ્યો છું. તારી સાથે કેમ વર્તવું તે આ મૂરખ

જીવને ભાન નથી. એ તો ફક્ત તારી આગળ રડી જાણે છે. તો પ્રભુ ! મારા જે ગુના થયા હોય તે માફ કરજે. મારામાંથી કામ, કોધ, લોભ, મોહ, રાગ, દ્રેષ, વિકાર, ભય, અસત્ય વગેરે જે જે દુર્ગુણો હોય તેનું નિવારણ કરી પવિત્ર, સાત્ત્વિક અને સંસ્કારી જીવન તરફ ગતિ કરાવજે. હે પ્રભુ ! મારાં હદ્યકમળમાં તારું સ્થાન રાખી મને કાયમ તારી સાથે રાખજે. જેથી, સતત તારું સ્મરણ કરતો રહું. ભૂલો પહું તો આ મૂરખ બાળકની સંભાળ લેજે અને તારાં ચરણકમળમાં સ્થાન આપજે.

મારા એકવીસ દિવસ ખૂબ શાંતિપૂર્વક સરળતાથી મનન, ચિંતન અને નામસ્મરણમાં આનંદપૂર્વક પસાર થઈ ગયા. તેમાં બા, ભીખુકાકા તથા જીણાભાઈ મારી ઉપર ખૂબ લાગણી રાખી ટાઈમે ટાઈમની મારી સગવડ સાચવી મને જે સરળતા કરી આપી, તે કેમ ભુલાય ? તે બદલ હું તેમનો આભાર માનું છું.

જ્યુયશ્ચ તા. ૧૬-૮-૧૯૮૮ થી મેં શરૂ કર્યો, તેની અંદર જ્યોત સતત જલતી રહો અને તે અમર તપો એવી વહાલા પ્રભુને મારી નમ્ર પ્રાર્થના.

લિ. બાબુનું પાયેલાગુ

વહાલા પ્રભુ,

આવતી કાલે મારો નવો જન્મ થશે અને ફરી ચક્કરમાં પડીશ. એકવીસ દિવસ તારાં ચરણકમળમાં રહી તારામાં ભાવના દઢાવી દઢાવી સંસ્કાર પાખ્યો છું. તેને દીપાવલાની શક્તિ આપજે અને જ્યાં જ્યાં નિમિત્ત બન્યો છું, તેમાં પાર ઉતારી તારાં ચરણકમળમાં બેસવા સ્થાન આપજે. તારા બાળકની અંતરના ઉંડે ઉંદીથી ગદ્દગદ કંઠની હદ્યપૂર્વકની નમ્ર પ્રાર્થના સ્વીકારજે.

લિ. બાબુના સાણંગ દંડવત્ પ્રણામ

॥ હરિઃઽં ॥

## મૌનનિવેદન-૨

મૌનમંદિરમાંથી, તા. ૨૦-૮-૧૯૫૮

બુધવાર તા. ૧૬-૮-૧૯૫૮ને દિને પૂજ્ય નિદ્યાદથી સુરત આશ્રમે પધારનાર છે, એવું ભીખુકાકાના કહેવાથી જાણેલું, પણ મંગળવારે સાંજના ભીખુકાકા બોલ્યા કે નિદ્યાદ આશ્રમે ગુરુમહારાજને તાર કરી દો કે ભારે રેલ આવી છે. એટલે મનને થયું કે મોટા હવે આવશે નહિ. તા. ૧૬-૮-૧૯૫૮ને બુધવારે સવારના સાડા છ વાગ્યે ભીખુકાકા તથા જીજાભાઈ મૌનમંદિરમાં પણ દાખલ થશે માટે સાવચેત રહેજો અને કોઈ વસ્તુ બગડે નહિ તેની સંભાળ લેજો, બધું ઓરડીમાં ટૂટક છે તેને ઉપર મૂકી દેજો. પછી બોલ્યા કે પાણી ઉિતરતાં હોય તેવું લાગે છે. તા. ૭-૮-૧૯૫૮ને દિને બરાબર આજ ટાઈમે મૌનમંદિરમાં બેસનાર સમક્ષ ગુરુમહારાજ પ્રવચન કરી રહ્યા હતા, તે યાદ આવ્યું. બાદ, બપોરના ટાઈમે જાજરુના ટબમાં પાણી ભરાયું. મેં ચિઢી મૂકી, તો જવાબ મળ્યો : રેલનાં પાણી ભરાયાં છે અને પાણી વધે છે. પછી તો ધીમે ધીમે પાણી વધવાં માંડ્યાં. બાથરૂમમાં પાણી દાખલ થયું અને જાજરુમાં પણ પાણી વધવાં માંડ્યાં, એટલે મેં જાજરુનું બારણું બંધ કરી દીધું, કારણ મેલું ઉપર હતું. એટલે તે બારણું બંધ કર્યું પછી ખોલ્યું નહિ. બાથરૂમમાં પાણી વધતાં વધતાં ઉમરા સુધી આવી ગયાં અને બહાર ઓટલા ઉપર રેલનાં પાણીની છાલકો વાગવા માંડી. એટલે ચોક્કસ થયું કે પાણી હવે મૌનમંદિરમાં દાખલ થવાની તૈયારી છે. એટલે શેતરંજ વગેરે ઊંચકી લીધાં અને લગભગ છ વાગ્યે માતાજી મંદિરમાં પધાર્યાં અને પાણીનો રેલો ચાલ્યો. મોં ધોવાના ટબ આગળ, ત્યાં પાણી ભેગું થવા લાગ્યું અને પાણી

વધુ ને વધુ દાખલ થવા લાગ્યું. બાથરુમનું બારણું ખોલ્યું તો પાણી અડધા ઉપર સુધી આવી ગયેલું. પ્રથમથી જ તૈયારી હતી એટલે સહેજ પણ અકળામણ, મૂળવણ કે ગભરામણ ન હતી અને વિચાર આવ્યો કે બાથરુમનું પાણી મૌનરુમમાં પડે તે પહેલાં જ સ્નાન કરી લઉં. માતાજી મૌનમંદિરમાં પધાર્યા છે અને તરત જ અમલ કર્યો. સ્નાન કરી લીધું પછી બાથરુમ ખોલી ફુવારો ખોલી ખૂબ નાહ્યો અને શરીર સાફ કરીને હીંચકે બેઠો. પાણી ધીમે ધીમે વધવાં માંડ્યાં. ભીખુકાકા અને જીણાભાઈ આવ્યા અને 'બહાર નીકળી જવું હોય તો બેલ મારજો' એમ કહ્યું, અને હિંમત રાખવા જણાયું. મેં ચિઠી લખીને મૂકી કે કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવાનું નથી. બુધવારે રાતના પછી તો બાથરુમનું પાણી મૌનમંદિરમાં પડવા લાગ્યું અને પાણી વધતાં ચાલ્યાં. નીચે ત્રણ સ્ટેન્ડ ભેગાં કરી તેની ઉપર પૂજાનો પાટલો (તેની ઉપર જમવા બેસીએ તે પાટલો) મૂકી દીધો. સ્ટેન્ડના પાયા રૂબવા લાગ્યા અને પાણીનો જોશ વધવા લાગ્યો. એટલે આરામખુરશી વાળીને ખીંટીએ ભેરવી દીધી. ઊંનું સ્ટેન્ડ દોરીથી બાંધી ખીંટીએ ભેરવી દીધું. ઘડિયાળ ખીટીએ ભરાવી દીધું. ચોક્કસ લાગ્યું કે પાણી વધતાં જવાનાં. સહેજ પણ ગભરામણ થઈ નથી અને મનની સાથે પાકો નિશ્ચય કર્યો કે ગમે તે બને પણ કોઈ પણ સંજોગોમાં મૌનમંદિરની બહાર નીકળી જવાનું નથી અને જપયજ્ઞનનું સાતત્ય તોડવાનું નથી. સમર્થ સથવારો છે પછી અકળામણ શાની? પ્રભુકૃપાથી જબરજસ્ત હિંમત હતી અને પાણી ધીમે ધીમે વધતાં જ ચાલ્યાં. એટલે અગમચેતી વાપરી બધી જ તૈયારી કરવા માંડી. હીંચકા ઉપરથી તળાઈને વાળીને હીંચકો બંધ કરી દીધો. એટલે પગ આગળ જે ભાગ લટકતો હતો તે ઉપર લઈને સાંકળ ભેરવી દીધી. બાદ, ત્રણ સ્ટેન્ડ હીંચકા ઉપર મૂક્યાં. એની ઉપર પૂજાનો પાટલો ગોઠવ્યો અને તેની આગળ જમવાનો

પાટલો ગોઠવ્યો. અને તેની ઉપર તળાઈને પાથરી તકિયા ગોઠવી દીધા. પછી તો બે મોટાં સ્તૂલ અડધા પાણીમાં ઢૂબી ગયાં એટલે પૂજ્યની પ્રતીમાને ભંડારિયામાં ગોઠવી દીધી અને બધું ચોક્કસ કરીને હીંચકે બેઠો અને લાઈટો બંધ થઈ ગઈ. હરિસ્મરણ બેઠાં બેઠાં કર્યા કરીશ એમ વિચાર કર્યો એટલે જીણાભાઈ બેટરી લઈને આવ્યા કે પાણી ભરાઈ જવાથી લાઈટ બંધ થઈ ગઈ છે, તો બેટરી રાખો અને હિંમત આપી ગયા. ખૂબીની વાત તો એ હતી કે આટલું બધું બન્યું પણ સહેજ પણ ગભરામણ નથી થઈ અને પ્રભુકૃપાથી ભારે હિંમત કેળવાઈ. હરિસ્મરણ કરતાં કરતાં હીંચકા ઉપર પાટલો ગોઠવી તેની ઉપર તળાઈ વાળીને નાખેલી તે બરાબર મૂકી તકિયો ગોઠવી આડો પડ્યો અને ઊંઘનું ઝોકું આવી ગયું. જાગતાં ઊંઘતાં હરિસ્મરણ કરતાં કરતાં બેટરી મારી. પાણી કેટલાં વધ્યાં તે તપાસ્યા કરતાં પાણી ધીમે ધીમે વધતાં જ જતાં હતાં. બહાર પાણીનો જબરજસ્ત ધુઘવાટો સંભળાતો અને બારણા સાથે મોજાં અથડાતાં અને બારણાની ફાડમાંથી પાણીનો રેલો પડે તેનો અવાજ આવવા માંડ્યો. લગભગ ત્રણ સાડાત્રણ વાગ્યા હશે અને જીણાભાઈ ચા લઈને આવ્યા અને ભંડારિયામાં મૂકી. એ પી લેવા જણાવ્યું. ઊભાં ઊભાં ચા પી લીધી. પછી જીણાભાઈએ કહ્યું, ‘હવે બેલ વાગશે નહિ, તો જરૂર પડે મોટેથી ભૂમ પાડજો.’ અને હિંમત રાખવા જણાવ્યું. એમ કરતાં ગુરુવારની સવાર પડી ગઈ. જીણાભાઈ ફરી ચા અને બિસ્કિટ આપી ગયા અને કહ્યું કે જમવાનું આજે બને તેમ નથી. હવે તો બેઠાં બેઠાં સ્મરણ અને પ્રાર્થના કરતો. પાણી ધીમે ધીમે વધતાં હીંચકાની સહેજ નીચે રહ્યાં. એકી જવાનું થયું તો વિચાર આવ્યો કે બાથરૂમનું બારણું ખોલી એકી કરાય તો પાછું રૂમમાં જ પાણી આવે અને જાજરૂનું બારણું તો બરાબર પેક જ કરી દીધેલું. એટલે હીંચકો અને મોં ધોવાના ટબની વચ્ચે બે મોટાં સ્તૂલ ગોઠવી દીધાં

અને હીંચકા ઉપરથી પાણીમાં ઊતર્યા વગર સ્ટૂલ ઉપર ઊભા રહીને ટબમાં એકી કરવા ગોઠવું તેવો ઉપાય કર્યો. ટબના નળથી પાણી પણ સરસ મળતું હતું. અને પછી બપોરના જીણાભાઈ રાબ અને કોપરું લઈને આવ્યા અને કહ્યું, ‘પ્રાઇમસ ઉપર બનાવું છે.’ હીંચકા ઉપર બેસીને જમ્યા બાદ સ્મરણ કર્યા કરતો અને પાણી ધીમે ધીમે વધતાં તે તપાસ્યા કરતો અને પછી તો પાણીમાં મોટાં સ્ટૂલ તરવાં લાગ્યાં અને હીંચકાની સપાટીએ પાણી આવી ગયું. જીણાભાઈ ચા લઈને આવ્યા અને કહ્યું પાણી વધતાં જાય છે. હવે પછી અતે અવાશે કે કેમ? એ પ્રશ્ન છે. સાંજનું જમવાનું કેમનું છે? ચિડી લખી આપી. ‘સાંજે જમવાનું નથી.’ પછી તો જીણાભાઈ ફરી આવ્યા અને કહ્યું કે, ‘બહારથી બારણાની સાંકળ ખોલી નાખું છું, કારણ હવે પછી અતે અવાય કે ન અવાય, તો જો તમારો વિચાર બહાર નીકળી જવાનો હોય તો વિચાર થાય તો અંદરથી સાંકળ ખોલી બહાર નીકળી આવજો.’ એમ કહીને બહારથી સાંકળ ખોલી નાખી. મેં ‘હરિ:ઝું’ થી જવાબ આપ્યો.

ગમે તે સંજોગોમાં બહાર નીકળવાનું નથી જ એમ મન સાથે પાકો નિશ્ચય કર્યો અને ગમે તે સંજોગો આવે તેને માટે ગોઠવણ કરવા માંડી. બે મોટાં સ્ટૂલ એકમેકને દોરી સાથે બાંધી હીંચકા સાથે તરતાં રહેવાં દીધાં. પછી પાણીમાં ઊતરીને હીંચકાને જે સાંકળમાં ભેરવેલો છે, તે ચારે સાંકળને એક એક કરીને હીંચકો અને સાંકળ બાંધી દીધાં કે હવે પછી પાણી વધે તો સાંકળમાંથી હીંચકો નીકળીને તરતો ન થઈ જાય. જો પાણી વધે અને હીંચકો તરતો થઈ જાય તો ગબડી જ પડાય. હવે પાણી વધે તો ચિંતા નહિ. સ્ટૂલ તરતાં છે, તે ઉપર લઈને બેસીશું. હરિસ્મરણ કરતાં કરતાં પાસે કરતાલ હતા તે

વગાડતો. હીંચકા ઉપર અગરબત્તી સળગાવતાં રાત પડી ગઈ. વિચાર આવ્યો કે ગઈ વખતે પાણી કેટલાં નીચાં હતાં તે વખતે અડાજણ સ્ટેન્ડ દુબી ગયેલું, તો આ વખતે શું સ્થિતિ હશે? અને મૌનમંદિરની બહાર ક્યાં સુધી પાણી હશે. વરિયાવની સડક સુધી પાણી હશે. આમ ને આમ પાણી વધે તો શું થાય? પણ સાંજ પછી પાણી વધતું અટકી ગયેલું અને એની એ જ સપાઠી ઉપર હતું. એટલે મન કહેતું હતું કે હવે પાણી વધશે નહિ અને પ્રાર્થના કરતાં કરતાં ધીમે ધીમે રાત પસાર થવા લાગી. બુધવારે સાંજથી હીંચકા ઉપર બેઠેલો તે ગુરુવારે રાતના પણ ત્યાં જ બેઠો હતો. જાગતાં ઊંઘતાં પાણી તપાસ્યા કરતો, તો કોઈ વખત હીંચકાના લેવલે લેવલ તો કોઈ વખત બેત્રણ આંગળ નીચું. પછી પાછું ઊંચું થતાં, તે લેવલ આવી જતું. પાણી એકબે આંગળ ઉત્તરે તે બહાર મોજાં આવે તે ચઢે. એટલે હવે પાણી ઉત્તરવાં લાગ્યાં એમ મનને થયું અને ઝોડું આવી ગયું. ફરી જોયું તો પાણી એક હ્યાં ઉત્તરી ગયેલાં. જાગતાં ઊંઘતાં રાત પસાર થઈ અને સવારના સવાત્રણ વાગ્યે ભીખુકાકા આવીને તગારાં મૂકી ગયા કે પાણી ઉત્તરવાં માંડ્યાં છે. ઓરડામાં કીચડ ઘણો હશે, તે પાણી ઉત્તરે એટલે બાથરૂમમાં નાખતા જજો. અને સવાર પડતાં પાણી ઉત્તરી ગયાં. બે દિવસથી જાડો તો બંધ જ થઈ ગયો હતો. મેં વિચાર્યુ. આમ કીચડ બાથરૂમમાં નાખીએ તો બાથરૂમનું પાણી બહાર વહેતું ન થાય ત્યાં સુધી શું કામ લાગે? એટલે બારણા વચ્ચમાં કાણું હતું તેમાં ચીંથરું નાખી તે કાણું બંધ કરી દીધું. એટલે ઓરડામાંનું પાણી નીકળી ન જાય અને પછી જ્યારે ઓટલા ઉપરથી પાણી નીચે ઉત્તરી જાય ત્યારે કાણું ખોલી પાણી સાથે કીચડ બહાર કાઢી નાખવો અને તે પ્રમાણે અમલ કર્યો. આમ,

પાણી સાથે બધો જ કીચડ બહાર. પછી અંદર જે પાણી રહ્યું તે પાણીને પગેથી દોળવી દોળવીને કીચડ ભેગો કરી બાથરૂમમાં નાખવા માંડ્યું. ઓરડો ચોખ્ખો થયો એટલે તેને ચોખ્ખા પાણીથી ધોઈ નાખ્યો. બધી ભીતો ઉપર કાદવ લાગેલો તે ધોઈ નાખી, ઓરડી સાફ કરી નાખી. ચોખ્ખાં પાણીથી ધોઈ નાખી. બાદ, પાણી બાથરૂમમાંથી કાઢી ફરી ચોખ્ખી ધોઈ, પોતું ફેરવી ચોક ચોખ્ખો કર્યો. સ્ટૂલો બધાં નળ નીચે બરાબર ચોખ્ખાં ધોઈ નાખ્યાં. બાથરૂમ જાજરુ સાફ કર્યો. સવારથી રાત સુધી એકસરખું આ કામ કર્યું અને મૌનરૂમ તથા ઓરડી તથા બાથરૂમ, જાજરુ બધું સારી રીતે ચોખ્ખાં કરી નાખ્યાં. મૌનરૂમના પથ્થર તો કીચડથી ધોવાઈને ઊજળા થઈ ગયા અને ભીત ઉપર પોતું ફેરવી ચોખ્ખી કરી અને શનિવારે બધું વ્યવસ્થિત ગોઠવી દીધું. હું મૌનરૂમમાં બેઠો તેના કરતાં અત્યારે રૂમ સરસ ચોખ્ખો છે. પ્રભુકૃપાથી ભારે અજિનપરીક્ષામાંથી પસાર થયા. તેમાં ભીખુકાકા અને ઝીણાભાઈએ આવી ભારે રેલમાં અવારનવાર આવીને અમારી સંભાળ રાખી. વખતોવખત ચા, જમવાનું પહોંચતું કર્યું, ખૂબ ભાવપૂર્વક અને પ્રેમથી કાળજ રાખી અને વખતોવખત આવીને હિંમત આપી જતા, એ તો અમારા માટે ભારે પ્રભુકૃપા. એમનાં નિષ્ઠામ કર્મની કદર આવા ટાઈમે થઈ અને હું, ભીખુકાકા તથા ઝીણાભાઈને ખૂબ ભાવપૂર્વક પ્રણામ કરું છું.

શનિવારે હેમંતદાદા, નટુભાઈ, શાંતિભાઈ ચાલતા આવ્યા. હેમંતદાદાનો અવાજ સાંભળી ખૂબ ખૂબ આનંદ થયો. મારા પ્રણામ.

લિ. બાબુના પ્રણામ

● ● ●

॥ હરિઃॐ ॥

## અધ્યાત્મવિજ્ઞાનીનો અદ્ભુત પ્રયોગ

### પ્રસ્તાવના

(પ્રથમ આવૃત્તિ)

પૂજ્ય શ્રીમોટા અધ્યાત્મવિજ્ઞાની હતા. એમણે પોતાના સાધનામય જીવન દરમિયાન જે જે અનુભવકક્ષાઓ સિદ્ધ કરી હતી, એના નિમિત્ત યોગે જે પ્રયોગો કરવાના આવ્યા, એ પ્રયોગ કર્યા છે અને પોતાના સમગ્ર જીવનની સાધનાનું હાઈ તેઓશ્રીએ આવા પ્રયોગો દ્વારા પ્રગટ કર્યું છે. પૂજ્ય શ્રીમોટાની આ એક અનોખી વિશેષતા છે.

૧૮૮૮માં તેઓશ્રીને અદ્વૈતનો-એટલે કે પોતાના ચેતનસ્વરૂપની સર્વવ્યાપકતાનો અનુભવ થયો એ પછી, પોતાની માની અંતિમ ઘડીએ, તેઓશ્રી બનારસમાં હતા, છતાં નાદિયાદમાં સદેહે પ્રગટ થયા હતા. પોતાના આવા અનુભવને તેઓશ્રીએ પ્રભુની કૃપાનો મહાન અનુભવ ગણાવ્યો છે. પોતાની સ્થળાતીત અનુભવાવસ્થાનો અને પ્રાર્થનાની અદ્ભુત શક્તિનો એક મહાન પ્રયોગ કર્યો હતો. આવા તો બીજા અનેક પ્રયોગો તેઓશ્રીએ વ્યક્ત પણ કરેલા છે. અધ્યાત્મપુરુષ ક્યારેય આવા પ્રયોગો કરતા નથી, પરંતુ જ્યારે એવું નિમિત્ત ઊભું થાય ત્યારે એ સહજ રીતે થાય છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કોઈ એક નિમિત્તને લીધે જે બન્યું હોય એવું બીજાને માટે પણ બને જ એવો અધ્યાત્મવિજ્ઞાનમાં નિયમ નથી. આ સર્વ સામાન્ય જીવોએ ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે.

પૂજ્ય શ્રીમોટા, સાધનાથી જે પ્રકારના અનુભવો પામ્યા હતા, એવા અનુભવો અન્ય નિમિત્તને પણ કરાવી શકતા હતા, એ એમની અધ્યાત્મસિદ્ધિની વિશિષ્ટતા છે. પૂજ્ય શ્રીમોટાની સાધનાનું આરંભનું સાધન નામસ્મરણ હતું. ઉત્તરોત્તર એ સાધનની સૂક્ષ્મતા તેઓશ્રી પામ્યા હતા. તેઓશ્રીના સંપર્કમાં આવેલા જીવાત્માઓમાં આ સાધન સહજ રીતે થયે જતું ઘણાંએ અનુભવ્યું છે અને એ સાધનની શક્તિથી કેવાં કેવાં પરિણામો અનુભવાય છે, એ પણ તારવાયાં છે. આવા પ્રયોગોના પુરાવા જૂજ છે. એમાં સ્વ. બાબુભાઈ તમાકુવાળાના જીવનમાં થયેલો પ્રયોગ તેઓશ્રીના પત્રોમાં જળવાઈ રહ્યો છે, એ આપણા સૌના આનંદની વાત છે.

સ્વ. બાબુભાઈને મેનેન્જાઈટીસનો જીવલેણ વ્યાધિ થયો હતો. નામસ્મરણની શક્તિથી એ એમાંથી કેવી રીતે ઊગર્યા એનો આઇપાતળો પણ પ્રેરક ઈતિહાસ પૂજ્ય શ્રીમોટાના આ પત્રોમાં છે. તમાકુવાળા પરિવારના સત્યોએ આ પત્રો જાળવી રાખ્યા એનું સારું પરિણામ આવ્યું. આ નાનકડા પુસ્તકમાં એ પત્રોનું સંપાદન થઈ શક્યું છે. તેથી, પૂજ્ય શ્રીમોટાના આવા અદ્ભુત પ્રયોગનો એક દસ્તાવેજ પુરાવો પ્રગટ થાય છે.

આ પત્રો દ્વારા પૂજ્ય શ્રીમોટાના અનુષ્ઠાનથી તથા સ્વ. બાબુભાઈ તથા એમના પરિવારના સહયોગથી બાબુભાઈની જિંદગી બચાવી લેવાઈ છે. એટલું જ નહિ પણ સ્વ. બાબુભાઈની એ પછીની જિંદગી પ્રભુસ્મરણમાં વળી એ પણ આશ્ર્યજનક ઘટના છે. જન્મ પામનાર દરેકનું મૃત્યુ તો નિશ્ચિત છે, પરંતુ જે અનુભવી પુરુષ સ્થળાતીત અને કાળાતીત અનુભવમાં પ્રતિષ્ઠિત

હોય તે આવા કોઈક નિમિત્તયોગે, કાળને લંબાવી શકવા સમર્થ છે. જોકે આવા પ્રયોગ માટે પણ કેટલીક શરતો છે. આ પત્રો ઉપરથી એ સમજી શકાશે. આથી, સ્વ. બાબુભાઈ તથા એમના પરિવાર ઉપરના પત્રોના આ પુસ્તકનું નામ ‘સમય સાથે સમાધાન’ રાખ્યું છે.

પૂજ્ય શ્રીમોટા પ્રત્યે કોઈ પણ નિમિત્તે રાગ, મોહ, સ્નેહ, ભાવ રાખનાર વ્યક્તિની, તેઓશ્રી કેટલી બધી સંભાળ રાખે છે, એ પણ આ પત્રોમાં બ્યક્ત થઈ છે. કુટુંબમાં સુમેળ કેવી રીતે રહે, વેપારમાં ભાગીદારો સાથે કેવી રીતે વર્તવાથી લાભ થાય, બાળકોની શક્તિની કદર કરવાથી એમનો કેવો વિકાસ થાય વગેરે અનેક ઉપયોગી બાબતો પણ પૂજ્ય શ્રીમોટાએ સમજાવી છે. એ રીતે આ પુસ્તકનું મૂલ્ય પણ નોંધપાત્ર ગણાય.

સ્વ. બાબુભાઈ તમાકુવાળાના ભાઈ શ્રી નટવરભાઈ તથા શ્રી મોહનભાઈએ આ પત્રો જાળવી રાખ્યા અને એના પ્રકાશન માટે સંપાદકને આપ્યા એથી સમાજને લાભ થવાનો છે અને પૂજ્ય શ્રીમોટાના ચાહકોને પણ નામસ્મરણના સામર્થ્યને પામવા માટેનું મોટું બળ મળી રહેશે.

અંતે તો પૂજ્ય શ્રીમોટાનાં લખાણો દ્વારા નામસ્મરણના સાધન સાથે આપણા રોજિંદા જીવનમાં સદ્ગ્રાવ, સુમેળ, ત્યાગ, ઉદારતા કેવી રીતે કેળવાય એ જ આવાં પ્રકાશનોનું સાચું પરિણામ છે.

પૂજ્ય શ્રીમોટાના પ્રગટ વિપુલ પત્રસાહિત્યમાં આ પુસ્તક પણ નોંધપાત્ર ઉમેરણ બને છે.

વલ્લભ વિદ્યાનગર,  
તા. ૧-૮-૧૯૮૩

નંદુભાઈ શાહ

॥ હરિ:ઊ ॥

## નિવેદન

(પ્રથમ આવૃત્તિ)

પૂજ્ય શ્રીમોટાના એક સ્વજન સ્વ. બાબુભાઈ રણછોડલાલ તમાકુવાળાના જીવનમાં જે તબક્કાઓ આવ્યા અમાં પૂજ્ય શ્રીમોટાએ ભાગ લીધો હતો. એમનો જીવનકાળ પ્રભુકૃપાથી લંબાયો અને શેષ ઉત્તરજીવન માત્ર પ્રભુસ્મરણમાં પસાર થયું. આ ઘટનાના અમે સૌ સાક્ષીઓ છીએ.

પૂજ્ય શ્રીમોટાએ સ્વ. શ્રી બાબુભાઈને પત્રો લખેલા. એ પત્રોનું સંપાદન ડૉ. રમેશભાઈ ભણે કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટાના ગ્રંથોના પ્રકાશનમાં અમને એમનો સહકાર મળે છે, એનો અમને આનંદ છે. આ પ્રકાશન માટે અમને આર. ઘેલાભાઈની તમાકુની પેઢી તરફથી આર્થિક સહયોગ મળ્યો છે. અમે એમના ઘણા જ આભારી છીએ.

સ્વ. શ્રી બાબુભાઈના ભાઈઓ શ્રી નટવરભાઈ અને શ્રી મોહનભાઈની પ્રેમભરી માગણીને માન આપીને આ પુસ્તકની પ્રસ્તાવના પૂજ્ય નંદુભાઈએ લખી આપી. અમે પૂજ્ય નંદુભાઈનો હદ્યપૂર્વક ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તકનું મહત્વ એમણે સમજાવ્યું છે. એથી, વિશેષ લખતા નથી. પુસ્તકની પ્રેસનકલ તૈયાર કરી આપવામાં સહાય કરનાર સૌ. માર્ગી ઉર્ફ કોકિલાબહેન મધુસૂદન ભણુના અમો આભારી છીએ.

ગુજરાતી પ્રજા આ પુસ્તકને આવકારશે એવી શ્રદ્ધા છે.

હરિ:ઊ આશ્રમ, સુરત,  
જાન્યુઆરી, ૧૯૯૩

જીણાભાઈ પટેલ  
વ્યવસ્થાપક ટ્રસ્ટી



॥ હરિ:અં ॥

## નિવેદન

(ત્રીજ આવૃત્તિ)

પૂજ્ય શ્રીમોટા રચિત વિપુલ સાહિત્યમાં તેઓશ્રી તરફથી સ્વજનોને પ્રેમપૂર્વક લખાયેલ પત્રોનો સમાવેશ થાય છે.

સુરતના સદ્ગત બાબુભાઈ રણાધોડાસ તમાકુવાળાને પૂજ્ય શ્રીમોટાએ પત્રો લખી તેમના જીવનપંથમાં જે હુંક, સમજણ અને માર્ગદર્શન આપેલાં, તે પૂજ્ય શ્રીમોટાનો શબ્દ ભલે એક સ્વજનના નિમિત્ત વ્યક્ત થયેલો હોય, પરંતુ તે સર્વ સ્વજનોને સ્પર્શી શકે એવી શક્તિ ધરાવતો હોય છે. ઉપરાંત, એ શબ્દને કોઈ કાળની પણ મર્યાદા હોતી નથી. સદ્ગત બાબુભાઈ તમાકુવાળાને લખાયેલ એ પત્રો સને ૧૯૯૭માં ‘સમય સાથે સમાધાન’માં પ્રથમ પ્રકાશિત થયા બાદ સને ૨૦૦૧માં તેનું પુનર્મુદ્રણ થવા પામેલું.

હાલમાં ‘સમય સાથે સમાધાન’ની પ્રતો ઉપલબ્ધ નથી. સ્વજનોમાં આવાં પ્રકાશનોની માંગ રહેતી હોવાથી, તેની ત્રીજ આવૃત્તિનું પ્રકાશન કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્ગતભાવથી અને ચોક્સાઈપૂર્વક શ્રી જ્યંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઈટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને સદ્ગતભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

અગાઉની આવૃત્તિઓની જેમ આ ત્રીજ આવૃત્તિને સ્વજનો આવકારશે એવી આશા છે.

તા. ૨૫-૧૨-૨૦૦૮

નાતાલ

ટ્રસ્ટી મંડળ,

હરિ:અં આશ્રમ, સુરત

## અનુક્રમ

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
સ્મરણયજ્ઞ	૨૭	સ્મરણની શક્તિ	૫૪
પોતાના ખર્ચ યજ્ઞ	૩૦	અવગુણ ટાળવા	૫૫
સ્મરણમહિમા	૩૦	દંપતીવહેવાર	૫૬
સ્મરણ સંગાથ	૩૩	સદ્ગ્રાવભર્યું વર્તન	૫૬
શરીરની જીગવણી	૩૩	જન્મદિન	૫૭
કર્મ સાથે સ્મરણ	૩૪	પુરુષાર્થ	૫૮
આશ્રમની સેવા	૩૪	પ્રકૃતિ	૫૮
ભાવનો ઉપયોગ	૩૫	મુક્ત થવાની રીત	૬૦
‘હરિઃઊં’નો અર્થ	૩૬	કુદુંબભાવના	૬૧
બ્રહ્મચર્ય	૩૭	બેદરકારી સામે રોષ	૬૧
આશ્રમસેવા	૩૮	સંસારમાં વિવેક	૬૨
સદ્ગુરુની સન્મુખતા	૩૮	લોભ સામે સાવધાન	૬૨
દિલના આકર્ષણ માટે કીમિયા	૪૦	સ્મરણ સાથે જરૂરી બાબતો	૬૩
પરિશ્રમનું પરિણામ	૪૧	શુદ્ધિનો યજ્ઞ	૬૩
વહેવારમાં ખપનું સૂત્ર	૪૩	આશ્રમ પ્રત્યેનું દિલ	૬૪
મુક્તાત્માનું તાદાત્મ્ય	૪૩	દોસ્તીનો હેતુ	૬૫
આશ્રમ જવાનો હેતુ	૪૪	મૌનનો આરંભ	૬૬
બાળકોને પ્રોત્સાહન	૪૫	જોવા જેવી ફિલ્મ	૬૭
પત્ની સાથે વહેવાર	૪૬	નિશ્ચયનું બળ	૬૮
શરીરની સંભાળ	૪૭	ભાવનાનાં લક્ષ્ય	૬૯
માંદાની સંભાળ	૪૮	સ્વજન સાથે શ્રીમોટાનું વર્તન	૬૯
કુબેરદાસને અંજલિ	૪૮	જીવલેણ રોગ	૭૦
સહકારનું મહત્વ	૫૧	મૌન લેનારની સેવા	૭૧
નારીભાવના	૫૨	વહેમો સામે સાવધાન	૭૧
સુમેળભાવના	૫૩	સન્મુખતા	૭૨

વિષય	પૃષ્ઠ	વિષય	પૃષ્ઠ
ગાટકની મર્યાદા	૭૩	પ્રભુકૃપાનાં દર્શન	૮૫
શ્રીમોટાનું અનુષ્ઠાન	૭૩	શ્રીમોટા પ્રત્યે ભાવ	૮૬
ગંભીર રોગનો સામનો	૭૫	જન્મદિનની ઉજવણી	૮૭
કટોકટીનો કાળ	૭૫	ડોક્ટરની સલાહ પ્રમાણે વર્તન	૮૮
કટોકટીમાંથી બહાર	૭૮	શરીરની કાળજી	૮૯
શરીરજીવનને ટકાવવા	૭૮	હમણાં મૌનએકાંત નહિ	૯૦
સહકારની જરૂર	૮૧	વહેવાર વ્યવસ્થા	૯૧
સ્વજન સાથે એકરૂપ	૮૨	'મળ્યાં'નો હેતુ	૯૩
નિરાશામાં આશા	૮૩	પ્રેમી તરફથી સ્વતંત્રતા	૯૫
બીમારની સારવારકળા	૮૪	સાજા થયા પછી સંભાળ	૯૫



# સમય સાથે સમાધાન



પૂજ્ય શ્રીમોટા

‘હું સર્વત્ર વિદ્યમાન છું.’

- શ્રીમોટા

‘જીવનદર્શન’, ૧૦મી આ., પૃ. ૩૮૨

મિશ ભાઈ,

તા. ૪-૧૦-૧૮૫૫

હરિસ્મરણ પળેપળ ચાલતું રહે ત્યારે જ જીવનનું નવું કામ શરૂ થઈ શકે. હરિસ્મરણ કરતાં કરતાં રોમેરોમ આનંદ પ્રગટે ત્યારે જીવનની કંઈક અંશે કૃતાર્થતા અનુભવાય. માટે, ‘હરિ:ઓ’ લલકાર્યા કરજો. જીવનમાં મનુષ્યદેહ મળ્યો છે, તેવું જીવન દેવોને પણ દુર્લભ છે. માટે, તેને સાર્થક કરજો. જગ્યાતિ રાખ્યા વિના, ચિંતા અને સાવચેતી ને સાવધાની રાખ્યા વિના કશું બનવાનું નથી. માટે, ચેતી ચેતીને હરિનું નામ લેજો. એ વિનાનો અમારો સંબંધ નકામો છે. અમારે તો પ્રભુકૃપાથી અમારા વડે કોઈ બીજો ભગવાનનું નામ લેતો થાય ત્યારે અમને સખ વળે. ચિંતાનું કારણ ઉપજે તેમ છતાં પણ ભગવાનને પ્રાર્થના કરી આપણે હરિસ્મરણમાં જ મસ્ત રહેવું. આશ્રમના ફાળામાં કંઈક રકમ ઉમેરાય તે કાજે તમે બધા ભીજુભાઈને મદદ કરતા રહેજો. આ જીવ પ્રખ્યાતિમાં નથી. મારું કામ તો તમારા જેવાના આધાર પર છે. માટે, તમે એ બાબતમાં તમારા મિત્રમંડળ અને ઓળખીતા પાળખીતા વગેરે બધાં આ કામમાં જેટલી સહાય કરશો, તે પ્રભુકૃપા છે.

તમારું સ્મરણ મને થાય જ છે. તમારાં આંસુ ભૂલી શક્યો નથી, તો તમારો ભાવ તો ભુલાય જ કેમ? ભગવાનનું નામ લેતાં લેતાં તમને જે આંસુ આવેલાં, તે જોઈને મને તો એમ થયેલું કે તમે હરિનું સ્મરણ એકધારું સતત ચલાવ્યા જ કરશો. નામસ્મરણ સર્વ યજના કરતાં ચઢિયાતો છે. સાધુ-સંન્યાસીઓ અને મહાત્માલોક એક એક યજન કરવા પાછળ

દસદસ હજાર, વીસવીસ હજાર ને ગ્રીસગ્રીસ હજારની રકમ ખર્ચે છે. આ યજ્ઞ એવો છે કે પૈસાનો ખર્ચ થયા વિના આ યજ્ઞ થઈ શકે છે, અને તે યજ્ઞ ઉત્તમમાં ઉત્તમ છે. ને એનું ફળ અમૃત છે. હરિનું સ્મરણ જેટલું ભક્તિથી, ભાવનાથી, જ્ઞાનપૂર્વક કરશો તેટલી મજા આપણાને છે. ત્યાં તમારાં બધાંની મદદ મળ્યા વિના મારાથી કશું ના થઈ શકે. સુરતમાં ભાવના છે. આ જીવ પ્રભુકૃપાથી જેવો છે તેવો છે. એની સમજણ શક્તિ અને જ્ઞાનની શક્તિ વિશે મારે મોઢે કહેવું અજુગતું લાગે, પણ મારાં લખેલાં પુસ્તકો વાંચે તો તેની સમજણ પડે તેવું છે. તમે બધા શુભેચ્છકો અને મિત્રો ભગવાન કૃપાએ મદદ કરો તો જ ત્યાંનું કામ બની શકે. ભગવાનની કૃપા હશે તો બનવાનું. □

તા. ૧૮-૧૦-૧૯૮૫

મૌનમંદિર જેમ બને તેમ જલદી બને એમ સૌ ઈચ્છે છે, પરંતુ ભાઈ ! મારી કને પૈસા નથી. મંદિર બંધાય એટલા પૈસાની સગવડ થયા વિના હું કદી કામ શરૂ કરવાનો નથી તે જાણશો, કારણ કે પૈસા ખૂટે તો મારે ક્યાંથી લાવવા ? માટે, જેમની જેમની એમ ઈચ્છા હોય, તે બધાં જો મને મદદ કરે, તો હું તો તૈયાર જ છું. ભગવાનનું સતત સ્મરણ કર્યા કરજો. તમારા હંદયની ભાવનાનો ઉપયોગ એના સ્મરણમાં કરશો તો સાચા ધનવાન થશો. □

નિર્યાદ,

પ્રિય ભાઈ,

તા. ૭-૧૨-૧૯૮૫

ડાબી આંખનો મોતિયો નવરાત્રીમાં તા. ૧૭-૧૨-૧૯૮૫ને દિને કઢાવાનું રાખ્યું છે, તે જાણ્યું છે. ડૉ. હીરાલાલ આંખના

ખાસ નિષ્ણાત હશે એમ માનું છું. પેલા હકીમ કરતાં દાકતર કને તમે નસ્તર કરાવવાનું રાખ્યું છે, જે મને વિશેષ ગમ્યું છે. મોટે ભાગે તો મોતિયાનું નસ્તર સરળ થાય છે.

ભગવાનનું સ્મરણ કર્યા કરશો, તેના ઉપર ભરોસો રાખજો. તમારી પ્રકૃતિને લીધે ભક્તિમાર્ગમાં ચિત્ત ચોંટ્યું નથી, તે બરાબર નથી. દિલ હોય તો માળવે પણ જવાય. આપણને બરોબર દિલ થયું હોય, તો કરવા ધાર્યું હોય તે જરૂર કરી શકીએ. તામસ પ્રકૃતિને લીધે પ્રમાદ અને આળસ ઘણાં રહ્યા કરે ને કંઈ કશું કરવાની પ્રવૃત્તિ ના બને. કરાવે તોપણ જાણો કે ઠેરના ઠેર. આવું હોવા છતાં જો આપણે ભગવાનનું સ્મરણ કરવું હોય, તો કરી શકીએ છીએ. માટે, હિંમત રાખજો. મોતિયાનું ઓપરેશન એ તો હવે ઘણી રમતની હકીકત બની ગયેલી છે. સોએ અંશી પંચાશી ટકા મોતિયાનાં ઓપરેશન સફળ થાય છે. તેમ આપણું પણ થવાનું. માટે, કોઈ જાતની ચિંતા કરશો નહિ. □

કતાર ગામ,

તા. ૨૭-૧૨-૧૯૮૫૫

તમે સોમવારે તા. ૨૭-૧૨-૧૯૮૫૫ સુરત ગામ જવાના છો, તે જાણ્યું છે. નડિયાદ આશ્રમમાં કવિવર ટાગોરના ભક્ત પ્રોફેસર શ્રી ગુરુદયાલ મહિલકજી પધારવાના હોવાથી આવતી કાલે સવારે છની ગાડીમાં નડિયાદ જાઉં છું. તમને મળી શકાયું નથી, તે માટે દિલસોજી છું. પ્રભુકૃપાથી આંખે સારું દેખાતું થઈ જવાનું. હમણાં તે આંખને શ્રમ ન પડે તેમ કરશોજી. તે આંખથી જોવાનું વારંવાર હમણાં તો ન જ કરવું. કેમ રહે છે, તેનો જવાબ કૃપા કરીને લખવા વિનંતી છે. □

પોતાના ખર્ચે યજા

તા. ૩૧-૩-૧૯૫૬

મારાથી તમને નવી દસ્તિ મળી છે એમ તમે લખો છો તે ભલે સાચું હોય, પણ હું તો કશું જ નથી. જે તે બધી ભગવાનની કૃપા છે. ભગવાનનું સ્મરણ કરતા રહીએ અને તે સતત થયા કરે તો આપોઆપ બધું ઠેકાણું પડ્યા કરે.

આંખને ઠરતાં હજ વાર લાગશે. એટલે તાપમાં બહુ ન ફરવું તે વાત સાચી છે. આશ્રમના ફાળાની રકમને માટે જેટલું મદદમાં અવાય તેટલું ખપમાં લાગજો. મૌનમાં બેસવાની તમારાથી સગવડ થાય તો જ તેમ કરજો. કુરુક્ષેત્રમાં જમવા કરવાની વ્યવસ્થા ઊભી થાય અથવા તો આપણા પોતાના તરફથી થઈ શકે અથવા તો કુરુક્ષેત્રમાં જે કોઈ રહેતા હોય તે જો આપણા માટે પ્રેમથી કરી શકે તે આપણે જેટલો વખત રહીએ, જમીએ તેનું યોગ્ય વળતર જો તેમને આપી શકીએ અને જો તે રકમ તે રાજ્યભૂશીથી લે, તો જ ત્યાં મૌન લઈ શકાય. એ તો જપયજ્ઞ છે. એકવીસ દિવસનો જપયજ્ઞ એ કંઈ નાનોસ્ફુનો પ્રયોગ નથી. અને એવો યજા તો પોતાને ખર્ચે થાય. એટલે તમે તે વિચારીને તેની સગવડમાં રહેજો. હરિસ્મરણ ઘણું ઘણું કરતા રહેજો. એમાં હજ ઘણી ઘણી ખોટ પડે છે. સાચો વેપારી ખોટ ન પડવા દે. ખોટ ટાળવાનો સતત પ્રયત્ન કર્યા કરે. માટે, આપણે જો વેપારી હોઈએ તો ખોટમાંથી તો ઊગરી જવું જોઈએ. લક્ષ્ય રાખીને, કાળજી રાખીને હરિસ્મરણનો વેપાર કર્યા કરજો. એ જ સાચામાં સાચો અને મોટામાં મોટો વેપાર છે. □

સ્મરણમહિમા

તા. ૬-૪-૧૯૫૬

કુરુક્ષેત્રમાં તમારો વિચાર મૌનમાં બેસવાનો છે, તે ઘણું ઉત્તમ છે. વેપારના સંજોગો ઠીક નથી રહેતા અને સંસારની

બીજુ મુશ્કેલીઓના વિચારોની આંધી આવે છે ત્યારે તમારું મન અસ્વસ્થ થઈ જાય છે અને સ્થિરતા જળવાતી નથી. તેવી વેળાએ હરિસ્મરણ મનને સ્થિર કરવામાં મદદ કરે છે. અને કોઈના તરફથી મળતી પ્રેરણા તેમાં ટકાવી રાખે છે, એ હકીકત આનંદપ્રેરક છે. હરિસ્મરણ જો સાચું રાખ્યા કરશો અને જો પ્રાર્થના કર્યા કરશો તો હિંમત હારી નહિ જવાય. પૂરી ધીરજ રહેશે અને ધરપત પણ રહેશે. વેપારનાં કામમાં અને સંસારનાં કામમાં પણ હરિસ્મરણ હે પૂરશે. ભગવાનનું નામ લેનારને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવેલી છે, ને તેમાંથી તે તરીને પાર થયેલા છે. એવી હકીકતો આપણે જાણેલી છે. હરિસ્મરણ એ તો આંધળાની લાકડી છે. જ્યાં કંઈ કશું દેખાતું ન હોય, ત્યાં તે આપણો ધ્રુવતારો છે. હરિસ્મરણ જે કરે છે અને વળી જે હદ્યના ભાવથી કરે છે, તેને કંઈ કશું ડગાવી શકતું નથી. જેને સમર્થ ધણીનો આશરો છે, તેને પછી રૂ શો? માટે, ભગવાનનો ભરોસો રાખીને એનું જ્ઞાનભક્તિ-પૂર્વકનું શરણું સ્વીકારીને એ જેમ વર્તાવે તેમ વર્તાએ.

શ્રીભગવાનનો આપણા ઉપર થતો કોધ અથવા એની બીજુ કોઈ લાગણી તે આપણા જેવા જીવપ્રકારનાં નથી હોતાં. રામને હાથે રાવણ મર્યો તોપણ રામના હાથના મરણથી એનું કલ્યાણ થયું. એટલે ભગવાનનું જે તે બધું પ્રેમભક્તિથી સ્વીકારવામાં માનવીનામાં મદદનિંબીની જરૂર રહે છે. પરિશ્રમથી ભરપૂર એવી મદદનિંબીની જરૂર છે. એનું મોકલેલું જે જીવ ખરેખરી ભક્તિથી, પ્રેમથી, અંતરના ઉમળકાથી વધાવીને તે ભોગવવામાં જે લગારે દુઃખ લગાડતો નથી, એટલું જ નહિ પણ જીવનને યોગ્ય રીતે ઘડવામાં તે જ સાચું મોટામાં મોટું હથિયાર છે,

એમ માનીને તે ભોગવવામાં રાજુરાજુ થાય છે, તેઓ શ્રીભગવાનની કૃપાને પામે છે. શ્રીભગવાનની કૃપા એવી રેઢી પડી નથી, ને એમ ને એમ મળી પણ જતી નથી. સંસારવહેવારમાં પણ આપણે જે કોઈની કનેથી કંઈક મેળવવું હોય છે, તો તેને માટે આપણે ઘસાવું પડે છે. એ તો અનુભવની વાત છે. માટે, કૃપા કરીને હરિસ્મરણમાં ભસ્તી અનુભવો ને હાલતાં ચાલતાં, ખાતાં પીતાં, સકળ કામ કરતાં કરતાં હરિસ્મરણ કર્યા કરો. □

તા. ૩૧-૫-૧૮૫૬

ભગવાનનું નામસ્મરણ ગંગાના પ્રવાહની પેઢે સળંગ ચાલ્યા કરે ત્યારે જ તેનો ફાયદો જણાય. કલાક, અડધો કલાક કે બે કલાક નામ લીધેથી કશું ના વળે. આપણામાં કહેવત છે કે જેટલો ગોળ ઘાલ્યો એટલું ગળ્યું થાય, પરંતુ તે કહેવત નામસ્મરણમાં લાગુ પડતી નથી. જેમ વેપારમાં લાભ મેળવવો હોય છે, તો આખો વખત તેમાં ધ્યાન આપવું પડે છે. દિવસમાં પા-અડધો કલાક વેપાર કરીએ તો દેવાળું નીકળે. વેપાર ચલાવીએ તો વેપારમાં ધ્યાન આપ્યે જ છૂટકો. એવી રીતે જો ભગવાનના નામનો વેપાર આપણે ચલાવવો હોય તો અડધુંપડધું કર્યે નહિ પાલવે. ભગવાન તો દાનત પારખનારો છે. નેકદિલી, સંચાઈ, પ્રમાણિકતા, વફાદારી, ભગવાન પરત્વે આપણાં કેટકેટલાં છે ને તે બધાંની તે કસોટી પાકી કરવાનો. એક પૈસો પણ કોઈ આપણને એમ ને એમ આપી દેતો નથી. આપણે ભગવાનને વહાલા થઈ પડીએ તેવા જો આપણે થઈએ તો ભગવાન આપણો જ છે. જે આપણને ઘણામાં ઘણું વહાલું હોય તેનું મનનચિંતન ને તેની ધારણા આપણા દિલમાં રહ્યા કરે છે, તેવી રીતે આપણા

દિલમાં ભગવાનની ધારણા આઠે પહોર જીવતી રહ્યા કરે, તો તેવું નામસ્મરણ ખપમાં લાગે છે. નામસ્મરણમાં જેમ જેમ સળંગતા પ્રગટશે તેમ તેમ મનની ચંચળતા હઠી જવાની. મન ચંચળ થાય ત્યારે પ્રાર્થના કરવી. સદ્ગુરુની કૃપા મદદ માગવી. ગુંચવાડો થાય, મૂંજવા થાય, મુશ્કેલી આવે, તો તેવી વેળાએ ભગવાનને પ્રાર્થના કરવાનું ચૂકવું નહિ. હરિસ્મરણ કરતા રહેશોજુ. □

### સ્મરણ સંગાથ

મદ્રાસ-૧

તા. ૨૩-૬-૧૯૫૬

હરિમાં ભરોસો રાખવો. એનું સ્મરણ એ ઘણી મોટી વાત છે. એ તો લેવું હોય તેવું દિલ હોય તો લઈ શકાય છે. માટે, એ તો મથી મથીને લેવું જ. બીજું ગમે તે કર્યા કરો પણ એને કદી પણ ન છોડો. મથી મથીને પણ એનો સંગાથ રાખો ને રાખો જ. □

તા. ૨૭-૭-૧૯૫૬

તમે ગુરુપૂર્ણિમા પર આશ્રમ જઈ આવ્યા, તે હકીકત જાણી છે. હરિસ્મરણમાં પરાક્રમ દાખવવું. જેને હરિસ્મરણમાં ચિત્ત ચોંટ્યું તેને સંસારના વિચારો આવી શકવાના નથી. ને તે વળી પણ કેમ કરી શકે? હરિસ્મરણમાં દિલ લાગવાથી વેપારનું કામ પણ જરૂર સારી રીતે થઈ શકવાનું છે. વેપાર વહેવારમાં શુદ્ધિ પ્રગટવાની, સાઝ દિલ, નેક દાનત પ્રગટવાની ને દિલમાં એક બહાર પ્રગટવાની. તેથી, ભૂલો તો કદી પછી થવાની જ નહિ. હરિસ્મરણથી જીવનનું કશું બગડી જવાનું નથી, તે જાણશો. □

### શરીરની જાળવણી

તા. ૮-૮-૧૯૫૬

તમારા શરીરની બધી હકીકત જાણી છે. શરીરના આવી જતના રોગની બાબતમાં સંપૂર્ણ આરામ-મનની શાંતિ,

પ્રસન્નચિત્તતા, નિશ્ચિત્તતા, નિરાંત આ બધું જેટલું વધુમાં વધુ રહે તેટલું શરીર વધુ સારી રીતે બેહું થાય. કોઈ પણ જાતની ફિકર ચિંતા ન હોય અને જે તે બધું સરળતાવાનું હોય અને દિલ આનંદમાં રહ્યા કરે તો ઘણો સારો ફેર પડી શકે છે. તેથી, આવા રોગવાળા શરીરની આગળપાછળના જીવોએ પણ તેને આનંદ શાંતિ મળે, ઉત્સાહ મળે, એવી રીતે વર્તવું જોઈશે. અને એવી રીતે વાતો પણ કરવી જોઈએ. વધારે તો મારે કશું લખવાનું ન હોય.

□

### કર્મ સાથે સ્મરણ

તા. ૨૮-૮-૧૯૫૬

કુરુક્ષેત્રમાં ભાદરવા વદ ચોથના દિને તમે સૌ કુરુક્ષેત્રમાં ગયેલા ને હરિસ્મરણ કરેલું તેવી રીતે અવારનવાર જતા રહેશો. આપણે તો સંસારવહેવારમાં છીએ અને વેપારની પ્રવૃત્તિમાં છીએ એટલે ઊંચીનીચી ગડમથલ તો થતી રહેવાની. દરેકને કોઈ ને કોઈ જાતની ગડમથલ તો હોય છે જ, તેમ છતાં આપણે શાંતિ પ્રસન્નતા રાખવાં ઘટે. મથતાં મથતાં આખરે સિદ્ધિને વરી શકાય છે. હરિ પર ભરોસો અને વિશ્વાસ રાખતાં શીખીએ. અને જે કામ મળ્યું હોય તેને ઉત્તમમાં ઉત્તમ રીતે કરતાં કરતાં હરિસ્મરણ કરીએ.

### આશ્રમની સેવા

તા. ૧૧-૧૨-૧૯૫૬

કુરુક્ષેત્રમાં હરિઃॐ આશ્રમમાં અત્યાર સુધી મળીને ૨૭,૦૦૦ ઉપરાંત ખર્ચ થનારું છે અને ૨૫-૨૬ હજારની રકમ ઉધરાવેલી છે, એમાં તમારે બધાંએ ભેગાં મળીને વધુ મહેનત કરવી પડશે. હજી તો ૫-૭ હજારનું કામ બાકી રહેલું છે. માટે, ભગવાનની કૂપાથી મદદ કરજો. એક માળના ઓરડાના પથ્થરની રકમ તમે આપવાનું કર્યું, તે ઘણું ઉત્તમ

કર્યુ છે. બંને મૌનમંદિરમાં પથ્થર જડવાના છે. માટે, એવી રીતે કોઈ કોઈ કનેથી મદદ અપાવતા રહેજો. તમારા હાથે જરૂર આ શુભ કામ થઈ શકવાનું છે, તે નક્કી જાણશો. તમને મને ભગવાને અમાનત-ભેટ આપેલા છે. માટે, તમે આમાં જરા દિલ રાખીને જેટલું કરશો તેટલું ફળવાનું. □

તા. ૨૦-૧૨-૧૯૫૬

તમે જો મન પર લો તો તમારાથી આશ્રમના ફળા માટેનું કામ ઘણું થઈ શકે તેવું છે. જો બોજરૂપ તે લાગે તો તો તે મુદ્દલે ન કરવું. પ્રેમથી ને ઉમળકાથી થાય તો તે મદદ કરનારું નીવડી શકે. આપણે બધાંએ ભેગાં મળીને આ કામ પ્રભુકૃપાએ પાર ઉતારવાનું છે. તમારામાં જે કુનેહ છે તેનો ઉપયોગ ને તેનો લાભ અમને મળે તે કેટલું બધું ઉત્તમ ! તમારી સાથે હજુ હદ્યનો ઘરોબો વધુ થાય એવું પ્રભુકૃપાથી હું તો માગું છું. હરિસ્મરણ જેટલું વધુમાં વધુ થાય તો વિશેષ ઊંડા પણ ઉતરી શકાય. એનાથી શાંતિ પણ ઘણી મળ્યાં કરે. હરિસ્મરણ વધુ ને વધુ કર્યા કરજો. □

ભાવનો ઉપયોગ

તા. ૧૫-૧-૧૯૫૭

તમારો ભાવ પ્રભુકૃપાથી આ જીવ સાથે વધારે થાય છે, પરંતુ તે ભાવનો સદ્ગુપ્યોગ જીવનનું ઘડતર સારી રીતે થાય તેમાં વાપર્યા કરવાનો છે. ભગવાનનું નામ સ્મર્યા કરજો. જીવનમાં સચ્ચાઈ પ્રગટે, આપણી પ્રમાણિકતાની અસર જીવનમાં ઊંડી ને ઊંડી તે તે આપણાં કાર્યમાં પણ પ્રગટે ને એ રીતે બીજાની ઉપર જે અસર થવાની હોય તે થાય. આપણા કુટુંબમાં બધા ભાઈઓ વચ્ચે દિલનો સદ્ગુલાવ કેળવાતો રહે અને સંપ જળવાય અને તેમાં કરીરૂપ બનો

એવી મારા દિલની ખ્વાહેશ છે. તમારામાં ભાવના છે, ઉત્સાહ છે અને ભગવાનના માર્ગ જવા માટે હાલમાં જે પ્રવૃત્તિ ઉપાડેલી છે, તેને જો સિંચન મળ્યાં કરે તો તે પ્રકારનો અભ્યાસ વધુ ને વધુ થાય, તો સાચેસાચ તમે બધાંને ખરા ખપના નીવડી શકો. આપણા કુટુંબમાં ભાઈઓના ને ભાગીદારોમાં તમે પ્રેરણારૂપ બનો, તો તમારી મદદ આ બધાં કામમાં લઈ શકાય. પ્રભુકૃપાથી તો મને ઘણું મળે-આપણાં બધાં કુટુંબીઓને મળીને મને પણ આનંદ થયો હતો. ભાઈ નટવરભાઈને ખાસ કહેજો કે તેમણે મને પૂછ્યું હતું તેથી હું રાજી થયો હતો. અને મારી સાથે નામસ્મરણ કરે તો જ સંબંધ થઈ શકે, કે રહી શકે એવું કશું નથી. મને તો જે કોઈ જીવ પ્રભુકૃપાથી મળે તેની સાથે દોસ્તી કરવાનું દિલ થાય છે. નટવરભાઈ મારી સાથે દોસ્તી કરે એવી મારી જરૂરથી તેમને વિનંતી કરશો. □

‘હરિઃઊ’નો અર્થ

તા. ૨૧-૧-૧૯૫૭

આપણા મિત્ર શ્રી બાબુભાઈ જમનાદાસ તમાકુવાળા મને જણાવે છે કે તમો હરિઃઊ મંત્રોચ્ચારનો વિચાર કરતા પહેલાં, તે શબ્દનો વિચાર અને તેમાં રહેલા ગર્ભિત તેમ જ સૂચક અર્થો પૂર્ણ રીતે સમજ લેવાનું તેમને ગમશે. તમારી જિજ્ઞાસાવૃત્તિ અને તેની પાછળ રહેલા હેતુ તેમ જ સૂચન સમજ્યા વગર કંઈ પણ ન કરવું, એ તમારી ઈચ્છા જાણીને હું ખરેખર ઘણો આનંદિત થયો છું. ખાતરીપૂર્વક જ આ વૃત્તિ છે કે જે ઈશ્વરના અન્વેષણમાં હોવી જોઈએ.

હરિઃઊની બાબતમાં કહેવાનું કે આ મંત્ર બહુ જ પ્રાચીન કાળથી પવિત્ર ઉપયોગયુક્ત આચરણો વડે શુદ્ધ થયેલો છે.

સૌથી પુરાણા મંત્રોમાંનો આ એક છે, કારણ કે વૈદિક સાહિત્યમાં પણ આનો ઉલ્લેખ થયો છે. તેમાં જ બધું સમાયેલું છે. તેનો અહીં વિસ્તાર કરવો અશક્ય છે, પણ એનો અર્થ ઈશ્વર થાય. શબ્દની દાણિએ એનો અર્થ ‘એક’ થાય, ‘તે’ જે હરણ કરે છે તે, કે જે આપણો ભૌતિક સ્વભાવ હરણ કરે છે. અને આપણી અશુદ્ધ ધાતુનું સુવર્ણમાં પરિવર્તન કરે છે. વળી, એનો અર્થ ‘તે’ ‘એક’ પણ થાય છે. કે જે આપણાં હદ્યો પોતાની પ્રત્યે આકર્ષે છે અને બેંચે છે. આ એક શબ્દ (ઝે) છે. (જો હું બરાબર રીતે આ શબ્દ સમજ્યો હો(ઉં)) કે જેમાંથી સૂચિનો આરંભ થાય છે. ગતિ છે અને જેમાં સમાઈ જાય છે. ‘હરિઃઝે’ એ પરિપૂર્ણ (શાંતિ) સંબંધી (પ્રવૃત્તિ) અને ફરીથી પરિપૂર્ણ (શાંતિ)નું પ્રતીક છે.

વળી, બધું ઉચ્ચારણ ગ્રણ સ્થાનેથી બોલાય છે. નાભિ, કંઠ અને બ્રહ્માંધ એટલે સહસ્ર પાંખડીઓવાળું કમળનું ફૂલ કે જે માથાના મધ્યભાગમાં છે. આ મંત્ર આ બધાં કેંદ્રોને સ્પર્શ છે અને આ બધાં સ્થાનેથી ઉચ્ચારાય છે. મને વિશ્વાસ છે કે આ તમારું સમાધાન કરશો. □

**બ્રહ્મચર્ય**

તા. ૧૬-૨-૧૯૮૫૭

ભગવાનના સ્મરણમાં સદાય આનંદમાં રહ્યા કરશો. હાલતાં ચાલતાં, ખાતાં પીતાં, ઊઠતાં બેસતાં, સકળ કંઈ કર્મ કરતાં કરતાં હરિસ્મરણ કર્યા કરવું. આને માટે બ્રહ્મચર્ય ધારું જરૂરનું. બ્રહ્મચર્ય વગર ભગવાનની ધારણા અખંડ ટકી ન શકે. બહેનને માલૂમ થાય જે તમે પણ એમાં હદ્યથી પૂરેપૂરો સાથ આપજો. બીજું શરીરની સુખાકારી પણ એનાથી સારી રહે છે. મન અને તન નીરોગી બને છે. વળી, આ કઠળ કાળમાં છોકરાંની

જવાબદારી કંઈ નાનીસૂની વાત નથી. જેટલી જંજાળ ઓછી તેટલા વધારે સુખી. માટે, દયા કરીને તમે બંને પૂરેપૂરું બ્રહ્મચર્ય પાળજો. કૃપા કરીને કોઈ વાતે ચિંતામાં ન પડવું, ફિકર ન કરવી, મુંજાઈ ન જવું, અકળામણ ન થવા દેવી, સદાય શાંતિ રાખવી, ધીરજ ધરવી અને ભગવાનનું સ્મરણ કર્યા કરવું.

□

ધ્રિય ભાઈ,

તા. ૮-૪-૧૯૫૭

તમારે ને મારે કોઈ પેલા ભવનું સગપણ હશે, તે આ જન્મે ભગવાને આપણો મેળાપ કરાવ્યો છે. તમને જે મારા અંગે સ્વખાં આવ્યાં છે, તે ઘણાં સારાં છે. કોઈને વિશે સ્વખાં આવે ત્યારે એમ જરૂર સમજાય ખરું કે આપણાને તેના માટે કંઈક રાગ થયો છે. હજુ તો ઘણો વધારે વધારે પ્રભુકૃપાથી મારે માટે તમને રાગ થાય, મોહ થાય ત્યારે મને ઘણું ગમે. તમે મને જ દેખતા થઈ જાઓ એવું હું તો ઘણું પ્રભુકૃપાથી ઈચ્છું છું. બ્રહ્મચર્યનું પાલન પ્રભુકૃપાથી બની શકે છે. માનવીનો યત્ન માત્ર ફળદાયી નીવડતો નથી. એનો અર્થ એવો નથી કે તેણે પ્રયત્ન કરવાનો નથી. તમારી પત્નીનો પણ તમારે સાથ છે. એ ઘણા આનંદની વાત છે. આમેય શાસ્ત્રમાં તો બે ફરજંદ થાય એટલે માનવીએ વાનપ્રસ્થ લેવું, પરંતુ આજકાલ તો પોતપોતાની સ્થિતિ સામું પણ જોતું નથી કે બાળકોને ઉપજાવીને તેમનું ભરણપોષણ કેવી રીતે કરી શકીશું ! એનો વિચાર કોઈ કરતું નથી. પોતાનાં બાળકને ઉત્તમમાં ઉત્તમ નાગરિક બનાવવો અને તેનામાં ગુણ અને શક્તિ પ્રગટાવવી, તે પ્રત્યેક માબાપની ફરજ છે. તમે હરિસ્મરણ કરતા રહો છો, તે સારી વાત છે. હજુ તેનો ઘણો અભ્યાસ પાડ્યા કરવાનો છે.

□

## આશ્રમસેવા

તા. ૨૬-૫-૧૯૫૭

સુરતના આશ્રમના રસોડાને માટે બધી ચીજવસ્તુઓ અમુક અમુક પાસેથી નિયમિત મળ્યા કરે, તે માટેની આપણે બધાંએ મળીને ગોઠવણ કરવાની છે. તમે, ભીખુભાઈ, શાતિભાઈ, ચંપકભાઈ, રમણભાઈ વગેરે બધા આશ્રમના પ્રેમીભાઈઓ આશ્રમ પરત્વે તે જે કાંઈ તેવો ભાવ રાખે છે, તે બધા એક દિવસ નક્કી કરી, તે દિવસે બધા ભેગા મળીને તે અંગેનું કંઈક ગોઠવો તો ઘણી સરળતા થઈ જાય. આશ્રમનું કામ એ કાંઈ એક જીવનું કામ નથી. આમાં તો આપણે બધાંએ મળીને જે તે કંઈ કરવાનું હોય તે કરવાનું હોય. અમારો આધાર તો જેમ ભગવાન પર છે તેમ તમારા બધા પર છે. સુરતમાં પુરુષોત્તમ માસમાં ૨૧-૨૨ દિવસ જે રહેવાનું થયું, તેમાં ભગવાને કૃપા કરીને તમારી બેટ મને આપેલી છે. તે બેટને હું અણમોલ સમજું છું. જેમ જેમ ભાવનાનું પ્રગટ થવું બનતું જશે તેમ તે ધનદોલત વગેરે પણ ભાવનાને અર્થે છે, તેમ તેનાથી કરીને આપણે ભાવનાને ઘડવાની છે. તમારું વહાલ મને સાંભરી આવે છે. સદાય આનંદમાં રહેશો ને હરિસ્મરણ કર્યા કરશો. □

## સદ્ગુરુની સંમુખતા

તા. ૨૮-૫-૧૯૫૭

તમારાથી મને વધુ ન લખાય તેનો કશો વાંધો નથી, પરંતુ તમારા કાગળની મને ચાહના રહ્યા કરે છે. તેથી, ૧૨-૧૪ દિવસે પણ એકાદ કાગળ તો તમારે મને લખવો જ. કાગળ મળવાથી અને તેનો જવાબ લખતી વખતે તમને તાદેશ્ય કરીને કાગળ લખાવું છું, ત્યારે મને એક પ્રકારનો સંતોષ વળે છે. વળી, આપણને જેને માટે ઘણો ઘણો ભાવ હોય, આદર હોય, ભક્તિ હોય તેને કાગળ લખીએ ત્યારે આપણે તેને મનની

આંખ આગળ ખડા કરીને એટલે કે સમક્ષ કરીને, તેનામાં દિલ પરોવીને તેને લખવાનું રાખવું, ને તેવી રીતે લખવાની રીતથી આપણાને પણ સંતોષ થશે ને આનંદ પ્રગટશે.

વિરુદ્ધમાં પરિણામ આવે ત્યારે ચિત્ત રહેવાનું નથી ને ગમે તેટલા પ્રયત્ન છતાં મનની સ્થિરતા ને પ્રસંન્નતા ટકતાં નથી, પરંતુ એવી વેળાએ આપણા સદ્ગુરુને મનની આંખ આગળ દિલમાં પ્રગટ કરીને તેને પ્રાર્થના કરવી, તેનું સ્મરણ કરવું ને તેને પોકાર પાડવો. આ રીત અજમાવી જોવા જેવી છે. ઘણી ઘણી લાગણીથી તેમ કરવું. એમ અભ્યાસ પડતાં પડતાં ને અભ્યાસ કરતાં કરતાં મનની સ્થિરતા ને પ્રસંન્નતા ટકે છે. જે જે જવાબદારી માથે આવી પડે તેને પ્રેમથી વફાદારીપૂર્વક બજાવવાની જ છે, પરંતુ તે બજાવતી વેળાએ તે કર્મ આપણે પ્રભુપ્રીત્યર્થ કરીએ છીએ એવી ભાવના સેવવાની છે. આપણા કુઠુંબ માટે કે છૈયાંછોકરાં માટે કરીએ છીએ એવી ભાવનાને ટાળવાની છે. □

### દિલના આકર્ષણ માટે કીમિયા

તા. ૪-૬-૧૯૫૭

તમારી આ જીવ પરત્વેની લાગણીને હરિસ્મરણમાં એકતાનતા અને અખંડતા પ્રગટાવો તો તે જ ખરા ઉપયોગમાં નીવડી શકે. જેનામાં આપણો સદ્ભાવ છે, આદર છે અને ભક્તિ છે, તેનું આકર્ષણ આપણાં દિલમાં પ્રગટાવવાને અને કેળવવાને માટે આવી રીતે દિલમાં તેને યાદ કરીને મદદ કર્યા કરીએ, તો મદદ કરવાનો હેતુ ફળીભૂત થઈ શકે. મદદ કરવાની એ તો તેવા જીવ પરત્વે આપણું આકર્ષણ વધારવા, તે માટે તેના પરત્વે આપણી લાગણી, ભાવના વધી તે સાકાર બને અને તે આપણી સાથેની સાંકળ કંઈ કર્મવહેવારના

સંબંધોમાં, વિચારોમાં, લાગણીમાં, સંપર્કમાં જોડાયેલો રહે તે માટે છે. મદદ અને ભેટ કરવાનો અસલનો જે રિવાજ છે, તેનો હેતુ આકર્ષણ પ્રગટાવવાનો ને કેળવવાનો છે. એવા એવા પરત્વેના સકળ કોઈ પ્રકારનાં કર્મમાં તેના પરત્વેનું આકર્ષણ પ્રગટાવવાનો ને કેળવવાનો આપણો હેતુ જીવતોજાગતો રાખવાનો છે, તો તેવું કર્મ આપણને ઉપયોગી નીવડે. એવું દિલનું આકર્ષણ પ્રગટે છે ત્યારે દિલ દિલની એકતા થતી અનુભવાય છે. આકર્ષણ વિનાના સંબંધમાં કશી કોઈ જાતની મીઠાશ અનુભવાતી નથી. માટે, આપણે જે તે વધુ આકર્ષણને માટે કરવાનું છે. તે લક્ષમાં રાખશોજ. □

### પરિશ્રમનું પરિણામ

તા. ૨૫-૬-૧૯૫૭

સદ્ગ્રાવનાપૂર્વક કરેલા પરિશ્રમનું પરિણામ કદી પણ તાત્કાલિક નીપજતું નથી. ઊંચે ચઢવું હંમેશાં અધરું છે. નીચે પડવું તદ્દન સહેલું અને સરળ છે. માટે, સદ્ગ્રાવનાપૂર્વક ઊંચે ચઢવાનો પ્રયત્ન કર્યા જ કરવો. હરિસ્મરણ ચાલુ રહ્યા કરે તેની માથાકૂટમાં જીવવું. બીજું બધું કર્યા કરવું ખરું, પણ ખરેખરું મહત્ત્વ હરિસ્મરણને આપ્યા કરવું. જીવનનું ખરું રહેસ્ય તેમાં રહેલું છે. જેટલો પ્રયત્ન સંસારવહેવારનાં કાર્ય માટે, વેપારનાં કાર્ય માટે તથા સગાંવહાલાંનાં કાર્ય માટે થયા કરે છે, તેનાથી વિશેષ હરિસ્મરણમાં થવો ઘટે. □

તા. ૨૬-૭-૧૯૫૭

તમારો ભાવ યાદ આવે છે. તમને ભગવાને મેળવી આપીને એક ભાઈની ગરજ મને એણે કૃપા કરી સારી છે. તમે મને હજુ બહુ મદદમાં આવવાના છો, પરંતુ તેના કરતાં તો તમારું હરિસ્મરણ એકધારું પ્રગટ્યાં કરે તેવી દક્ષિણા મારે તો ખપે.

તમે એમાં લક્ષ પરોવજો. મારે તો તમારા દિલમાં એક થવું છે. તે વિના જંપ પડવાનો પણ નથી. □

tl. ૨-૮-૧૯૫૭

તમારો પ્રેમાળ ને ભાવવાળો કાગળ મળ્યો છે. આપણે ઘેર આટલાં બધાંની માંદગી આવી ગઈ, તે બધી હક્કીકત વાંચી થયું કે તમને કેટલી બધી હેરાનગતિ પહોંચી હશે ! આથી, તમને જ હરિસ્મરણ કર્યા કરવાની ખાસ જરૂર રહે છે. હરિસ્મરણની ભાવનાથી ધીરજ, શાંતિ, સહનશક્તિ, હિંમત, બળ વગેરે બધું મળ્યાં કરતું હોય છે. માટે, કૃપા કરીને તેમાં જ મન ચિત્ત લગાડ્યાં કરવા વિનંતી છે.

હરિસ્મરણમાં એકધારું રટણ હૃદયથી ભાવભર્યું સતત ચાલ્યા કરે છે, તો જ જીવપણું ટળી જાય ને પછી કામ, કોધ, મદ, મસ્તર, મોહ, અહં વગેરે મોળાં પડતાં જતાં હોય છે. કર્મ કર્યા કરીએ તોપણ તેમાં હરિસ્મરણની ભાવના સણંગ જીવતી રહ્યા કરે તેમ મથ્યા કરવું ને મરદની પેઠે જગૂભ્યા કરવાનું છે, તે નક્કી જાણશોજ. □

tl. ૮-૮-૧૯૫૭

સુરતમાં ફરી કોલેરા ફાટી નીકળ્યો છે, તે જાણી નવાઈ લાગી. રાગદ્વેષ મોળા પડ્યા વિના એનામાં લગની લાગવી શક્ય નથી. તોપણ હરિસ્મરણ થતાં થતાં તેમાં જો ગંગધારાવત્ત એકધારું સતત પ્રગટી શકે તો રાગદ્વેષ પણ મોળા પડતા જ જાય. હરિસ્મરણની ભાવનાનું સણંગપણું જાગ્યા વિના પ્રભુની લગની લાગવી શક્ય નથી. માટે, એ તો મથ્યા જ જવું. જીવદશા હોય ત્યાં સુધી બધું જ થવાનું, પણ જો વધુમાં વધુ લક્ષ હરિસ્મરણ થવામાં લાગ્યા કરે, તો કદી છુટકારો થાય ખરો. □

નવીયાદ,

તા. ૨૭-૮-૧૯૫૭

મરણતોલ માંદગી ગઈ. પ્રભુની કૃપા પારાવાર છે. ભાઈ ચૂની મને શરીરની સેવામાં ખરો ખપનો લાગી ગયો. હજ બરાબર ટીક થયું ન ગણાય. ચૂની બેત્રાણ દિવસમાં ત્યાં આવશે. પૂરેપૂરો આરામ જરૂર લઈશ. તમારાં જેવાં વહાલસોયાં સ્વજનને કારણે તેમના પ્રેમે બહુ મદદ કરી છે. □

વહેવારમાં ખપનું સૂત્ર

તા. ૨૭-૮-૧૯૫૭

‘બાળકનું, માંદાનું, બહુ અહંકારીનું, મૂર્ખનું, વિદ્વાનનું, સદ્ગુરુનું, જિદ્ધી સ્ત્રી કે પુરુષ - એ બધાંની ‘હા’ એ ‘હા’ જ કરવી.’ એવું મારા શુરુમહારાજે મને શીખવેલું. એટલે બાળકની બધી બાબતમાં ‘હા’ એ ‘હા’ જ કરવી. ઉપર લખેલું સૂત્ર પણ સમજવા જેવું છે. ને વહેવારમાં તે ઘણું ખપનું ને ઉપયોગનું છે. કેટલાક માનવીને ‘હા’ એ ‘હા’ કરવામાં જાણે સંકોચ થતો હોય છે. માટે, આપણે તે પ્રકારનો કોઈ સંકોચ રાખવો નહિ. એટલે ખીચડી ને શાક વગેરે માગે ત્યારે ‘હા ભાઈ, બનાવી આપીશું, બનાવી આપીશું’ એમ કહેવું, ને તેના દેખતાં બૈરાંને પણ કહેવું કે ‘એને તમે કેમ બનાવી આપતા નથી?’ પણ આપવી નહિ. એને રાજ રાખજો. ત્યાં બેઠાં બેઠાં હરિસ્મરણ કરજો. કોઈ જાતની ચિંતા કરશો નહિ. ચિંતા આપણે ભગવાનને સોંપવી.

મુક્તાત્માનું તાદાત્મ્ય

તા. ૨૮-૮-૧૯૫૭

આ શરીરને વારંવાર થતા જુદા જુદા રોગના હુમલાને મારા એક જૂના મિત્ર જેઓ સાધનાને પંથે વળેલા છે, તેમને તે હકીકતની મનમાં ગોડ બેસતી ન હતી. તેમના દીકરાને

એક વખતે કોઈ પ્રકારની માંદગી થઈ અને એક વખતે તેમની પત્નીને મરડો થયો ત્યારે મને પણ તેમના દીકરાની માંદગી ને તેમનાં પત્નીનો મરડો થયેલો. ભગવાને કૃપા કરીને એ અનુભવ એટલા માટે કરાવ્યો કે ઉચ્ચાત્માના શરીરને આવું જે બધું થતું હોય છે, તે ખરેખરી સાચી ઘટના હોય છે. બાકી, આપણાને કંઈ એવો ઉચ્ચ પ્રકારનો પ્રેમ હજુ પ્રાપ્ત થયો નથી. બીજા જીવના શરીરની માંદગી આવી રીતે કોઈના શરીરમાં પ્રવેશ કરી શકે છે અને તે હકીકત સાચી છે, તેનો અનુભવ તમને થયો, તે ઘણી સારી વાત છે.

તેમાં તમે મને મદદગાર થજો, તે ભગવાનનું નામ લે કે ના લે તેની સાથે કશો સંબંધ નથી. દોસ્તી બાંધવામાં કશી રોકટોક ન હોય. પ્રભુકૃપાથી મેં તો દારૂદિયાની પણ દોસ્તી બાંધેલી છે.

મને તો પ્રભુકૃપાથી જે કોઈ મળે તેની સાથે વહાલ કરવાનું બહુ બહુ દિલ થાય. □

આશ્રમ જવાનો હેતુ

તા. ૩૦-૮-૧૯૫૭

જે કામમાં આપણાને ખરેખરું દિલ હોય, તેવું કામ ગમે તેટલું ભારે હોય, માલવાળું હોય, કંટાળાવાળું હોય, અધુરું હોય, મુશ્કેલ હોય, તોપણ જેનું તેમાં દિલ પ્રગટેલું હોય તેને તેવું બધું કશું જ લાગતું નથી.

કુરુક્ષેત્ર જવાનો હેતુ નામસ્મરણનો છે. તે ધેર રહ્યે રહ્યે પણ બની શકે.

તા. ૧૦-૧૦-૧૯૫૭

બહેન આશ્રમમાં આવેલાં ત્યારે સાંજે બધાંની સાથે નદીમાંથી તે પણ પાણી લાવવા લાગેલાં ને બધા છોડવાને

પાયેલું. તેમની સાથે નંદરબારનાં બીજાં એક બહેન હતાં, તેમણે પણ મદદ કરેલી. સામાન્ય રીતે બૈરાં લોકો આવાં કામમાં ઉમંગથી તૈયાર થતાં હોતાં નથી. તેમની આવી મદદ કરવાની રીતથી રાજી થયો હતો. આપણા આશ્રમમાં વાડી સરસ ઊછરે, તે બાબતમાં આપણે બધાંએ મળીને કાળજી રાખવાની છે. ભાઈ ભીખુભાઈને જે બાબતમાં રસ છે અને તે માટે તેમના જાડા શરીરથી બનતી તે મહેનત પણ કરે છે. અને આશ્રમમાં બીજાં આવેલાંને તેવું કામ કરાવીને તે કહેતા હોય છે. તેથી, કેટલાકને જોકે બરાબર નહિ લાગતું હોય, પરંતુ આવી આશ્રમ જેવી જગ્યાએ આવી બાબતમાં કશું મનમાં આણવાનું ન હોય. ઊલટું આશ્રમનું કામ કરવામાં તપભક્તિ સમજુને હૃદયમાંથી ઉમળકો પ્રગટવો ઘટે. તમે તો અહીં નાદિયાદમાં કેટલું બધું કામ પ્રેમથી કરો છો, તે મેં મારી જાતે જોયું છે. એટલે આ બધું લખાડા તમારે માટે છે. એમ કૃપા કરીને ન સમજશો, પરંતુ આપણા આશ્રમમાં આવનાર બધા ભાઈઓને માટે છે. કોઈ તેવું મનમાં ન લે એવી યોગ્ય સમજણ પ્રગટાવવાને માટે લખેલું છે.

□

બાળકોને પ્રોત્સાહન

તા. ૧૫-૧૦-૧૯૫૭

બેબી પ્રથમ નંબરે પાસ થાય તો મને આનંદ. છોકરાંથી હારી જવામાં તો આનંદનો પાર નથી હોતો ને એને આપવાની રકમ પણ શી મોટી છે ! એકવીસ તે કંઈ વિસાતમાં ગણાય ? માટે, તેને ઉત્સાહ આપજો. ને જે તમારો પુત્ર એક નાનો (મને પંખો નાખતો હતો) જેને પ્રથમ નંબરે આવે તો રૂપિયા પાંચના ઈનામનું કહ્યું છે. તેને પણ ઉત્સાહ આપતા રહેજો. અહીં ઊર્મિલાનું શરીર ઠીક ચાલે છે ને આશ્રમનું ઘણું બધું

કામ કરે છે, પરંતુ તેટલું તે ઘરે પોતાને ત્યાં ન કરી શકે, કારણ કે અહીંનું વાતાવરણ તો તદ્દન મુક્ત ને સ્વતંત્ર. જ્યારે સંસારવહેવારના વાતાવરણમાં તો ગુંગળામણ થાય એવું, આજે તો જ્યાં ત્યાં અનુભવાય છે. એમાં જે શાંતિ ને પ્રસન્નતા રાખીને જીવવાને મથશે તે જીતવાનો છે. સંસાર તો બાકી આપણને ગળી જવાનો જ છે. □

પત્ની સાથે વહેવાર

તા. ૨૩-૧૦-૧૯૫૭

બહેનનો સ્વભાવ મૂળમાં ચીડિયો તો નથી, પરંતુ કામકાજના દબાણને લીધે કરીને તેમ થતું હોય. તમારે તેમની સાથે બહુ જ વહાલથી વર્તવું અને તેમનાથી ગુસ્સે ન થઈ જવાય તે માટે તમારે કાળજી રાખવી. ગાડાનાં પૈડાંમાં દિવેલ પૂરવાથી ચાલવામાં સરળતા પ્રગટે છે, તેમ તમારે તેમને શાંતિ રખાવવામાં મદદગાર થવું. ટીખળ કરીને - વિનોદ કરીને દિવસમાં તેમને વારંવાર હસાવવાં. બેબીને તમે સમજણ પાડી તે ઘણું સારું કર્યું. ભાઈને ભણતરમાં આપણો વારંવાર પૂછ્યા કરવું. એવડાં બાળકોમાં અત્યારના જીવનનો ગાળો રમવાનો ને આનંદ કરવાનો છે. માટે, તેને સમજાવી સમજાવીને થોડો થોડો અભ્યાસ કરાવવામાં પ્રેરાવવો. તેનામાં અમુક પ્રકારના સંસ્કારો છે, નહિતર તો ઘણાં છોકરાં મારી પાસે આવે છે, પરંતુ તે બધાં કંઈ પંખો નાખવા બેસી જતાં નથી. કુરુક્ષેત્રમાં આ વખતે તે મને પંખો નાખતો હતો અને તે પણ કોઈના કલ્યા કરવ્યા વિના, પોતાની મેળે કરતો હતો. તે તમારી જાતે જીયેલી હકીકત છે, પરંતુ તે નાપાસ થાય તે બરાબર નહિ. માટે, તેને ટકોરવાનો આપણો ધર્મ છે, તે જાણજો.

ઘણીવાર આપણા દિલની ભાવના ઉત્તમ હોય, પરંતુ તેનું

પરિણામ ઉત્તમ ન આવે, તેના કારણમાં સામેથી બીજા જીવનો તેનો સ્વીકાર અને તેમાં દિલથી દિલનો સહકાર પૂરેપૂરો ન મળે તેમ પણ બનતું હોય છે. બહેન બેસતા વર્ષથી નિશ્ચય કરે કે ગુસ્સે થવાના કે ચીડ કરવાના ઘણા ઘણા પ્રસંગો મળે તોપણ શાંતિ રાખવી. □

તા. ૨૪-૧૦-૧૯૫૭

તમારી શુભેચ્છાનો કાગળ મળ્યો છે. બધાંની સાથે સમભાવથી સુમેળથી વર્તતાં વર્તતાં સહન કરવું પડે, તો તે તપ ગણવું. કદાચ અન્યાય થતો લાગે તો ઉદારતા દાખવવી, પરંતુ સદ્ગ્રાહ અને સુમેળને જ મહત્વ આપી જવવાનું ને વર્તવાનું છે. □

### શરીરની સંભાળ

તા. ૩-૧૧-૧૯૫૭

રાજકોટમાં મારા એક જૂના મિત્ર કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેમનું શરીર અવસાન પામ્યું. તેમનો તાર આવવાથી મારે રાજકોટ જવું પડેલું. બાબુભાઈને માલૂમ થાય કે જે ડોક્ટરે પોતે તો પોતાનું કામ કર્યું, પરંતુ આપણે ખાટલામાં બિલકુલ હાલ્યા ચાલ્યા વિના સ્વસ્થ પડી રહીશું અને બિલકુલ હાલ્યા ચાલ્યા નહિ કરીએ અને માથું પણ આમતેમ હલાવીશું નહિ, તો આંખોને ઠીક લાભ થવા સંભવ છે. ઓછામાં ઓછા ત્રણચાર દિવસ તો આપણે તેમ કરવું જ જોઈએ. ખાવાની અંદર બને તેટલું સાદું અને પ્રવાહી લેશો કે જેથી પચવામાં વાંધો ન આવે અને દસ્ત વગેરે સરળતાથી થાય. દસેક દિવસ ખાવાપીવામાં સાચવો તો આંખને સારું થવામાં તે બધું મદદગાર થઈ પડે. થોડામાં થોડું ખાવું અને તે પણ પચી જાય તેવું પ્રવાહી રૂપનું. દસ દિવસ જાણે કે ઉપવાસ કર્યા હોય તેમ

માનવું. અને એનાથીયે વધુ જરૂરનું તો એ છે કે મનથી હંમેશાં રાજ્ઞિરાજી, આનંદી આનંદી અને પ્રસન્નચિત્ત રહેવું. જેટલું આનંદી રહેવાય તેટલું વિશેષ ઉત્તમ, પરંતુ જોરથી હસ્તવું કરવું નહિ. □

## માંદાની સંભાળ

તા. ૪-૧૧-૧૯૫૭

બાબુભાઈને કહીએ કે ખાટલામાં પડ્યાં પડ્યાં હરિસ્મરણ કર્યા કરજો. આવો નિરાંતનો લહાવો ફરીથી મળવાનો નથી. નટવરભાઈને અને લલિતાબહેનને વિનંતી કે અમારા બાબુભાઈને આનંદ કરાવજો. ખાવનું જાણું આપશો કરશો નહિ અને પચી જાય તેવું પ્રવાહી આપજો. ભૂખની બહુ બૂમ મારે તો કોઈ ફળનો રસ આપજો. રોજ દસ્ત સાફ ઊતરે તેની કાળજી રાખજો અને તેમના શરીરને હાલમડોલમ ન થવા દેશો. બાબુભાઈને માલૂમ થાય કે થોડાક દિવસ કષ વેઠજો અને માથાને ભૂલેચૂકે પણ આમતેમ ફેરવ્યા કરશો નહિ. ખાવામાં બહુ કાળજી રાખજો. આમાં પેટ જેટલું હળવું હોય તેટલું ઉત્તમ. માટે, કૃપા કરીને હવે પાંચ છ દિવસ સાચવવાના છે. નટવરભાઈને માલૂમ થાય કે તમે વૈદની દવા ચાલુ રાખજો. અને બીજી એક સૂચના છે કે રોજ દસ્ત સાફ આવે તેને માટે સવારમાં વહેલા ઊઠીને રોજ છ આની ભાર હરે લઈ લેવી, ને તેના પર ગરમ પાણી પીવું. અમારા બાબુભાઈને તમે બે જગ્યા થઈને ગમ્મત કરાવજો ને ટોળટપ્પા કરતાં રહેજો. એ બને તેટલા વધારે આનંદમાં રહે તે ઘણું જરૂરનું છે. □

તા. ૬-૧૧-૧૯૫૭

હવે, તમને પડખું ફેરવવાની રજા મળી છે, તે જાણ્યું છે. દાક્તર તો શીરો કે એવું કશું ખાવાનું કહે, પરંતુ પડ્યા

રહેવાનું હોવાથી તે પચે નહિ અને તેથી ગોસ થાય. જો ગોસ થતો હોય તો ઉનું પાણી પીવાનું રાખજો અને વધારે ગોસ થતો હોય તો સોડા પણ પિવાય. ખાવામાં પણ ઓછું ખાવું. હાલમાં વધારે તો નહિ. હરતાં ફરતાં થઈ જાય ત્યારે જે ખાવું હોય તે ખવાય. આવો નિરાંતનો સમય મળ્યો છે અને ખાટલે સૂવાનું છે, તો વધારેમાં વધારે હરિસ્મરણ કરજો. □

તા. ૮-૧૧-૧૯૫૭

ભાઈ બાબુભાઈને માલૂમ થાય કે હજ એક મહિના સુધી કૃપા કરીને તમારે બહુ જાળવવાનું છે. આંખને કોઈ જાતની તકલીફ ન પડે તેમ કરવાનું છે અને મન શાંતિ ને પ્રસન્નતામાં રહે તેવું ખાસ ગોઠવવાનું છે. આંખનો ઉપયોગ ના થાય તેવી રીતે વેપારના કામકાજમાં રસ લેવો. અને આ સૂચના બરાબર તમારે પાળવાની છે. એમાં મીનમેખ ફરક પડવા દેશો નહિ. ને હવે જેમ ભૂખ લાગે તેમ ખાવાનું રાખજો. તોપણ તેલમરચું જેમ ઓછું હોય તેમ સારું. સુરતમાં તેલ-મરચાંનો ઉપયોગ વધારે. માટે, આ ખાસ લઘ્યું છે. પચી શકે તેમ હોય તો ધી પણ હવે લઈ શકાય. આંખે મોતિયાનું ઓપરેશન પૂરેપૂરું સફળ થયું ને દેખી શકાયું છે, તે જાણી રાજી થયો છું. અમારા નટુભાઈ ભલેને તમારા સગાભાઈ રવ્યા પરંતુ તેની સાથે આપણે ખરેખરી દોસ્તી બાંધવાની છે. ભાઈબંધની સાથે જે દિલ ખુલ્લું થાય અને ઉમળકાથી બધી વાતો થાય અને તેવા સંબંધમાં એક પ્રકારનો ઉમળકો પ્રગટે છે, તેવું આપણે તેમની સાથેનો સંબંધ બાંધવાનો છે. □

કુબેરદાસને અંજલિ

તા. ૧૨-૧૧-૧૯૫૭

જત, અહીં નિદ્યાદમાં ગઈકાલે ભાઈ કુબેરદાસ હાર્ટએટેક

થવાથી દેવલોક પામ્યા છે. તેથી, હાલમાં કશું લખી શકું તેમ નથી. આ ૧૫ દિવસમાં ભગવાને મારાં ત્રણ સ્વજનોને બોલાવી લીધાં. એક રાજકોટના વજુભાઈ. બીજા નડિયાદમાં મણિભાઈ. ત્રીજા કુબેરદાસ. ભાઈ કુબેરદાસ વડે તો આશ્રમ ચાલતો હતો. હવે પ્રભુ એની કૃપાથી એવી સગવડ જે અમને અપાવર્ષે તે ખરો. અમારી દેખભાળ, સંભાળ ને કાળજી ભાઈ કુબેરદાસ જેટલી લેતા હતા તેટલું તો અમારાથી પણ બનતું ન હતું.

॥ ૧૮-૧૧-૧૮૫૭

નડિયાદના ભાઈ કુબેરદાસના સ્મરણાર્થે નવું મૌનમંદિર જે થાય છે, તેના કુંભવિધિના પ્રસંગે તમારાથી હાજર અહીં ન રહી શકાય તેનો કશો વાંધો ન હોય. તમારી ભાવના જો તે માટેની હોય, તો તે હાજર રહેવા તુલ્ય છે. તમારી ભાવના પ્રતિદિન વધ્યા કરે અને સદ્ગ્રવૃત્તિમાં તમો મદદગાર વિશેષ ને વિશેષ થાઓ, તો તે જીવનના કલ્યાણની હકીકત છે. જીવનનિર્વાહ માટે પ્રવૃત્તિ તો કરવી જ પડવાની, પરંતુ તે તો નર્યો સ્વાર્થ ગણાય. એટલે જીવનનિર્વાહની પ્રવૃત્તિની સાથે સાથે સદ્ગ્રવૃત્તિની બાબતમાં આપણા પોતાના જીવનનિર્વાહની પ્રવૃત્તિમાંથી જેટલો સમય, જેટલું કામ, જેટલી તકેદારી કાળજી, ઉમંગ, ઉત્સાહ અને સ્વાર્પણ વગેરે બધું રાખીએ છીએ અને તેને પોતાનું જ ગણીએ છીએ, તેવી જ રીતે જો આપણે સદ્ગ્રવૃત્તિમાં પરોવાયેલા રહીએ તો આપણે જીવનના કલ્યાણની બાબતમાં બહુ આગળ વધી શકીએ. માટે, આ હકીકત લક્ષમાં રાખવાની જરૂર છે.

આંખની સંભાળ રાખશો. આંખને મુદ્દલે શ્રમ હમણાં પણ દેશો નહિ. લલિતાબહેનને દિવસમાં કેટલી વાર હસાવો છો

તે લખજો. પતિપત્નીએ હંમેશાં મીઠો વિનોદ કર્યો કરવો જોઈએ કે જેથી તેઓ બંને પરસ્પર હસતાં રહી શકે. કોઈ પણ પ્રકારનો મન પર બોજો પ્રગટવા દેવો નહિ. અને હંમેશાં શાંતિ અને પ્રસન્નતા જળવાયાં કરાય તેમ વર્તવાનું છે. □

સહકારનું મહત્વ

તા. ૨૪-૨-૧૯૫૮

આપણા કુટુંબના બધા ભાઈઓ તથા પેઢીમાં કામ કરનારા બધા એકઠા થયેલા બધાંને મારો આ કાગળ પ્રેમથી વંચાવજે.

આ કાળ કઠણ છે અને મુશ્કેલીવાળો છે. તેથી, પેઢીમાં કામ કરવાવાળા આપણે બધા ભાઈઓ પેઢીનું હિત દિલમાં દફાવીને પેઢીને માટે એકદિલ થઈને ખૂબ ઉત્સાહથી કામ કરીશું અને આપણે બધાં એકબીજા સાથે સુમેળથી, સંપથી ને સદ્ભાવથી વર્તવાનું રાખીને એકબીજાનું આહુંતેહું ભૂલી જઈને બધાંની સાથે ખબેખભો મીલાવીને જો ખરેખરા દિલથી કામ કરીશું તો આપણે ટકી રહીશું. અત્યારનો કાળ એવો છે કે આપણા દિલમાં જો ભંગાણ પડ્યું તો એટલું કામ કથળવાનું એ નક્કી જાણજો. આપણા બધાંના દિલ એક થવાની ઘણી ઘણી જરૂર છે. પેઢીનું હિત કેમ કરીને વધારેમાં વધારે સારી રીતે સચ્ચવાય ને બે પૈસા વધારે રણાય તેમાં જ આપણા બધાંનું દિલ જો લાગેલું રહે, અને પેઢીમાં કામ કરતા આપ સૌ ભાઈઓ કોઈ પ્રકારની હુંસાતુંસીમાં ન પડી જતાં પ્રેમથી સહકાર આપવાનું શીખીશું તો સારી વાત થવાની છે. આટલી મારી ઉપર લખેલી હકીકત આપણે બધા ભાઈઓ પ્રભુકૃપાથી લક્ષમાં રાખીશું તો પ્રભુકૃપાથી પેઢીનું કામ સારું ચાલશે. તમારો થોડોઘણો દાણો પેટમાં પડ્યો છે. એટલે તે દાણો પ્રભુકૃપાથી આમ બોલાવે છે. માટે, કૃપા કરીને મારી આ

લહેલી હકીકતને કાન બહાર કાઢી ન નાખતાં પ્રેમથી દિલમાં  
રાખીને પ્રેમથી વાંચશોજુ. □

(અન્યાસ કરતા બાળમિત્રને)

તા. ૨૪-૬-૧૯૫૮

તારો કાગળ મળ્યો છે. ઘરમાં કોઈ બોલે તે તારાથી સહન  
થતું નથી, ને તને ખૂબ ગુસ્સો આવે છે ને બધાંની સામે થઈ  
જાય છે. આ બધું તેં સાચું લખ્યું તેથી રાજુ થયો છું, પણ  
આપણાથી ગુસ્સો તો ન થાય. ગુસ્સો ન થાય તેવો પ્રયત્ન  
કરતો રહેજે. રોજ બરાબર વાંચજે. કામ જે સૌંપાય તે તો  
કરવું જ જોઈએ. આપણે કામ જો ન કરીએ તો પછી આપણું  
કામ કોણ કરવા આવશે? મારી આબરૂ તો તારા હાથમાં છે.  
હવે તો તું મને તારજે કે બુડાડજે. કૃપા કરીને મારું કહ્યું  
માનજે. ગુસ્સે ન થઈશ ને કોઈના સામું ન થઈ જતો. કામ  
કરજે ને વાંચજે. □

## નારીભાવના

પ્રિય બહેન,

તા. ૧-૭-૧૯૫૮

આજે ગુરુપૂર્ણિમા છે. અમારા ઘરની ને બધાંની તું જ ગુરુ  
છે. તું અમને સાચવે છે ને અમારું પોખણ પણ તું જ કરે છે.  
તું અમારું આહુંઅવળું કશું દિલમાં રાખતી નથી. છોકરાંની  
ભૂલ તો તું જતી કરે, ક્ષમાવાળી છે. સ્ત્રીને ઘરતી કહેલી છે.  
ઘરતી કેટકેટલું સહે છે. છતાં તે ધીરજવાન છે. તેવી રીતે  
અમને તું જોજે. અમે બધાં છોકરાં તો સાવ નાદાન છીએ.  
તારી સામું પણ બોલી નાખીએ છીએ. છતાં તું અમારા પર  
વહાલ કરે છે !

તું એમ ન સમજશ તું એકલી છે. તારી સાથે આ મોટા  
છે જ, તેનું તું સ્મરણ કરજે ને દિલમાં રાખજે તો તને પૂરી

સમજણ પડી જાય ને તને તે અશાંત કે દુઃખી થવા ન હે.  
આનંદમાં રહેજે. □

પ્રિય બહેન,

tl. ૮-૭-૧૯૫૮

તારી બે લીટી વાંચી. આંખમાં આંસુ આવી ગયાં.  
બાબુભાઈની બેટ મને મારા ભગવાને કૃપા કરીને આપી છે.  
એનું વહાલસોયું દિલ તું સમજજે. તારામાં કંઈ જેવી તેવી  
શક્તિ છે એમ ન માનતી. તું કૃપા કરીને ‘તારે માથે કોઈનો  
હાથ નથી’ એમ માનીશ નહિ. કેમ મને બાબુભાઈ વહાલા  
છે તેમ તું પણ છે. તને અટવાયેલી અશાંતિમાં ને કોધમાં  
જોતાં મને શું શું થતું હશે ? કૃપા કરીને જરા શાંતિ રાખજે.  
અશાંત થયા કરવાથી ને ગુસ્સે થવાથી નુકસાન આપણાને  
પોતાને થાય છે. તને વધારે શું લખું ! તને એવું થાય ત્યારે  
તું મોટાનામાં દિલ પરોવજે ને એની પ્રાર્થના કરજે. મોટાનું  
શરીર તે ‘મોટા’ નથી. શરીર તો માત્ર એને દિલમાં પ્રગટાવવા  
માટેનું સાધન છે. બાકી, તારે કદી પણ ગભરાવું નહિ. તું  
એકલી નથી. તો મારી તને પ્રાર્થના છે કે તું મને તારી સાથે  
ને સાથે રાખજે. કોઈ વાતે મનથી દુઃખી ન થઈશ. □

### સુમેળભાવના

(બાલમિત્રને)

tl. ૨૨-૭-૧૯૫૮

મારા વિશે તને સ્વખું આવ્યું તે સારી વાત છે. ભાઈ !  
તું મારો દોસ્તદાર થયો અને તારાથી આંદુંઅવળું થાય તો તો  
મારી લાજ ગઈ ગણાય. મોટાનો દોસ્તદાર થઈને જો તું  
સુધરવાનું જલદી નક્કી ન કરે તો મારાથી બેસી કેમ રહેવાય ?  
મારા પર તારી રજા વિના હું કશું પગલું નહિ લઉં. નિરંજનાને

તું પજવતો નથી ને તેને વહાલ કરે છે, તે જાણીને બહુ રાજુ થયો. વહાલા ભાઈ, તું જો બાને રાજુ રાખે, એને આનંદ આપે તો તો હું ઘણો ઘણો રાજુ થાઉં. અને બાને કેટલું બધું સારું લાગે ! પરંતુ હજુ જોઈએ તેવું તું લેસન કરતો નથી. હવે તું વાડામાં જતો નથી તે ઘણી સારી વાત થઈ. મને તો શ્રદ્ધા છે કે તું જરૂર સુધરવાનો અને સારો થવાનો અને ભણવામાં પણ હોશિયાર થવાનો. □

## અવગુણ ટાળવા

(બાલ મિત્રને)

તા. ૨૮-૭-૧૯૫૮

આપણામાં જે અવગુણ હોય અને કુટેવ હોય, તે જો સુધારીએ નહિ અને સારા થવાને મહેનત ન કરીએ, તો આપણે માણસ ન કહેવાઈએ. હવે, તારામાં કોઈ કુટેવ ન રહી જાય તેની કાળજી રાખજે. નહિતર ઘણા બધા લોકો તારી મશકરી કરશે. તને મેં પેન અપાવી છે, તે એટલા માટે કે ‘મોટા’ તને યાદ આવે અને તેથી તારાથી કશું ખોટું થાય નહિ. તું બહેનો સાથે પ્રેમથી વર્તવાનું લખે છે, એ ઘણી સારી વાત છે. કોઈ આપણને કામ સાંપે તો એકદમ આપણે ના ન પાડી દેવી. અને બા કામ બતાવે તો તો તે કરવું જ. જો તું મારો ખરેખરો દોસ્તદાર હોય અને તને મારા માટે વહાલ હોય, તો તારે મારું કશું કરવું જોઈએ. દોસ્તદારનું કશું ન કરીએ તો પછી દોસ્તી શાની ? અને પહેલા નંબરે પાસ થવા જેટલું તું વાંચતો નથી. માટે, કૃપા કરીને બરાબર તું વાંચજે.

વહાલી બહેન ! તું મને કાગળ લખે છે, તે ઘણું ગમે છે. ભાઈને તો મેં એક પેન અપાવી છે ! ને તારી કનેથી તે કેમ લઈ લે ? મેં એને તારી પેન પાછી આપી દેવાને લખ્યું છે.

તને પેન પાછી ન આપે તો તું મને જરૂર લખજે. તું ઘરનું કામ કરે છે અને બાને બનતી બધી રાહત આપે છે ને સાથે સાથે અભ્યાસમાં ધ્યાન આપે છે, તે જાણી બહુ રાજ થયો છું. બધાંને બોલાવજે. આ વખતે તારે પ્રથમ નંબરે પાસ થવાનું છે. માટે, તું બહુ મહેનત કરજે. □

### સ્મરણાની શક્તિ

શ્રી બહેન,

તા. ૧-૮-૧૯૫૮

છોકરાંનું કામકાજ તારે પહોંચે અને રસોઈ વગેરે બધાંની કરવાની રહી અને નાનાં છોકરાં પણ રહ્યાં એટલે તારે હાલાકી તો પહોંચે, પરંતુ નિરંજના તને મદદ કરે તેવી છે. અને બાબુભાઈ જેમ છોકરાંની સાથે ઠંડક રાખીને વર્તે છે તેવી રીતે બધાંની સાથે શાંતિ રાખવી. તું અકળાઈ જાય છે તેથી મને પંચાત થાય છે. ભગવાનનું નામ જેટલું તું લેશે તેટલું તારા માટે બહુ ઉત્તમ છે. અને તેથી તને ઘણી નિરાંત અને હળવાશ રહેશે.

મનની સ્થિરતા નથી જળવાતી તેનો કશો વાંધો નથી. આપણે ભગવાનનું સ્મરણ કર્યા કરવું. અને તેમાં જેટલો વધુ સમય લેવાય તેમ કરવું. ધ્યાન અને સાધના જેટલાં ઉપયોગનાં છે તેટલું જ ભગવાનનું સ્મરણ ઉપયોગી છે. ભગવાનની કૃપાથી તમારામાં મારાથી જેટલો ભાવ રખાય છે તેટલો રાખું છું. મારા ગુરુમહારાજની શક્તિથી અને તેમના આશીર્વાદથી અને ભગવાનની કૃપાથી એટલું તો ચોક્કસ કહી શકું છું કે જે જીવ મારી સાથે રાગ કરશે, મોહ કરશે, પ્રેમ કરશે તે તે જીવની ઉચ્ચ ગતિ થવાની છે. તેટલી વાતની મને ખબર છે.

આપણે આપણી જાતને ઓળખવા માગીએ તો જરૂર ઓળખી શકીએ. આપણાથી કોઈનું બૂરું થાય નહિ. કોઈને

વિશે ખોટું આપણા દિલમાં પેસે નહિ. બધાંના વિશે સારો ભાવ આપણા દિલમાં જાગે અને પ્રભુકૃપાથી કોઈ દુષ્ટિયારાને મદદમાં આવતા રહીએ અને સાથે સાથે ભગવાનનું નામ લેતા રહીએ. મદદ તો છે જ, તે જાણજો. □

### દંપતીવહેવાર

તા. ૨૨-૮-૧૯૮૫

બહેનને અકળાઈ જવાનું બન્યું પણ તમે તો શાંત જ રહ્યા હશો એમ માનું છું. તમારા બે જણામાંથી કોઈ એક જ્યારે અકળાઈ જાય ત્યારે બીજાએ શાંત રહેવું. એવો નિયમ તમે બંને કરો એવી વિનંતી છે. રોજ રાત્રિના તમો 'તુજ ચરણો'ની પ્રાર્થના કરો છો, તે નિયમ ચાલુ રાખજો. બીજા કોઈને તેમાં બેસવાને માટે આપણે આગ્રહ કરવો નહિ અને રાત્રિનો પ્રાર્થનાનો નિયમ તમારે ચાલુ જ રાખવો. અને રોજ સવારના પણ નાહી ધોઈને છ થી સાતનો જે નિયમ તમે કર્યો છે, તે વ્રતને પણ ચીવટાઈથી વળગી રહેજો. □

### સદ્ભાવભર્યું વર્તન

તા. ૨૩-૮-૧૯૮૫

ધંધાપાણીની બધી હકીકત જાણી. નંદરબારમાં જુવાર ભરી છે, તે પણ હકીકત જાણી. સુરતના કામની હકીકત પણ જાણી. વેપારમાં તો ચડાઉિતર થયા જ કરે. આપણા મૂળ ધંધાથી જે બીજા નાના ધંધા થતા હોય તેમાં કદી નિરાશ ન થવું. કોઈક વખતે તે આપણને જરૂર ફાયદો કરી આપશે. સરવાળે તો લાભ છે. એટલું જ નહિ પરંતુ દર વર્ષે પણ તેમાં કશી ખોટ આવવાની નથી. વળી, આપણા ભાગીદારો ઘણા છે ને તેમનાં છોકરાં પણ છે. એટલે તે બધાંને કામધંધે વળગાડવાને માટે આવા બીજા જે ધંધા છે, તે પણ ખાસ જરૂરના ગણાય. કૃપા કરીને બધાંની સાથે આપણા દિલનો સદ્ભાવ જાગે અને જેટલું

વધુમાં વધુ પ્રેમથી વર્તવાનું બને તો આપણે બધાં જ પ્રેમથી,  
સંપ અને સદ્ગ્રાવથી સાથે રહી શકીએ. □

તા. ૧-૮-૧૯૫૮

તમે રોજ રાત્રે અને સવારે નિયમિત પ્રાર્થના અને હરિસ્મરણ કરો છો, તે વાંચીને રાજ થયો છું. તમારા જીવનમાં જે કંઈ પલટો આવ્યો છે, તે મારે લીધે છે તેવું કશું નથી. એને પ્રભુકૃપા સમજવી. ઘરમાં વાતાવરણની ઉગ્રતા હોય તે વેળા પણ મનમાં શાંતિ અને પ્રસન્નતા ટકે તેવો જગ્રત પ્રયત્ન કરવો. આપણે જેમ અજ્ઞાન છીએ તેમ પત્ની પણ તેમ હોય. આપણાને જેમ પત્નીને કહેવાનો અધિકાર, તેમ પત્ની પણ આપણા ઉપર તડુકી શકે. ત્યારે આપણાને ખોટું ન લાગવું જોઈએ. તમે સુમેળ અને પ્રેમથી વર્તવાને સદાય મંડ્યા કરો છો તેવી તમારી વર્તણૂક મને જરૂર ગમે છે. બને ત્યાં સુધી આપણાથી ગુસ્સે ન થવાય તો ઉત્તમ. કોઈક વખત હેતુપૂર્વક તેમ કરવું પડે તો જરૂર તેમ કરવું ખરું, પણ દિલમાં તે કાળે જેના પ્રત્યે તેમ કરવાનું બને તેના પરત્વે ઘણો ઘણો પ્રેમભાવ પ્રગટેલો રાખવો. □

## જન્મદિન

તા. ૨-૧૦-૧૯૫૮

આપણા સમાજમાં જન્મદિવસનું અમુક પ્રકારનું મહત્વ ગણાય છે. અનું કારણ શરીરથી જ જે તે કંઈ બધું થાય છે. અને શરીરને લીધે જ જેમાં ને તેમાં સમજણ પણ પડે છે ને વિકાસ પણ થાય છે. એવા શરીરનું મહત્વ જો ખરેખરી રીતે આપણા દિલમાં ઉગ્રી જય તો શરીરથી યોગ્ય કામ લેવાની કણા પ્રભુકૃપાથી ઉગે. અને એટલા માટે જ શરીરનું મહત્વ જીવનમાં ઉગાડવાને માટે આવી રીતની પ્રથા સમાજમાં પ્રચલિત છે. □

જત, તમારો અડાલજથી લખેલો તા. ૩-૧૨-૧૯૫૮નો કાગળ આજરોજ મળ્યો છે. હરિનું સુરણ એ જ જીવન છે. અને એ જીવનને પ્રગટાવવાને મથવું, એનું જ નામ સાચો પુરુષાર્થ છે. આનાથી બીજી જાતનો પુરુષાર્થ એ ‘પુરુષાર્થ’ નામને યોગ્ય નથી.

‘પ્રકૃતિના જેર આગળ ટકાવી રાખવાનું મારું શું ગજું ?’ એવું તમે તમારા કાગળમાં લખો છો. આપણાં નિશ્ચયબળ હોય ને દઢ મક્કમતા હોય તો આખરે તો પ્રકૃતિને પણ નમવું પડે છે. આપણે પ્રકૃતિને પણ નમાવવી જ પડશે. પ્રકૃતિને છે તેવી ને તેવી રાખીને આપણે બહુ આગળ ડગ નહિ ભરી શકીએ. માટે, એ તો ગમે તેમ કરીને નિશ્ચય પ્રગટાવી મરણિયો નિર્ધાર કરીને સુરણને જીવતું રાખવાને જ મથવાનું છે, તે વિના બીજો આરો નથી.

જીવનવહેવારનું કર્મ એ જરૂરનું હોવા છતાં, તે કરતાં કરતાં હરિસુરણને આપણે મહત્વ આખ્યા કરવાનું છે. અને સંસારમાં આપણે સુમેળ પ્રગટાવવાનો છે. જેની સાથે આપણે રહેવાનું છે, તેના અવગુણોનું ચિંતવન કર્યા કરીશું અને તેની ખોડને જ આગળ લાવીશું તો કદ્દી મેળ ખાવાનો નથી. અવગુણ આપણામાં પણ હોય ને સામાનામાં પણ હોય. એટલે અવગુણને જતા કરવાની દાણિ આપણે કેળવવાની છે. બીજું કોઈ તે કરે કે ન કરે, પરંતુ આપણે તેમ કરવું. એનું જ નામ સાચું તપ છે. તમે પોતે મારો કહેલો આ માર્ગ પ્રેમભક્તિથી અપનાવશો એવી મને શ્રદ્ધા છે. જે કોઈ જીવ બીજાના અવગુણને વધારે મહત્વ આપે છે અને પોતાના દોષ અને

અવગુણને ગણકારતો નથી, તે જીવ કોઈની સાથે સુમેળ સાધી શકતો નથી. અને આપણે તો સુમેળ સાધવો છે. જગતમાં, જીવનમાં અને સંસારમાં તડ ને ફડ કર્યે જગતનું, જીવનનું અને સંસારનું કદી નભવાનું નથી. આપણે તો સુમેળનો માર્ગ સાધવાનો છે. આ મારો તમને મારા દિલનો ખરેખરો સંદેશો છે. અને તમે તે પ્રેમપૂર્વક એકલા હો તોપણ પાળજો. આ સંદેશો પાળવાને માટે તમારે ઘણું સહન કરવું પડે છે તે હું જાણું છું, પરંતુ આના સિવાય મારે તમને બીજું કશું આપવાનું નથી. માટે, મારા પર પ્રેમ કરજો. □

## પ્રકૃતિ

તા. ૫-૧૨-૧૯૮૪

જત, તમારો ગઈકાલનો કાગળ મળ્યો છે. બપોરે લગભગ અડધોપોણો કલાક સુધી તમને હરિસ્મરણ થયું, તે હકીકત જાણી રાજી થયો. ગઈકાલે મેં તમને એક કાગળ લળ્યો છે. તેમાં પ્રકૃતિ વિશે પણ લળ્યું છે. આપણે બધાં પ્રકૃતિના ગુલામ છીએ, તેનો સ્વીકાર કરવાને તૈયાર હોતા નથી. એટલું જ નહિ પરંતુ આપણે પ્રકૃતિના પ્રેરાયેલા જ જે તે બધું કરીએ છીએ. તેનું યોગ્ય પ્રકારનું ઉંખતું ભાન આપણને જાગતું નથી. જો આપણે ભગવાનના નામના સ્મરણનો અભ્યાસ સતત એકધારો ચાલુ રાખ્યા કરીશું અને બધા મળેલા જીવોની પ્રકૃતિ ને સ્વભાવની સાથે સુમેળ અને સદ્ગ્ભાવ જ્ઞાનપૂર્વક જીવતો જાગતો કેળવવાનું રાખ્યા કરીશું તો આજ નહિ તો કાલ આપણે પ્રકૃતિના ગુલામ મટી જવાના છીએ. સંસારમાં, જગતમાં ને જીવનમાં અનેક જુદી જુદી જતની પ્રકૃતિ અને સ્વભાવવાળા જીવોની સાથે આપણું મળવાનું તો થવાનું જ અને એવી વેળાએ જો તે તે જીવોનું આડાઅવળાપણું જોવાનું બન્યું, તો

આપણે પોતે જ વધારે ને વધારે અશાંત થવાના. એટલે આપણા પોતાની શાંતિની ખાતર આપણે બીજા કોઈની પ્રકૃતિ તરફ લક્ષ રાખવાનું નથી. કદાચ લક્ષ થાય તોપણ સમજી સમજીને તેમાંથી મનને હઠાવવાનું છે. એટલી વાત તમે મનમાં નક્કી કરી રાખશોજી. જો આટલું કરી શક્યા તો ઘણું કરી શક્યા છો એમ જરૂર માનજો. કોઈ પણ ઉપાયે શાંતિ ને પ્રસન્નતા ગુમાવવાં આપણને પાલવે તેવાં નથી, તેનું ભાન ફૂપા કરીને જીવતુંજાગતું રાખજો. હરિસ્મરણ કર્યા કરશો. □

**મુક્ત થવાની રીત**

તા. ૮-૧૨-૧૯૮૫૮

સામાનો દોષ ન જોતાં અથવા તો સામાના અવગુણ ન જોતાં આપણા પોતાના જ અવગુણ, દોષો અને કુટેવો સમજી સમજીને તેનાથી મુક્ત થવાનો પ્રમાણિક, જાગ્રત પ્રયત્ન કર્યા કરવો તે સાચી સાધના છે. હરિસ્મરણ કરતાં કરતાં આ બધું આપણે કરવાનું છે. આપણે આપણાં પોતાનાં શાંતિ ને પ્રસન્નતા જો ટકાવવાં હોય અને જીવતાં રાખવાં હોય તો આપણે પોતે સાદાસીધા બધાંની સાથે સદ્ગ્રાવ, આદર, પ્રેમભાવ, સુમેળ આ બધું જીવતુંજાગતું કેળવવું પડશો. જો આપણે આપણા હૃદયથી ખરેખરા કોઈને સદ્ગુરુ માન્યા હોય, તો આપણા પરત્વેના તેના મૂલ્યાંકનમાં આપણને સાચેસાચી શ્રદ્ધા પ્રગટી જવી જોઈએ. જો તેમ થતું ન અનુભવાય તો આપણે દિલથી કરેલા કે માનેલા સદ્ગુરુમાં આપણું દિલ હજી મળવા, હળવા કે ગળવા માંદેલું નથી એમ સમજવું. સદ્ગુરુની સાથે પ્રેમ-ભક્તિથી એકદિલ પ્રગટ્યા વિના આપણું કામ સધાવાનું નથી. જો માનવા તો પૂરેપૂરા દિલથી માનવા ને એવી તાકાત જો ન

હોય તો બહેતર છે કે આપણે સદગુરુ જ ન કરવા. મારા ગુરુમહારાજનો મને હુકમ છે કે તારે કોઈને ભ્રમણામાં ન રાખવા. સાચી હકીકત કહેવી. મારા આવા લખાણથી કૃપા કરીને તમે ઓછું આણશો નહિ. સાચેસાચું દિલમાં સમજ શકો અને ગળે ઉતારી શકો તે માટે સ્પષ્ટ લખેલું છે. અને હવે આપણો એવો સંબંધ થયો છે, માટે લખી શકાય. તમે નાદિયાદ જરૂર ઉત્તરશો, કારણ કે તમારી સાથે નજીવો થોડોક સામાન સુરત મોકલાવવાનો છે. □

તા. ૨૪-૩-૧૯૫૮

તમારો કાગળ મળ્યો છે. પ્રભુસ્મરણને રામબાળ ઈલાજ ગણીને તેને પ્રેમભક્તિભાવે વળગી રહેવાનું કર્યા કરશોજુ.

હાલમાં બધા લોકો આવ્યાથી બધું નથી લખી શકતો. કામમાં હોશિયાર બનજો. ચીવટ, કાળજી રાખજો. સહુ કોઈની પ્રકૃતિ સ્વભાવ પારખવાં તો ખરાં પણ તે બધું દિલમાં રાખવું. □

કુંદુંબભાવના

તા. ૧૬-૬-૧૯૫૮

આ યુવાનીના ગાળામાં છોકરાંઓને ફરવા કરવાનું મન થાય તે સ્વાભાવિક છે. તમે તથા નટવરભાઈ અને બીજા બધાં યુવાન છોકરાંઓ સાથે સારી રીતે વર્તો છો ને ઉદારભાવના રાખો છો, તે ઉત્તમ વાત છે. એ આશ્રમ માટે સારું કામ કરી શકશો અને તેમનો સહકાર વિશેષ ને વિશેષ મળતો રહેશે. યુવાનિયાઓને ભાવનાથી કરી એમની કદર કરી કરીને તેમને ઉતેજન દીધ્યે જવું અને શાબાશી પણ આપવી. તેમનામાં ઉત્સાહ પ્રગટાવવા માટે આ બધું જરૂરી છે. □

બેદરકારી સામે રોષ

તા. ૨૭-૬-૧૯૫૮

આપ સાહેબ શરીરની કશી ચિંતા રાખતા નથી, તે ખરાબ

છે. તમને તો દૂરે દૂરે લગાવ્યા હોય તોપણ પાર ન આવે. આપ સાહેબના ડહાપણમાં તો જાણે દવ લાગ્યો જણાય છે. દાંત, આંખ ને શરીરને તાવ ને અશક્તિ છે, તેની દવા કરાવવાની ઘણી જરૂર છે. □

### સંસારમાં વિવેક

તા. ૩-૭-૧૯૫૮

હમણાં મારું શરીર સારું નથી. એટલે વધારે કશું લખતો કરતો નથી. દીકરીને બધાંનો ત્રાસ છે, ત્યારે તમે શું કરો છો? બધાંને વારતા કેમ નથી? શું ઊભાં ઊભાં તમાસો જ જોયા કરવાનો છે? ખાલી ખાલી મને કહ્યા કરવાથી શો દહાડો વળે? જો નભ્રતાથી કે પ્રેમથી કહ્યે, તે ન માનતા હોય તો પછી કઠણ પણ થવું જ જોઈએ.

તમારા શરીરની સંભાળ તમારે રાખવાની છે. જે તે કંઈ સ્વાર્થમાં જ સમાઈ જતું નથી. □

### લોભ સામે સાવધાન

વહાલા નટુભાઈ,

જત, મદ્રાસ બે વેગન માલ મોકલવાનું નક્કી કર્યું છે, તે હકીકત જાણી. ‘લોભે લક્ષણ જાય’ એ કહેવત છે. વેપારમાં મારી સમજણ જારી ચાલે નહિ, પણ આ સોઢો તમે લોકોએ કર્યો તેમાં લાંબી દણ્ણિ પહોંચાડી નથી. આ એક ભારે સાહસ કર્યું છે. કોઈક વખત સાહસ કરવામાં ફાવી પણ જવાય છે, પરંતુ હવે જ્યારે સાહસ કર્યું જ છે, તો મનમાં ડરપોકપણું રાખશો નહિ. ને ‘હાય, શું થશે?’ ‘હાય, શું થશે?’ એવું વિચારવાની બિલકુલ જરૂર નથી. હવે તો આપણો દાવ પાંશરો પડે તેમ વર્તવાનું. પૈસા કઢાવવામાં કાબેલ થજો. હું તો ભગવાનની પાસે બધીએ બાબતની પ્રાર્થના કરું છું. હું તો

એનો વાણોતર છું. એટલે જે કંઈ હકીકત મારી પાસે છે, એ બધી એને જણાવવી પડે. એનાથી કશું છાનુંછપનું રાખતો નથી, પરંતુ આ મદ્રાસવાળો સોઢો આપણો પ્રભુકૃપાથી પાર પડશે ત્યારે જ મને તો દિલમાં ઠીક લાગશે. મારા જેવાની છાતી તો નબળી પોચી છે. તમે બધાએ ભારે છાતીનું કામ કર્યું છે. એટલે આ બાબતમાં તમે બધા સાવધાન અને જાગતા રહેજો એવી વારંવાર વિનંતી છે.

□

સ્મરણ સાથે જરૂરી બાબતો

તા. ૨૧-૭-૧૯૫૮

ગુરુપૂર્ણિમાને દિવસે તમે આખો દિવસ હરિસ્મરણમાં ગાળવાનું નક્કી કર્યું હતું, તે પ્રમાણે જરૂર કરશો. ભગવાનનું સ્મરણ કરતા રહેવું. એના જેવો બીજો કોઈ સહારો નથી ને બીજી કોઈ મદદ પણ નથી. એના જેવી બીજી કોઈ જગતમાં ભારે ઓથ નથી. આ બધું તમે પ્રેમથી ગળે ઉતારજો ને પાકું સમજજો. અને હરિસ્મરણને સાચું જીવન ગણીને એ પ્રમાણે વર્તવાનું સમજ સમજને કરજો. આ સંસારમાં જે જે જીવ મળેલા છે, તેમની સાથે ભાવભક્તિપૂર્વક, ઉદારતા, મોદું દિલ આપણે રાખવું. બીજાને માટે પ્રેમથી ત્યાગ કરવાનું જેટલું બનશે, તેટલી આપણી શક્તિ વધવાની છે. આપણે સમજ સમજને બીજાને માટે પ્રેમથી જેટલું સહન કરીશું, તેટલું ખરેખરું બળ મળવાનું છે.

□

શુદ્ધિનો યજા

પ્રેય બહેન,

તા. ૨-૮-૧૯૫૮

ભાઈ બાબુ મૌનમાં બેસે ત્યારે તે સ્મરણ કર્યા કરે ત્યારે તારે પણ સ્મરણ કર્યા કરવું. ને તું જો પ્રેમથી સ્મરણ કર્યા કરશો તો બાબુને મદદ મળ્યા કરશો. તે ઉપરાંત, આ મૌનસ્મરણયજ્ઞ તો શુદ્ધિનો છે. તેમાં બધો જ કચરો બાળવાનો

છે. એટલે તારે ઘરમાં બહુ સ્વચ્છતા કરવાની છે. છોકરાં સાથે ખૂબ ઉમળકાથી વહાલથી વરતવું. બધાંને વહાલ કરવું, વહાલથી બોલાવવાં. બધાં છોકરાં પણ ઘરમાં આ એકવીસ દિવસના ગાળામાં શાંતિ રાખે ને બધાં હળીમળીને રહે તેવું વાતાવરણ સરજાય તે જરૂરનું છે. તારે અકળાઈ ન જવું. કોઈ આપણું પેટ ધમપછાડા કરે તોપણ તારે પૂરી શાંતિ પકડીને બને તેટલા આનંદમાં જ રહેવું. આ એકવીસ દિવસ દરમિયાન તારે બને તેટલું શાંતિમાં રહેવું ને નામસ્મરણ કર્યા કરવું. આ ગાળામાં તારે ઘરમાં જ રહેવું ને તારે આશ્રમમાં આવવાનું દિલ થાય તોપણ તારે ઘરના કામકાજમાં જ દિલ આપવું ને હરિસ્મરણ કરવું. તું અહીં આવે તો તારા ચારપાંચ કલાક જાય, તે તેટલો વખત તું ત્યાં રહીને જ જો ભગવાનનું નામ લે, તો તે અહીં તું આવે તેના કરતાં ઉત્તમ છે.

તું કોઈ વાતે છોકરાંની મસ્તીથી અકળાઈ ન જઈશ. ને ગુસ્સો ન થવા દેતી. કોધ તો ભંગી છે ને એનાથી આપણો આ પવિત્ર પજ્ઞ જે શરૂ થવાનો છે, તે તો કોધથી અપવિત્ર બની જાય. તારી મદદ વગર ચાલી શકે તેવું નથી. માટે, બહુ જ કાળજી રાખજે. તારા પ્રયત્નમાં હું સાથે જ દું, તે નક્કી માનજે ને આનંદમાં રહેજે.

આ મૌનમાંથી બાબુભાઈ બહાર નીકળે ત્યાર પછી તમારે બંનેએ હવે શરીરનો સંબંધ પૂરો મૂકી દેવો ને શુદ્ધ ભાવથી સંસારમાં વર્તવાનું છે. શરીરના સંબંધને હવે સપૂચો ભૂલી જવાનો છે. □

**આશ્રમ પ્રત્યેનું દિલ**

તા. ૮-૧૦-૧૯૫૮

શહેરમાં તમારે ઘેર નંદુભાઈને જમવા તેડી જવા એટલે કેટલાક કલાક જાય ! એક તો અહીં આશ્રમમાં બેત્રણ દિવસ

હોય તેમાં આવી રીતે દિવસ જાય તે પોસાય તેવું નથી. આપણે માગણી કરવામાં પણ સમજવું ધટે. શહેરમાં ને શહેરમાં તે રહેવાના હોય ને તમે તેમ ઈચ્છો તે યોગ્ય ગણાય.

તમારા શરીરની અશક્તિને કારણે મૌનપૂર્ણહૃતિ સમયે હાજર ન રહી શક્યા તેનો હું કદી વિચાર કરતો જ નથી, પણ આપણે પોતે દરેકે તે વિચારવું ને તેનું પૂરું યોગ્ય નિદાન કરવું ધટે. હજુ આશ્રમ પરત્વે કે મારી પરત્વે ખરેખરું પ્રેમભક્તિવાળું દિલ પ્રગટેલું નથી. દિલ જ્યારે પ્રગટે છે ત્યારે માનવી તેને અમલમાં મૂકે છે. તેથી, શરીરની અશક્તિને કારણે નથી અવાતું તે હું માનતો નથી, પણ હજુ તેવું દિલ પ્રગટેલું નથી. કામ પણ હોય ને કામને અવગણીને ન અવાયું એમ અનેક વાર કહ્યું છે, પણ જો દિલ હોત તો હાથ પર જે કામ હોય તે કામને સવેળા સારી રીતે પૂરું કરીને પણ જો આવવું હોય તો આવી શકાય. દરેકને સાચી રીતે તેના મૂળમાં પેસી સમજવું.

તમે મોકલ્યું તે મારે શું કરવું? તમારે બધાંએ આશ્રમ ચલાવવાનો છે. તેનું લક્ષ્ય તમારામાં તમોને જગ્યો એવી પ્રાર્થના. □

દોસ્તીનો હેતુ

તા. ૧૮-૧૦-૧૯૫૮

પ્રભુકૃપાથી તમારું કામ સારું ચાલે છે, તે જાણી રાજી થયો છું. ‘સ્નેહ કરીને આવજો’ અને તમારી સાથે તે બાબતમાં વાત થયેલી, તે તમોને યાદ હશે. અને માલ વધુ ભરાઈ ગયો છે, તે બાબતની વાતચીત નીકળતાં તમારો બધો માલ ખપી જવાનો છે, તેમ પણ પ્રભુકૃપાથી તમોને લેખિત પત્રમાં લઘું

છે, તે પણ તમે વાંચ્યું હશે. ભગવાનની કૃપાથી અમારું તો બધું ચાલ્યા કરવાનું છે. અમારે તો ખરેખરું જે જોઈએ તે તો દિલ જોઈએ છે. તે મળતાં બધું મળી રહે છે. બધાંયની સાથે અમે જે દિલથી દોસ્તી કરીએ છીએ, તે આશ્રમને માટે લેવાની ગરજ માટે નહિ, પરંતુ જે જે જીવ અમને મદદ કરે તેની સમજણ અને તેની ભાવના કંઈક કરતાં ઉંચી પ્રગટે અને તેના રાગદ્વેષ મોળા પડે, તે અમારે તો અનુભવવું છે. ઉધરાણીનું પણ જેટલું પતાવાય તેટલું પતાવજો.

તું તારા કાગળમાં લખતો હતો કે આશ્રમે મૌનપૂર્ણહુતિવેળા અશક્તિના કારણે ના આવી શક્યો, પરંતુ તારા શરીરની અશક્તિ હતી, તો આટલી લાંબી મુસાફરી કરવાનું ને તે ગાળામાં રખડવાનું બન્યું તેનું શું ? ત્યાં અશક્તિનું કારણ ચાલી શકતું નથી. માટે, અમારી આગળ એવું ખાલી ખાલી ન લખવું કે કહેવું. તારે માટે મને લાગણી કે ભાવના છે. તેની તો તું પણ ના પાડી શકે તેમ નથી.

મારું કે આશ્રમનું કામ કરશો અને તેમાં ખાંખત રાખશો, તો તેથી તમારું કામ બગડવાનું નથી, તેની ખાતરી રાખજો, અને આશ્રમને પૂરેપૂરી રીતે મદદરૂપ થવાને ઉત્સાહિત અને ખંતીલા બનજો. તેમાં તમારો ખરેખરો અને સાચો સ્વાર્થ જળવાવાનો છે.



## જોવા જેવી ફિલ્મ

તા. ૧૪-૧-૧૯૬૦

જત, સુરતમાં ‘Ten commandments’ સિનેમા આવ્યો છે, તે જોવા જેવો છે. સંત મોઝીજ જેઓ ઈસુ ભગવાનની પહેલાં અવતરેલા, તેમના જીવનની બધી હકીકત છે. Pre-Biblical History છે. જોવા જેવો છે. લલિતાને તમે

જરૂર લઈ જાઓ. નહિ લઈ જાઓ તો પછી આપનું આવી  
બન્યું સમજવું.

□

## મૌનનો આરંભ

તા. ૫-૭-૧૯૬૦

આજે પ્રભાતે તું મૌનમાં બેસી ચૂકેલ હશે. અને તે વખતે તારું વહાલભર્યું સ્મરણ મારા દિલમાં કેવું ધબકતું હતું, એ તો હું એકલો જ જાણું છું. તારી ભેટ મને ભગવાનની કૃપાથી મળી છે. તું જાણે છે કે આપણી વચ્ચે જે સગપણ છે, તે આપણા દુનિયાદારી અને સંસારના સગપણ કરતાં કોઈક જુદા જ પ્રકારનું છે. તારી એકેએક પ્રવૃત્તિમાં મને રસ છે, અને તે તો તને અનુભવ છે. ભગવાનની કૃપાથી ભલે બીજાં બધાંને અમે ‘લેનારા’ લાગીએ અને એવું ‘લેવાનું’ બધાંને જણાતું હોય છે, પરંતુ ભગવાનની કૃપાથી જે ‘અપાતું’ હોય છે, તે તો કોઈ જોઈ કે જાણી શકતું નથી. અમે જેમ લઈએ છીએ તેમ ભગવાનની કૃપાથી આપતા પણ હોઈએ છીએ. આ પણ એક સોએ સો ટકા નક્કી હકીકત છે. અને તેની તને સમજાણ પણ છે. અને તું કંઈ મામૂલી નાનો શો વેપારી નથી, પરંતુ તારે ને મારે જે દિલની દોસ્તી છે, એટલે મારે તને ખાસ પ્રેમથી અને હક્કથી માગી શકાય કે કંઈ પણ આપે તેની પાછળ આશા અપેક્ષા મુદ્દલે ના હોય તો તે ઉત્તમ છે.

આ વખતનું તારું મૌન બહુ જ ભાવનાવાળું જાય અને તારા દિલમાં મારા પરતેની ભક્તિ એટલી બધી પ્રગટે કે જેથી હું ત્યાં ન હોવા છતાં તું મારાં દર્શન કરી શકે,. તો તને ઘણો ઘણો આનંદ થાય. માટે, આ વખતે તું ભાવના ને લાગણી ‘મોટા’ પરતે ઊભરાવી ઊભરાવીને તારું દિલ

મોટામાં જ પૂરેપૂરું પરોવાઈ જાય તેવો ખૂબખૂબ જીવતોજાગતો એકધારો પ્રયત્ન કરજે. હું તો તારી સાથે જ છું. એમ નક્કી માનજે. આ કંઈ ખાલી લખવા ખાતર લખેલ નથી. એનો તને અનુભવ થાય ત્યારે જ મારી વાત તને સાચી સમજાય. આનંદમાં રહેજે.

□

## નિશ્ચયનું બળ

તા. ૮-૭-૧૯૬૦

વહાલા બાબુભાઈ, તમારો પ/જનો કાગળ મળ્યો. તમારો અને મારો મેળાપ એ તો ભગવાનની કૃપાનો સંબંધ છે. જે નિશ્ચય કરીએ તે નિશ્ચયને પ્રેમભક્તિથી સરેશની જેમ વળગી રહીએ તો જ આત્મબળ આપણામાં કામ કરતું બની શકે. નિશ્ચય કરીને જે નિશ્ચયને વળગી રહેતો નથી તેવો જીવ તો વિશેષ ને વિશેષ લૂલો બન્યા કરે છે. દિલની ભાવનાને ટકાવી રાખવાને પણ નિશ્ચયબળની જરૂર. એવા હદ્યના નિશ્ચયબળ વિના વિશ્વાસ ને ભરોસો પણ ટકી ના શકે. જેનામાં નિશ્ચયબળ ના હોય તેવા જીવમાં વિશ્વાસ અને શ્રદ્ધા કપૂરની વાસની જેમ ઉડી જાય છે. અને આ મૌનગાળામાં તમે પ્રભુકૃપાથી જેને માન્યા છે, તેને દિલમાં દિલની ભાવનાથી વિશેષ ને વિશેષ જીવતો કરો. અને તેનામાં રાચવાનું કર્યા જ કરો. અને બહાર નીકળ્યા પછી તે અત્યાસને કેળવી કેળવીને વધુ ને વધુ સજીવન કર્યા કરો, તો જેને માન્યા હોય તેની ચેતનાની મદદ હુંફ-ઓથ આપણને લાગ્યા કરે.

ખૂબ આનંદમાં રહેજો. આજે ગુરુપૂર્ણિમા છે અને કેટલાં બધાં સ્વજનો દિલમાં એક પછી એક ડોકાય છે. આજે કેટલાંકનાં સુરાશમાં ઉર્ભિ છે, લાગણી છે, ભાવના છે, પરંતુ તેમાં નિરંતરતા પ્રગટી નથી. આપણે તે પ્રગટાવીએ તો કામ પાકે.

ભાવનાથી જે જીવે છે, તે ખરું જવી જાણે છે. એવી રીતે  
જીવવું એને જ જીવન ગણેલ છે. માટે, મરદ બનજો. □  
ભાવનાનાં લક્ષણા

તા. ૧૧-૭-૧૯૬૦

ભાવના જ્યારે દિલમાં પાંગરે ત્યારે તેવી ભાવના કેવું  
ગજબનું કર્મ કરાવી શકે છે, તેના જોઈએ તેટલા દાખાંત ઈતિહાસ  
આપે છે. શૌર્યના-ધૂનમાં ચઢેલું માનવીનું દિલ અનેક ઘા પડ્યા  
હોવા છતાં પણ મેદાનમાં મસ્તીથી ઝડૂભ્યા કરે છે. એવા એક  
નહિ પણ અનેક દાખલા છે. મસ્તી પ્રગટે તો કશું મુશ્કેલ  
લાગતું નથી. ભાવના પ્રગટતાં કોઈ એક પ્રકારની મસ્તી પ્રગટે  
છે. અને તેની ધૂન એવી તો દિલમાં ફોરે છે કે જેથી કરીને  
આપણે મુશ્કેલમાં મુશ્કેલ કામને પણ પાર પાડી શકીએ છીએ.  
એવી ભાવના જો તમને પ્રગટી શકે તો મોટાનાં દર્શન તો ત્યાં  
છે જ. જેમ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયા વિના મંદિરમાં  
તેનાં દર્શન કોઈ કરતું નથી, તેવી રીતે આશ્રમના  
મૌનમંદિરમાં પ્રભુકૃપાથી અમારા ગુરુમહારાજની  
ભાવનાની પ્રાણપ્રતિષ્ઠા અને ચેતનની પ્રતિષ્ઠા ત્યાં અમે  
શ્રીભગવાનની કૃપાથી કરેલી છે. એમ જે તે દિલમાં ખરેખરી  
ભાવના જાગે છે, તેને તો ખરેખરો કોઈ અનેરો રંગ જામે છે.  
અને જેને રંગ જામે છે, તેના નશાની તો શી વાત કરીએ ?  
માટે, ભાવના પ્રગટાવી પ્રગટાવીને રહ્યા કરજો. □

સ્વજન સાથે શ્રીમોટાનું વર્તન

તા. ૨૮-૭-૧૯૬૦

જત, તમારું રપમીનું કવર મળ્યું છે. આ વખતનું તમારું  
મૌન પ્રભુકૃપાથી સારું થયું અને એની કૃપાથી પાર ઉત્તર્યુ.  
અને હરિસ્મરણમાં જીવવાની તમને પ્રભુકૃપાથી સમજણ પડવા  
લાગી છે, તે બધું જાણીને રાજ થયો. ભગવાને તમને તો મને

ભેટ તરીકે આપેલા છે, તે હું તમને કેમ કરીને ભૂલી શકું ? અને તમને તો મારા વહાલા સ્વજન ગણું છું. એટલે જ તમો સાથે કેટલીક વાર કઠળ રીતે પણ વર્તું છું. જેને આપણા પોતાના ગણીએ તેને તો આપણે પ્રેમથી અને કોધથી પણ અને કઠળ વચ્ચનથી પણ વર્તી શકીએ. તમે મનમાં કશું લાવતા નથી અને મારા પર પ્રેમ જ ઢોળો છો, તેમ છતાં જો તમને ખરેખરો મારા પર પ્રેમ થઈ જાય ત્યારે તો પ્રેમનો ધર્મ એ છે કે એનું મનન ચિંતવન આપણા મનમાં સતત થયા કરે. અને પ્રેમનું બીજું લક્ષણ આકર્ષણ છે. એવું જ્યારે ખરેખરું દિલમાં દિલથી આકર્ષણ તમને મારી પરત્વે જાગે ત્યારે ખરેખરો પ્રેમ થયેલો સમજવો. અને આકર્ષણ જાગે તો તે કંઈ સમજાયા વિના થોડું જ રહે ? પ્રભુનું સ્મરણ અને જીવનમાં મળેલાં પરત્વેના રાગદ્રેષ મોળા પાડી પાડી બધાંની સાથે સદ્ભાવ, સહાનુભૂતિ, ધીરજ, ત્યાગ કરવો, મોટું દિલ દાખવવું. આ બધું આપણે સમજ સમજને કર્યા કરવું. એમાં જે ખમવાનું આવે તેને તપ સમજવું. હદ્યના ઉમળકાથી અને પ્રેમથી સહન કરીએ તો જ પ્રેમ જવે. □

### જીવલેણ રોગ

તા. ૧૦-૩-૧૯૬૧

મેનેન્જાઈટીસનો રોગ એ મૂળ ગંભીર ગણાય છે. ડોક્ટરે આપણને ગભરાવી મારવા એમ કહેલું નથી. તમને બધાંને ફિકર થાય ને અરવિંદને લાગી આવે તે તો અહીં રહ્યે રહ્યે પણ ખૂબ સમજ શકું છું. આમાં આપણે દિલગીર થયે ચાલે તેમ નથી. આપણને જો સાચી લાગણી હોય, તો તે લાગણીનો ઉપયોગ ભગવાનને માટે પ્રાર્થનામાં કરવો જોઈએ. તમે મને રોજની રોજ ટપાલ લખો છો તો જાણવાનું મળે છે. બાબુભાઈને

કમરે દુખાવો ઉપડ્યો છે, એ ગઈકાલની સવારથી વધારે લાગે છે. બાકી, સાચી રીતે તો આવા રોગના કેઈસીસ ઘણાખરા FATAL-પ્રાણધાતક નીવડે. ભગવાનનું રાત્રે સ્મરણ કરે. આપણા ઘરમાં અખંડ સ્મરણયજ્ઞ શરૂ કરો. વારાફરથી બજે કલાક આપીને તે યજ્ઞ ચલાવ્યા કરો. હું પણ મારાથી બનતું તેની કૃપાથી જે શક્ય હશે તે થયે જશે, તે કરીશ. □

### મૌન લેનારની સેવા

તા. ૮-૪-૧૯૬૧

મૌનઓરડામાં આપણાં બધાંનો બહારનો અવાજ ન સંભળાય તો ઉત્તમ. એટલા માટે આપણે બધાંએ કાળજી રાખવાની છે. પહેલાં પણ આ રીતે હું અવારનવાર ટોક્યા તો કરતો.

જૂના મૌનમંહિરમાં કોઈ ભાઈ કે બહેન બેઠેલ હોય ત્યારે આપણે ત્યાં ચા પીતાં કે બીજાં કામકાજ કરતાં એકમેક સાથે ઓલવું ના થાય તો તે વધારે ઉત્તમ. આ કાગળ તમને બધાંને ઉદેશીને છે. માટે, બધાંને વંચાવજો. અને બધાં તેનો અમલ કડકપણે કરે તેમ મારી નમ્ર વિનંતી છે. □

### વહેમો સામે સાવધાન

શ્રીય ભાઈ ચંપક,

તા. ૨૨-૪-૧૯૬૧

માંદગીના અંગે ખોટા વહેમો જે લોકો રાખે છે, તે લોકોમાં સાચી શ્રદ્ધા નથી અને ભક્તિ પણ નથી. એવા લોકો પણ મારી પાસે આવે છે. આવતાં આવતાં ભગવાનની કૃપાથી પરિચય થતાં અને તેમનું દિલ મળતાં જ્યારે ખરેખરી તેમના દિલમાં ભાવના જાગશે ત્યારે સાચી હકીકતવાળાં મારાં વચન તેમને ગળે ઉત્તરશે. માંદગી વિશેના આવા વહેમોને આપણે નકારવા જોઈએ અને સમાજમાં તેવી વૃત્તિને આપણે પોષણ પણ ના આપવું જોઈએ. આવી વૃત્તિઓને પોષણ આપીને

તેને માનવાની વાત કરે છે, તે બધી ભ્રમણા છે. આ પત્ર જેને  
વંચાવવો હોય તેને તું વંચાવી શકે છે. □

સન્મુખતા

તા. ૩૧-૭-૧૯૬૧

આ કાગળ તમને મૌનમંદિરમાં મળશે. ભગવાનની કૃપાથી  
ખૂબ ઉત્સાહથી અને ભક્તિથી નામસ્મરણ, પ્રાર્થના, ભજન  
અને વાંચનનો સત્સંગ કર્યા કરજો. અને વારંવાર ‘મોટા’ને  
મનની આંખ સામે લાવીને આંખો મીંચીને તેનું સ્મરણ કરજો.  
અંદરથી કાગળ લખવાની જરૂર નથી. અંદર આનંદ ઉત્સાહથી  
હરિસ્મરણ પ્રાર્થના વગેરે બધું કર્યા કરજો. □

તા. ૧૭-૭-૧૯૬૨

ગુરુ એ તેનું શરીર નથી. શરીરને જે ગુરુ માની તેને  
મહત્ત્વ આપે છે અથવા જે શરીરને લક્ષમાં રાખીને તેને જે  
ગુરુ કરે - માને કે સમજે તો તો તે નર્ધુ અજ્ઞાન. ગુરુ તો  
અંતરમાં પ્રગટેલી જે ચેતનાશક્તિ હોય તે સાચો ગુરુ. એવા  
ગુરુ પરત્વેની આપણા હૃદયની સાચી પૂરેપૂરી પ્રેમભક્તિ પ્રગટે  
ને તેના દિલ સાથે આપણું દિલ હળી, મળી, ભળી ને ગળી  
જય ત્યારે-ને તે પણ આપણા પોતાના દિલની તેવી ભાવનાને  
કારણે-ત્યારે આપણે તેના હાઈને પામી શકીએ. ગુરુના સ્થળ  
શરીરને કદી પણ ગુરુ માનવાપણું ના હોય. સાચી રીતે તો  
ગુરુ પોતે પોતાનો જ હોય.

પ્રભુએ કૃપાનો વરસાદ વરસાવી મને જે સ્વજનોમાં  
સદ્ભાવ-સમભાવ-સાથ હુંફ-મદદ-ઓથ શુભેચ્છા એ બધું  
મેળવી અપાવ્યું છે, તેવાં બધાં સ્વજનોનાં સંસ્મરણોથી આજે  
એ વહાલા પ્રભુની પુનિત કૃપાસરિતના સલિલમાં સ્નાન કરી  
કરી તેના પાવનકારી સ્પર્શનો અનુભવ લીધાં કરે, તે આનંદના  
લહાવામાં અનોખી મસ્તી અનુભવું છું. ને તે કાજે તમો બધાંનો

પ્રેમભાવે હૃદયમાં હૃદયથી ઋણનો સ્વીકાર કરી તે ભાવે પ્રેમથી  
નમું છું. □

### ગ્રાટકની મર્યાદા

તા. ૨૫-૭-૧૯૬૨

ગ્રાટકનો લાભ સારો તો ત્યારે જ મળે કે મૌનમાંથી બહાર  
નીકળીને રોજ ને રોજ તેનો એકધારો ચાલુ અભ્યાસ જો થયા  
કરે તો. આ તો મૌનમાં એટલો સમય થાય તેનો અર્થ નહિ.  
તમને પ્રકાશનો અનુભવ થાય છે તે ઉત્તમ છે. મોટાનામાં  
પૂરી ભાવના લાગણી જન્મે તેવું કરવાનું છે.

આજે આવ્યા છીએ ને ટપાલનો ઢગલો છે. બીજાં આવનારાં  
પણ હોય, એટલે હમણાં કાગળ-બાગળ લખશો નહિ.

ગ્રાટકનો સમય લંબાવવાની જરૂર નથી. પોણો કલાક કે  
બહુ તો કલાક જ કરવું.

જે અંદર હોય તે વાંચ્યા કરજો. □

તા. ૮-૮-૧૯૬૨

મૌનમંદિરમાં તમારો સમય ખૂબ આનંદથી સરળતાથી  
પસાર થયો તે તો ઉત્તમ થયું, પરંતુ બહાર નીકળ્યા પછી  
ધ્યાન-ગ્રાટક વગેરે આપણે કશું કરી શકતા નથી અને મૌનમાં  
બેસીએ છીએ ત્યારે જ તે કરીએ છીએ. તેથી, તેનો લાભ  
બરાબર ન મેળવી શકાય. એવાં સાધનોનો જો રોજ ને રોજ  
જીવંત અભ્યાસ થયા કરે તો જ ફળદાયી નીવડી શકે. અને  
તેમ બની શકે તો સ્મરણા, પ્રાર્થના તથા ભાવના જીવતી રહે  
અને ભાવનાને સાધન સમજીને તે સાધન જીવતું રહી શકે  
તેવો અભ્યાસ જે કેળવાય તેવું જરૂરનું ખરું. □

### શ્રીમોટાનું અનુષ્ઠાન

પ્રિય નદુભાઈ તથા મોહનભાઈ,

તા. ૨૫-૮-૧૯૬૨

બાબુભાઈના કારણે તો મને ચેન પડતું નથી, ને અજંપો

રહ્યા કરે છે. માનસિક અનુષ્ઠાન તો ભગવાનની કૃપાથી શરૂ પણ થઈ ચૂક્યું છે. આશ્રમમાં બે ડૉક્ટર રોજ આવે છે તેમને તો પૂછી જોયેલું. તેમનો પણ અભિપ્રાય એવો છે કે આ રોગ FATAL-પ્રાણધાતક ગણાય. અને પછી આજે તો મારાથી રહેવાયું નહિ ને નડિયાદ શહેરમાં જઈને મારી સાથે ખૂબ અંગત ભાવસંબંધ છે, તેવા એક F.R.C.S. ડૉક્ટરને મળ્યો ને કાગળિયું સ્ટેશને આપેલું તે બતાવ્યું. તેમણે પણ કહ્યું કે આ રોગ બહુ ગંભીર છે. આ રોગની બીજી કશી દવા શોધાઈ નથી. અને કોઈક કેસમાં તો ૨૦/૨૫ દિવસ સુધી પણ દર્દી બેભાન રહે. જેટલા વધુ હિન રહે તેટલું તેવા દર્દીને માટે જીવવાની શક્યતા વધારે. બાકી તો સેંકડે બેપાંચ ટકા બચે તો બચે. મારે તમને સાચી હકીકત લખવી જોઈએ. આ હકીકત જાણીને આપણે હિંમત હારવાની જરૂર નથી. આપણા પોતાના દિલનો વિશ્વાસ અને હિંમત જીવતાં કરવાં. □

દીવાલો હુર્ગની ફાટે તમારી આત્મશ્રદ્ધા જો  
અને પર્વત કરી દે, મોકળા (પથને) તમારી આત્મશ્રદ્ધા જો.

દિલમાં જે આત્મવિશ્વાસ અને શ્રદ્ધા છે, તેને આપણે બધાંએ પાકાં કરવાં. તમારા બધાંના દિલનો જો ખરેખરો પ્રેમભક્તિવાળો સહકાર મળે તો મારા પોતાના પ્રાણ પ્રગટે. પ્રભુકૃપાથી ગત હિનથી આગળ કરવાની જરૂર પડશે, તો તે પણ થવાનું. તમારે મને રોજ ને રોજ કાગળ લખ્યા કરવો ને તમારે બધાંએ પ્રાર્થના પણ ઘણી કરવી. મારી લખેલી હકીકત બીજા કોઈને કહેવાની જરૂર નથી. નકામા બીજા લોકો ગલ્યા. આજે સાંજે બોંતેર કલાક પૂરા થશે. અત્યારે તો એક એક કલાક કટોકટીનો છે. એમનાથી જે બોલાતું હતું

તે બોલાય છે કે કેમ ? ‘હરિઃઊ’ બોલે છે કે કેમ ? તથા તેમના હાથમાં ચા-દૂધ વગેરે જે આપતા હતા, તે બાબુભાઈ તેમના પોતાના હાથમાં લઈને પી શકે છે કે કેમ ? પેશાબ તેમની મેળે થાય છે ખરો ? દસ્તને માટે એનિમા આપે છે ખરા ? દવા પોતાની મેળે પી જાય છે ખરા ? આ બધાંનો મને ઉત્તર આપજો. કોઈ ગભરાશો નહિ અને બીજાંને ગભરાવા દેશો નહિ. □

### ગંભીર રોગનો સામનો

તા. ૨૫-૮-૧૯૬૨

અહીં પણ મેં ડોક્ટરને પૂછ્યું છે અને તેમની સલાહ લીધી. આ રોગ ગંભીર કહેવાય તેવું તેમનું પણ કહેવું છે. તમો બધાં ભગવાનની પ્રાર્થના કરજો અને હું પણ પ્રભુકૃપાથી માનસિક અનુષ્ઠાન કર્યા કરીશ તે જાણજો. આપણે આત્મવિશ્વાસ રાખીને ભગવાનની પ્રાર્થના કરવી. બાબુભાઈનો કેસ ઘણો ગંભીર છે, તે વાત તો સાચી, પણ તેથી ચિંતા કર્યેથી કશું વળે નહિ. મને કૃપા કરીને રોજ લખતા રહેજો. □

### કટોકટીનો કાળ

પ્રિય નદુભાઈ તથા મોહનભાઈ,

તા. ૨૬-૮-૧૯૬૨

જત, તમારો શનિવારનો એક્સપ્રેસ ડિલિવરીનો કાગળ મળ્યો છે, પરંતુ રવિવારે તેવી ટપાલ શહેરમાં ‘ભારત ભુવન હોટલે’ જ જાય. કોઈ આપણું સગું હોય તો વળી આશ્રમે આપી જાય. બાકી તો મળે નહિ. આશ્રમમાંથી એક છોકરો સવારે દૂધ લેવા શહેરમાં ગયો હતો. એટલે વળી તમારી ટપાલ મળી ગઈ, પરંતુ કુંજરાવવાળા પી.ટી. સુરતથી આવેલા, તેમણે આજે સવારે આવીને ત્યાંની બધી હકીકત જણાવી. અત્યારે તો કલાકે કલાક-every hour-કટોકટીનો છે. ગમે તે રીતે ભગવાન,

બાબુભાઈના દિવસો બેંચે રાખે તો તો આશા પાકી પડે. ભલેને સ્થિતિ કટોકટીની હોય પણ જો દિવસો બેંચાઈ જાય તો આશા પાકી થાય. બાકી, સાત દિન તો ભારે કટોકટીના અને કસોટીના છે. તમારા બધાંયના કરતાં મારી સ્થિતિ તો કફોડી છે. તમને આશ્વાસન પણ હું કેવી રીતે આપું તે પણ મને તો સૂજતું નથી. આપણને ટકાવી રાખે છે આપણા હદ્યની શ્રદ્ધા. આપણને દરેકને આવો આવો ખરેખરો કટોકટીનો ને કસોટીનો કાળ હોય છે ત્યારે જ ભગવાનને પોકાર પાડવાનું સૂજે. ભગવાનની કૃપાથી આપણો ગમે તેટલાં કારણો નિરાશાનાં હોય તોપણ આપણે તો આશાના કિરણ ઉપર જ ઝૂમવાનું છે. એટલે આશાવાદી જ રહેવું સારું.

આપણા કુટુંબમાંથી સૌથી પ્રથમ ભગવાનની કૃપાની બેટ મને તો બાબુભાઈની છે. મારે કંઈ કરવાનું છે, તે કોઈને માટે નથી. અને કોઈને બતાવવા માટે પણ નથી, પરંતુ પ્રયત્નથી જ જો કોઈને બચાવી શકતા હોય તો તો જોઈતું હતું શું? તેમ છતાં કેટલીક વાર પ્રાર્થનાનો સાદ પણ સંભળાય છે એવો પણ અનુભવ છે ખરો. આપણી મંજુલાને દેખાતું ન હતું ને ડોકુટરે પણ આશા મૂકી દીધેલી ને નહિ જ દેખાય તેમ કહેલું. તેમ છતાં આજે તે વાંચી શકે છે ખરી. એટલે આપણી પાસે તો જે સાધન છે, તેની આશા રાખીને તેનો ઉપયોગ ત્યાં કરવો ને કદી પણ હિંમત હારવી નહિ ને શ્રદ્ધાને ડગાવવી નહિ. મારે તો બાબુભાઈ જે છે તે છે. એ કંઈ લખવાથી વધારે નથી. તમારે બધાંને તે માજાણ્યા ભાઈ ખરા, પરંતુ મારું સગપણ તો કોઈ જુદી જ દિશાનું ને જુદી જ ભાવનાનું.

માટે, કૃપા કરીને જરા પણ હાલી જશો નહિ. લાગણી થાય ત્યારે પ્રભુભજન કરજો. પ્રાર્થના કરજો. રોજ રોજ બાબુભાઈની હકીકત લખતા રહેજો.

બાબુભાઈની શક્તિ ટકાવી રાખવા માટે ડોક્ટરો બધી સારવાર કરે છે તે જાણ્યું. બાટલા ચડાવવાનો પણ તે જ હેતુ, કારણ કે બહારથી તો ખોરાક લઈ શકતો નથી, એટલે ખોરાકનું તત્ત્વ સીધું પેટમાં ભણે તથા નાડી ને બ્લડપ્રેશર બરાબર જળવાઈ રહે, એટલા માટે નસ દ્વારા ખોરાક અને દવા આપવાનો હેતુ છે. □

પ્રિય નફુભાઈ તથા મોહનભાઈ,

તા. ૨૭-૮-૧૯૬૨

તમે ભગવાનની કૃપાથી ગભરાતા નથી. તેથી, મને ઘણું સારું લાગે છે અને મને પણ તેથી હિંમત રહે છે. તાવ કેંક ઓછો થયો એટલું સારું ગણાય. વારંવાર પગ ઊંચાનીચા કરે છે ને બેઠા થવાનું કર્યા કરે છે તે સારું નહિ, કંઈક થોડે અંશે તે સન્નિપાતનું લક્ષણ ગણાય ખરું. પાઉડર વાંસે ને કમરે લગાવો છો તે સારું છે. વારંવાર ભગવાનનું નામ લે છે. તે તો ડોક્ટરને અમે પૂછ્યું તો કહે કે તે તેના સબ્કોન્સ્યસ માઈન્ડ(અર્ધ જાગ્રત મન)માં ઉત્તરેલું હોવાથી તેમ કરે ને બોલે. ડોક્ટર તો કહે છે કે જો આઠદસ દિવસ દર્દી ખેંચી કાઢે તો પચાસ ટકા આશા વધે ખરી. ભગવાનની કૃપાથી તમો બધાં ખૂબ હિંમત રાખજો. હું જાણું છું કે આપણે ઘોર નિરાશામાં છીએ તોપણ આપણે આત્મવિશ્વાસ દફાવી દફાવીને હું તો ભગવાનની પ્રાર્થનામાં જ રહ્યા કરું છું. અત્યારે તો બાબુભાઈનું સ્મરણ એ જ મારે માટે તો ભગવાનનું સ્મરણ છે. બાબુભાઈ તેમના મળતાવડા સ્વભાવથી બધાંને પ્રિય થઈ પડેલા છે, તેની

તો મને ખબર છે. આપણે હોસ્પિટલના ડૉ. એ. ડી. દેસાઈ કહે તેમ જ કરવું. આપણે પોતાની મેળે કરીને બીજા કોઈ ડોક્ટરને બોલાવવાનું કરી શકાય જ નહિ. કુંજરાવમાં પી. ટી.ને ખબર પડતાં તે ત્યાં દોડી આવ્યા તે બાબુભાઈ પરત્વેનો તેમનો પ્રેમભાવ સૂચવે છે. મારે તો તમો બધાંની હિંમત વડે ટકવાનું છે. માટે, તમે બધાં ખૂબ હિંમત રાખજો અને જ્યારે લાગી આવે ત્યારે ખૂબ પ્રેમથી પ્રાર્થના કરજો. સુરણ તો એકધારું ઘરમાં જ કરજો ને મને કાગળ લખતા રહેજો. □

### કટોકટીમાંથી બહાર

પ્રિય નટુભાઈ તથા મોહનભાઈ, તા. ૨૮-૮-૧૯૬૨

બાબુભાઈને હજુથ મેનેન્જાઈટીસનાં લક્ષણો લાગે છે, તેમ છતાં જોખમ કે ભય હવે નથી, પણ મેનેન્જાઈટીસનો રોગ ગંભીર ગણાય તો ખરો. અને હવે જો બાબુભાઈ થોડાધંશા પણ ભાનમાં આવ્યા હોય તોપણ જો આઠદસ દિન બેંચી કાઢી શકે તો આપણને સારી નિરાંત મળે. હજુ ટ્યૂબ વાટે પેશાબ થાય છે, તે પણ અહીંના કોઈના કહેવા પ્રમાણે ખરાબ ચિહ્ન નથી. આપણે તો પ્રાર્થના કર્યા કરવી.

આજે સવારે કાગળ લખ્યા પછીથી અને તે લખાયો એટલે મને પણ સારું લાગે છે. અને તમારા બધાંની હિંમતથી હું તો તે કાગળમાંના ભાવ પ્રમાણે જ ભગવાનને પોકાર્યા કરવાનો છું. હું જાણું છું કે ભગવાન કંઈ આપણો ગુલામ નથી. તેમ છતાં સદ્ગુરુનને વિકસાવવાની પ્રાર્થના જો ખરેખરા શુદ્ધ હદ્યથી કરેલી હોય તો બાજુ બદલી શકાય. પ્રાર્થનાઓ કરતાં ભક્તિભર્યા જીવનને વિકસાવવા માટે પ્રાર્થનામાં વધારે ગ્રાણ ઊગી નીકળી શકે ખરા. ભગવાનની કૃપાથી બાબુભાઈ બચી

જય અને જીવે અને આપણા બધાંના મુખ હસતાં રહે ત્યારે  
 જ મારા દિલમાં તો ભગવાનની કૃપાની ધન્યતા અનુભવાશે.  
 અમારા દિલમાં તો બાબુભાઈ જે છે તે છે અને એ દ્વારા તમારાં  
 બધાંના દિલનો ભાવ મેળવવા ભાગ્યશાળી થયો છું, તે તો કેમ  
 કરીને ભૂલી શકાય ? તમે બધાંએ હેતથી સાથ આચ્યા કર્યો છે,  
 તે બદલ તો તમને શું લખું ? આશ્રમની સંસ્થા લઈને બેઠો છું  
 અને સુરતનો આશ્રમ તેટલો પાસે હોત તો અવારનવાર મળી  
 જવાનું કરત. તમે બધાં ખૂબ પ્રાર્થના કરજો. □

### શરીરજીવનને ટકાવવા

પ્રિય નટુભાઈ તથા મોહનભાઈ,

તા. ૨૮-૮-૧૯૬૨

કણ વળતી નથી. બાબુભાઈનું શરીરજીવન કેમ કરીને ટકે  
 એ જ વિચારધારામાં વળ્યા કરવાનું બને છે. પ્રાર્થના તો ચાલુ  
 જ છે. આજ રાતે ભગવાનને કહ્યા જ કરતો હતો ત્યાં એવું  
 સમજાયું કે જો બાબુભાઈ હવે તેમનું ભવિષ્યનું જીવન  
 ભગવાનની ભક્તિમાં ગાળવાનું કરે ને તમે બધાં તેમાં પ્રેમથી  
 સંમતિ આપો ને તે પણ માત્ર કહેવાની ખાતર નહિ, પણ  
 ખરેખરા દિલથી તો કદાચ ભગવાનને ધા નાખવાની મારા  
 દિલની પ્રાર્થનામાં કદાચ સાચો રણકાર એની કૃપાથી પ્રગટે.  
 આપણે બાબુભાઈના જીવનને ભગવાનનાં ચરણકમળમાં  
 સમર્પી દઈએ ને તે પણ પ્રેમથી. ભગવાનને આપણે ખરેખરા  
 દિલના ભાવથી જણાવીએ કે ‘હે પ્રભો ! આ બાબુભાઈનું  
 જીવન પણ તમારું છે. જો જીવે તો તે તમારી ભક્તિમાં બાકીનું  
 જીવન ગાળે એવું અમે બધાં તેના શરીરનાં સગાંવહાલાં પ્રાર્થના  
 કરી તારી આગળ તે વચ્ચન લઈએ છીએ, તો તેમ હવે તારી

જેમ મરજી હો તેમ બનો !’ આપણે બધું જ એને સોંપી દેવું.  
 આમેય બાબુભાઈનું અંદરનું મન તો ભગવાનના સ્મરણમાં  
 છે. એની ખાતરી તો બધાંને થઈ છે. નહિતર તદ્દન બેભાન  
 અવસ્થામાં તેમનાથી વારેઘડીએ એનું નામ લેવાનું બની શક્યું  
 ન હોત. તમે બધાં કૃપા કરીને એનું જીવતર આ અર્થે જ ટકે  
 એવો નિશ્ચય જાહેર કરો ને પછી મારા જેવા અબુધની  
 પ્રાર્થનામાં બળ પ્રગટી શકે તો પ્રગટી શકે. બાબુભાઈ મને  
 કેટલા વહાલા છે, તેની સમજણ કદાચ તમને નહિ પ્રગટી  
 શકે. ભગવાને જ કૃપા કરીને બાબુભાઈનો ભેટો મને કરાવ્યો  
 છે ને તે પણ તેમને ભક્તિના માર્ગમાં પ્રેરાવવા કાજે જ. શરૂ  
 શરૂમાં તેઓ મારી પાસે આવતા જતા ને આશ્રમમાં વધારે  
 સમય ગાળવાનું કરતા ત્યારે તે વિશે તમને બધાંને અણગમો  
 તો થયા કરતો હતો, પરંતુ ધીમે ધીમે પ્રભુકૃપાથી તમે બધાં  
 પણ થોડું ધાણું પણ વળ્યા ને હવે બાબુભાઈને તમે પ્રેમથી આ  
 માર્ગ જ બાકીનું જીવન ગાળે તેવી પ્રતિજ્ઞા લો. એમ કરીને  
 તેમણે ગૃહસ્થાશ્રમ તો છોડવાનો નથી, પરંતુ તેમણે તેમનું  
 સમગ્ર લક્ષ તો ભગવાનની ભાવના પરત્વે ગળાય તેવી  
 ગતિમાં ગાળવાનું છે. જીવી જાય ત્યારે ને તદ્દન સાજ થઈ  
 ગયા કેડે તેમને આપણે ઉપરની વાત કરીશું ને તે પછી તેઓ  
 જેમ નિર્ણય લે તે પ્રમાણે આપણે તેમને સ્વતંત્ર રાખીશું.  
 આપણે પોતે તેમને કોઈ રીતે બળજબરી તો નહિ કરીએ.  
 તેમના સ્વતંત્ર મતથી તેમને વર્તવા દેવાનું કરીશું. માટે, આપણે  
 હવે તેમને માટે ઉપરની પ્રતિજ્ઞા લઈએ ને જો બાબુભાઈને  
 ભક્તિભર્યું જીવન જીવનું હોય તો આપણે બધાં તેમને પ્રેમથી  
 તેમ કરવા દઈશું. ને કોઈ પણ રીતનો વિરોધ નહિ કરીએ,

એવું મનમાં ને મનમાં દૃઢાવવાનું સાચી રીતે કરીએ તો પ્રભુકૃપાથી જીવન જીવતું થવાના પલ્લામાં ભગવાનની કૃપાનું બળ ઉમેરાય. માટે, કૃપા કરી નિશ્ચય કરી મને તુરત તાર કરજો. એટલી તમને કાકલૂદીભરી પ્રાર્થના છે. અમારું દિલ તો કેવું દ્રવે છે, તે કહેવાથી શું લાભ ?

□

## સહકારની જરૂર

પ્રિય નદ્દુભાઈ તથા મોહનભાઈ,

તા. ૨૮-૮-૧૯૬૨

આજ બપોર પછી તમને ટ્રેકકોલ કરીને બાબુભાઈના સમાચાર મેળવવાને મન ધણું તલવાપડ થયા કરે. એવામાં નડિયાદથી કારમાં એક ભાઈ મને મળવા આવ્યા ને તેમને ત્યાં ફોનની સગવડ હતી. એટલે શહેરમાં જઈને તમને અરજંટ કોલ કર્યા. લગભગ ૪૦ મિનિટ બેસી રહેવું તો પડ્યું. તમારાં બધાંની બાબુભાઈના ભાવિ જીવન અંગેની સંપત્તિ મળી તે ભગવાનની કૃપા સમજું છું. ભગવાન પરત્વેની પ્રાર્થનામાં હવે મને વધારે ચેતન પ્રગટશે. તમારાં બધાંનો તેમાં સહકાર છે, તે જાણીને આનંદ થયો. ભગવાનને ચરણે બાબુભાઈનું જીવન આપણે સમર્પિએ, તો તે પ્રકારની પ્રાર્થનાથી પ્રભુકૃપાથી જરૂર સારું પરિણામ આવી શકે તેવો વિશ્વાસ પણ એની કૃપાથી હવે પ્રગટવા માંડ્યો છે. મારી તો ભાઈને ખાસ પ્રાર્થના છે કે તે આશ્રમની વિરુદ્ધનું ધણી ધણી વાર બોલે છે. મને તેનો વાંધો નથી ને મેં તે અંગે કશી ફરિયાદ પણ કરી નથી, પરંતુ આ કટોકટીના કાળે ભાઈનો તેના ખરેખરા દિલનો સહકાર મળે તે ધણું જરૂરનું છે. માટે, મારે આ લખવું પડ્યું છે. મને પોતાને બાબુભાઈને માટે કેવી લાગણી છે, તે કંઈ મારે તમો

બધાં આગળ સાબિત કરી બતાવવાની જરૂર ન હોય. હવે તો ભગવાન એને બચાવે એ જ એક પ્રાર્થના છે ને એમાં જ હું તો એની કૃપાથી મચેલો રહ્યા કરીશ. □

## સ્વજન સાથે એકરૂપ

મ્રિય નદ્વાઈ તથા મોહનભાઈ,

તા. ૩૭-૮-૧૯૬૨

આખો શ્રાવણ માસ શ્રીભગવાનના નામનો અખંડ સ્મરણશ્યક્ષ હતો. ને આજ સવારે પૂર્ણાહૃતિ હતી. એટલે વહેલી સવારે નાદિયાદથી નીકળીને અહીં આવ્યા છીએ. હું છું ફરું છું અને બધી જ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે, પરંતુ દિવમાં તો બાબુભાઈ જ. આજે તમો તરફથી કંઈ કાગળ મળ્યો નથી. આમેય ઘણી જૂની કહેવત કે ‘No news is good news’. દિવસ ખેંચાતા જાય છે, તે એક બહુ સારું લક્ષણ છે. ને જે ઘડીએ ભાનમાં પ્રગટ્યા ત્યારે આપણે માટે તો તે નવો દિવસ. પહેલવહેલા સુરતમાં પ્રભુકૃપાથી એકવીસ દિન રહેવાનું થયું હતું ત્યારે શરૂઆતથી બાબુભાઈ રોજ આવતા. કંઈ બોલેચાલે નહિ. કંઈ પૂછે પણ નહિ, પણ આવતા નિયમિત. ત્યારથી તેમનું ચિત્ત પ્રભુકૃપાથી અમારામાં લાગેલું છે. ભગવાનની કૃપાથી કોઈનોય સંબંધ ખોળવા જવાનું બનતું નથી, પરંતુ જે સંબંધ એની કૃપાથી થવા દે, તેમાં અમારું દિલ તો રહ્યા કરે. ને એમ તો કેટલાય જીવો માંદગીમાં ને રોગના હુમલાથી પટકાયેલા પડ્યા હોય છે, પરંતુ બાબુભાઈનામાં પ્રભુકૃપાથી અમારું લક્ષ છે, તે તો કોઈ બીજા પ્રકારનું છે.

બાબુભાઈ ભાનમાં આવે એટલે અમને તાર કરવાને લઘું છે. ભાનમાં આવે ત્યારે મોટાના વતીના તમે નમસ્કાર કરજો. તે પછી પણ આપણે સંભાળ અને કાળજી બહુ રાખવી પડશે.

પેટમાં જરાપણ વધુ પડતું ન જાય તેની કાળજી રાખજો અને ડોક્ટર તેમના અંગે જે કંઈ કહે તે બધું વિગતવાર મને લખજો. તમારાં બધાંની સાથે મારી હમદર્દી છે. □

## નિરાશામાં આશા

પ્રીય ભાઈ ચંપક,

tl. ૧૮-૧૮૬૨

મને પણ બાબુભાઈનો રોગ તો ઘણો ગંભીર લાગે છે. ગમે તેવી નિરાશામાં નિરાશા હોય છતાં આશા રાખીને વર્તવું ઉત્તમ. ડૉ. શાંતારામે મને સલાહ આપી છે કે મારે ત્યાં હાજર થવું જ પરંતુ અત્યારે તો હું સાબરમતીમાં છું. મારી સ્થૂળ હાજરીથી ત્યાં કશું સારુંખોટું થવાનું હું માનતો નથી. જો ભગવાન મારું સાંભળવાનો હશે તો ગમે ત્યાં હું ભલેને હોઉં ત્યાંથી તે સાંભળશે. આજે તો દસમો દિન છે. આવા કેસમાં વીસથી પચીસ દિન પણ બેભાન અવસ્થા રહે છે. બાબુભાઈની બાબતમાં નાયાદમાં પણ સારામાં સારા ડોક્ટરને પણ મળતો રહું છું. સારામાં સારા એક ફિઝિશિયન છે. તેમને પણ મેં આશ્રમમાં નાયાદમાં આવતા ડોક્ટર દ્વારા પુછાવી મંગાવ્યું હતું. ભગવાનની કૃપાથી હું તો એની પ્રાર્થનામાં માનવાવાળો જીવ છું. એ પ્રાર્થનાનો ભાવ જીવનું કલ્યાણ કરનારો જ છે, તે હવે તો બાબુભાઈ જીવે તો તેઓ ભક્તિમય માર્ગનું જીવન જીવે ને તેમનો નિશ્ચય થાય, તો તેમના બાકીના સમર્પિત જીવન માટે ભગવાનની કૃપાથી આશા રાખી બેઠો છું. ૧૪ દિન કરતાં પણ બેભાન અવસ્થામાં તેમના દિન જાય અને તેના કરતાં પણ વધુ જાય તેમ ડોક્ટરોનું કહેવું છે, પણ જેટલા દિનો વધુ જેંચાય તેટલું ઉત્તમ છે. માટે, હવે તો દિવસો જેંચાય છે, તેમ આશા વધુ બંધાતી જાય છે. □

## બીમારની સારવારકળા

પ્રિય નટુભાઈ તથા મોહનભાઈ,

તા. ૨-૮-૧૯૬૨

ડોક્ટર ગમે તે કારણસર આપણા ઉપર અકળાઈ જાય તેથી આપણે મનમાં લાવવું નહિ. આપણો કેસ ગમે તેવા હોશિયાર ડોક્ટરની પણ ધીરજનો અંત લાવે તેવો છે. આપણે ડોક્ટરની ઉપરવટ કશું કરવું નહિ. બાબુભાઈની બેભાન અવસ્થાનો આજે અગિયારમો દિન છે. બાબુભાઈ તેમનું બાકીનું જીવન પ્રલુપ્તિયર્થે જીવવાનો જો નિશ્ચય કરે, તો તેવા જીવનની પાસે ભગવાનની પાસે મારી પ્રાર્થના છે. તેમ છતાં મારા કોઈ વચનથી તેમને હું બાંધી દેતો નથી. હું તો ભગવાનને પ્રાર્થના દ્વારા જણાવું કે ‘હવે આ કરમાવા માંડતું ફૂલ તારે અર્થે જ જિંદગી જીવે તે માટે તેને તું ચેતન બક્ષ.’ આપણે કોઈએ હિંમત હારવાની જરૂર નથી અને જેટલા આપણે હિંમત રાખીને શ્રદ્ધા પ્રગટાવીને ભગવાનના સ્મરણમાં રહીશું, તે આપણે માટે જેટલું ઉત્તમ છે તેટલું જ નહિ પણ બાબુભાઈ માટે સવિશેષ. આપણે ભગવાનની કૃપાથી હંમેશાં શ્રદ્ધા કેળવી કેળવીને આપણે સકામ પ્રાર્થના પણ કરીએ ને એવી પ્રાર્થનાનો હેતુ ભગવાન સમર્પિત જીવનને માટે હોય, તો તેવી સકામ પ્રાર્થના પણ એક પ્રકારની નિષ્કામ બની જાય. માટે, આપણે ભગવાનને વિશેષ મહત્ત્વ દેવું. ને આવા નિમિત્તે આપણને એને ભજવાનો લહાવો મળ્યો ને એવી ગરજને કારણે આપણું દિલ એવી પ્રાર્થનામાં પરોવવાપણું બન્યું તે પણ ઉત્તમ છે. મારા ત્યાં દોડી આવવાનો કશો અર્થ નથી. તમો બધાં હિંમત રાખજો.

□

મિય નદુભાઈ તથા મોહનભાઈ,

તા. ૩-૮-૧૯૬૨

ડોક્ટરોએ કહ્યું કે ગાડી હવે પાટા ઉપર આવી ગઈ છે. તો તે આનંદના - ઘણા આનંદના - સમાચાર છે. હવે જ ધીરજનો પ્રશ્ન રહે છે. બાબુભાઈને બોલાવવાનો હવે પ્રયત્ન ના જ કરવો અને કાળજીપૂર્વક તેનો અમલ કરવો. આપણે સગાંવહાલાં બધાં તેમને કંઈ કશું પૂછીએ કરીએ નહિ તે ઘણું જરૂરનું. તેમને ઘોંઘાટ ન લાગે ને શાંતિ રહે તેવું વાતાવરણ તે ઓરડામાં રાખશોજી. આપણે બધાંએ મનમાં મનથી પ્રાર્થના કરવાનું તો ચાલુ જ રાખવું અને સ્મરણ પણ કર્યા કરવું. ઓરડામાં કશો ઘોંઘાટ ના થાય તેની ઘણી ઘણી કાળજી રાખવી. □

### પ્રભુકૃપાનાં દર્શન

મિય નદુભાઈ તથા મોહનભાઈ,

તા. ૬-૮-૧૯૬૨

બાબુભાઈને શ્રીપ્રભુકૃપાથી ભાનમાં આવેલા જોઈને પ્રભુની અનહદ કૃપાનાં દર્શન મને તો થયાં. હજુ જ્યાં સુધી તેમના શરીરમાંનો તાવ તદ્દન નોર્મલ થતો નથી, ને તે તદ્દન નોર્મલ જ રહે તે જરૂરનું તો ખરું, ને ત્યારે જ આપણને પૂરી નિરાંત મળી શકે. ભયંકર મરણતોલ કટોકટી તો ગઈ ગણાય. હજુ તાવ આખા દિવસનો પળે પળ તદ્દન નોર્મલ રહે ત્યારે જ આપણે બાબુભાઈની બાબતમાં જમીનની તદ્દન સર્વસાધારણ યોગ્ય સપાટી ઉપર આવી ગયેલા ગણાઈએ.

બાબુભાઈને કશો જ શ્રમ આપણાં સગાંવહાલાં તરફથી ન આપવામાં આવે, તે ઘણું ઘણું જરૂરનું ને તે માટેની પાકી વ્યવસ્થા થવી ધટે, ને તે માટે હવે જ તમારો ચોકીપહેરો ખાસ ખાસ વધારે જરૂરનો ગણાય. તમે મક્કમતા રાખીને

તथા એવી બાબતમાં પૂરા કડક રહી શકે એવી વ્યક્તિ આપણાં બધાંમાં એકમાત્ર તમે જ છો. તેથી, બાબુભાઈના હવે પછીના ગાળામાં તમારી હાજરી વિશેષ જરૂરની ખરી.

મને તમારી હાજરી અહીં સુરતમાં હોવાનું અનિવાર્ય લાગે છે. આ તો મારો એવો મત ને સમજણ છે. તમારામાં આમ કટોકટીની પળોમાં જે આત્મવિશ્વાસ હોય તે જરૂરનો. જોકે હવે જ બાબુભાઈની કાળજીવાળી દેખરેખ ને ખાવાપીવાની બાબતમાં પણ બધું જ પાકી દેખરેખ ને વ્યવસ્થાની ખાસ જરૂર. આ બધું હોવા છતાં તમારે વેલોરનું નક્કી કરવાનું રહે છે જ ને તે હવે વધારે વાર વિલંબમાં પડી જાય તે પણ બરાબર નથી. જોકે તમને બધાંને તે જરૂરનું લાગતું હોય તે તો સમજાય તેવું છે જ. તેમ છતાં જો તમારે મને મળવું હોય તો બપોર પછી ચાર વાગ્યા બાદ મળી જવાનું કરી શકાય એવું હોય તો તેમ કરજો, કારણ કે તે પહેલાં તો મારે ટપાલ વગેરે પતાવવાનું હોય છે. કૃપા કરી સાંજે તો નહિ જ.

બાબુભાઈની મારા વતી ખબર પૂછશોજુ. યોગ્ય સગવડ મળતાં જરૂર બાબુભાઈનાં દર્શન કરી જ જઈશ, તે જાણશોજુ. □

**શ્રીમોટા પ્રત્યે ભાવ**

પ્રિય નદુભાઈ,

તા. ૧૯-૮-૧૯૬૨

જત, તમારો ૧૮/૮ નો કાગળ મળ્યો. બાબુભાઈને આખા શરીરે ખૂબ બેચેની હતી તેથી કરીને ડોક્ટરોએ નળી વાટે કશીક દવા આપવાનું જણાવ્યું. બાબુભાઈને શરીરે બેચેની અને વેદના એટલી બધી હતી કે તેઓ જેર પણ માગતા હતા. મારા શરીરનો જન્મદિન ૧૭મીએ હતો, તેવી તેમને ખબર

પડવાથી વહેલા ઊઠી, સ્મરણ કરી મોટાની પ્રતીમાને હાર પહેરાવ્યો, તે તેમનો મારા તરફનો સદ્ગ્રાવ સૂચ્યવે છે. મારા માટે તેમના દિલમાં જે ભાવભક્તિ અને શ્રદ્ધા છે, તેથી કરીને જ મારાથી તેમના માટે આટલું પ્રભુકૃપાથી મથી શકાયું છે. એટલે ખરું મહત્વ તો તેમના ભાવનું છે. મારું તો કશું નથી. બાકી, બીજાં કોઈને માટે મારાથી આટલું કશું પણ થઈ શકે નહિ. બાબુભાઈને મારા વતી ઘણું ઘણું કરીને વહાલ કરજો અને બધાંની ખબર પૂછજો.

□

## જન્મદિનની ઉજવણી

પ્રિય નફુભાઈ,

તા. ૨૧-૮-૧૯૬૨

જત, તમારો ૨૦/૮ નો કાગળ મણ્યો. બાબુભાઈને ઊંઘ આવતી ન હતી, તે બે પડીકાં આખ્યાં તેને કારણે તેમને ઘણી ઊંઘ આવી ને તેથી બેચેની ના રહી ને સારું લાગ્યું. એ બધું જાણ્યું. હજુ એમને શરીરે ઘણી અશક્તિ છે. તેથી, મને તો લાગે છે કે તેમને દવાખાનામાં હજુ વધુ દિનો રાખી શકીએ તો વધુ સારું. અહીં પણ શેઢી નદીમાં મોટી રેલ આવી છે. ને અવરજવરનો યુઝવલ(સામાન્ય) રસ્તો બંધ થયો છે. ત્યાં તાપીમાં મોટી રેલ જરૂર આવી હશે.

તમારા શરીરનો જન્મદિન રૂમીએ હતો તે જાણ્યું. જન્મદિવસ એ જીવનમાં પ્રેરણા પ્રગટાવવા માટે અને માનવ શરીરની મહત્ત્વ પ્રગટાવવા માટે ઘણો મોટો પ્રસંગ છે અને જન્મદિન સારી રીતે ભાવનામાં, સ્મરણમાં, પ્રાર્થનામાં એકધારો વીતે તથા તે દિને જાણી કરીને સમજ કરીને સભાનપણે કોઈક પરોપકારનું કર્મ બને તો તેથી જીવનું કલ્યાણ થાય છે. સામાન્ય રીતે તે દિને આપણે મિષ્ટાન્ન વધુ

ઉડાવીએ છીએ અને બધો સમય એમ ગુમાવીએ તે તદ્દન  
ખોટું છે. □

વહાલા બાબુભાઈ,

તમારા શરીરનો જન્મદિન ૨૨મીનો હોવાનું જાણ્યું છે. તે દિને છોકરાંઓને મીઠાઈ-નાનખટાઈ જેવું આપવાનું નક્કી કર્યાનું જાણી બહુ રાજી થયો. તે દિન તમો સ્મરણમાં, પ્રાર્થનામાં, ભજનમાં અને સદ્ગુરુચન્દ્રમાં ગાળજો. અને વાતો કરવાની થાય તો તે પણ સત્સંગની કરજો. આ બધા ઉપાય સિવાય બીજી રીતે તે દિનનો ઉપયોગ કરશો નહિ. તમારું જીવન એ કોઈ ઊંચા હેતુને માટે છે. આપણે સંસારવહેવારનાં સકળ કામ કરતાં કરતાં આપણું દિલ ભગવાનની ભક્તિથી રંગાયેલું રહે તે જ આપણું મોટામાં મોટું કામ છે. તે એવા પ્રકારની જાગૃતિ તમને પ્રગટો તેવી પ્રાર્થના છે. □

પ્રિય નટુભાઈ તથા મોહનભાઈ,

તા. ૨૫-૮-૧૯૬૨

જત, કાગળ વાંચ્યો. બાબુભાઈની જે શ્રદ્ધા છે તેને ટેકો આપવો. તમારે જે દિવસે ઘેર લઈ જવા હોય તે દિવસે ઘેર લઈ જજો. ઘેર પ્રવેશ કરી પહેલું કામ ભજન, પ્રાર્થના, સ્મરણનું અડધો કલાક પણ કરજો. આશ્રમમાં મોટરમાં તદ્દન ધીમે ધીમે લવાય અને મોટરમાંથી બાબુભાઈ ઉતરે કરે નહિ ! તેઓ અંદર બેઠાં બેઠાં જ અમારાં દર્શન કરી લે. એટલે એમના દિલને પૂર્ણ સંતોષ થાય. □

ડોફ્ટરની સલાહ પ્રમાણે વર્તન

પ્રિય નટુભાઈ તથા મોહનભાઈ,

તા. ૩૦-૮-૧૯૬૨

જત, તમારા તરફથી બે પત્રો મળ્યા છે. તથા ગઈકાલે સાંજે જ વાગ્યે અરડીના મુખી-બરડામાંથી જે રસ કાઢેલો તેનો રિપોર્ટ

(પેથોલોજિકલ) લઈને પત્ર સાથે આવ્યા હતા. તે રિપોર્ટ તથા આગલો રિપોર્ટ ડોક્ટરને બતાવ્યો. બંનેમાં જારો કશો ફરક નથી. તેમનું એમ કહેવું છે કે રિપોર્ટમાં પરુનાં ચિહ્ન નથી એટલે કદાચ મેનેન્જાઇટીસ તો ના હોય, પણ એ તો ત્યાંના ડોક્ટરો કહે તે આપણે માનવું. હું તો હવે બાબુભાઈ જીવે જ એવી શ્રદ્ધા-આત્મવિશ્વાસથી અને તમો બધાંના ટેકાએ પ્રાર્થનામાં જરૂરી રહ્યો છું. જ્યાં સુધી બાબુભાઈનું શરીર બેભાન છે ત્યાં સુધી કટોકટી પાકી અને ગંભીર પણ ખરું. પરંતુ આપણે તો ભગવાનની પ્રાર્થનામાં જ મચ્યા રહેવાનું છે. મારો આધાર તો એની પ્રાર્થના ઉપર છે. અને બાબુભાઈ, એ તો આપણાં બધાંને ટેકાડુપ છે. આ દિવસોમાં જેટલા તે યાદ આવે છે ને તેમનું સ્મરણ થાય છે, તેટલું તેમનું સ્મરણ કદી પણ થયું નથી. આપણે તો આશાવાદી થઈને જ મથવાનું છે. તમારાં બધાંની હદ્યની શ્રદ્ધા મને બળ આપે છે. કૃપા કરીને તમો બધાં પૂરેપૂરી હિંમત રાખજો. જેટલા દિન બેંચાય છે તે ઘણું સારું થાય છે. ભગવાનની કૃપાથી ભાનમાં આવે ત્યારે વળી વધુ નિરાંત થાય. તેમના આગળ ગરબડ થવા દીધા સિવાય ભગવાનનું સ્મરણ થાય અને મોટાના પુસ્તકનું વાંચન થાય તો તે બધું બાબુભાઈ માટે સારું ખરું. હવે તે હરિઝિઓં બોલે છે ખરા ? દવા વગેરે કે પાણી કે દૂધ પોતાના હાથમાં લઈને પી શકે છે ખરા ? તે બધું મને ‘મોટા’ હરિજન આશ્રમ, અમદાવાદ-૧૩. એ સરનામે લખજો. શનિવારે એક્સપ્રેસ ડિલિવરી ઉપરના સરનામે લખજો. અને રવિવારે લખો તો નડિયાદ લખજો. બાબુભાઈ જો ભાનમાં આવે તો મને ગાંધી આશ્રમના સરનામે તાર કરાવજો. □

## શરીરની કાળજી

વહાલા બાબુભાઈ,

તા. ૪-૧૦-૧૯૬૨

જત, તમારે વેર જઈને હવે જ તમારે તમારા શરીરની વધારે કાળજી રાખવાની છે. શરીરને વધારે શ્રમ પડે તેવું કશું જ કરશો નહિ. જો ઉપર જાજર હોય તો ત્યાં જ જાજર જવું. નાહવું કરવું પણ ઉપર જ. ફરવું કરવું હોય તો મેરે જ તેમ કરવાનું. હમણાં નીચે ચડકિતર કરવાની જ નથી. તમે કૃપા કરી ઘણી ઘણી કાળજી રાખજો. ઉથલો જો ખાધો તો મારા બાર વાગી જશે. તમારા શરીરની શરૂઆતની માંદગી કેવી ને કેટલી ગંભીર હતી તેની તમને તો શી ખબર પડે ! આઠ દિવસ તો પ્રભુકૃપાથી ઉંઘાયું જ નથી. આઠ દિવસનું અનુષ્ઠાન લેવાનું બનેલું ને સતત પ્રાર્થના કરી. હવે, તમે જો વધારે ઉઠબેસ કર્યા કરો ને વધારે હરોફરો તે ઠીક નહિ. માટે, તમારે મારા ઉપર કૃપા કરવી.

□

હમણાં મૌનએકાંત નહિ

નડિયાદ,

પ્રિય બાબુભાઈ,

તા. ૪-૧૦-૧૯૬૨

જત, તમારો કાગળ મળ્યો છે. ને મારા કાગળ પ્રમાણે તમો વર્તશો. તે અમને તમારા ઉપર બહુ હેત ઉપજે છે. તમારું શરીર બહુ ગંભીર ને બધાંએ આશા મૂકી દીધી હતી. ત્યારે મને કેટલી ફિકર ચિંતા થતી હતી ! અને નડિયાદ જઈને ડો. જી. સી. પટેલને બધાંને પૂછતો અને આઠ દિન અને બીજો હપ્તો પાંચ દિનનો એમ સતત પ્રાર્થનાનો એકધારો પ્રયત્ન ચાલ્યા કરતો. આવી કટોકટીમાં નટુભાઈએ ભારે હિંમત બતાવી અને ભારે વિશ્વાસ રાખ્યો.

હમણાં તમો મૌનમાં બેસવાનું કરો તે બરાબર નહિ. હજ

પંદરવીસ દિન જવા દો અને મૌનમાં બેસવા માટે બધાંની સદ્ગ્રાવપૂર્વક સંમતિ મેળવી લો. પછી આપણે ઘટતું કરીશું. ભગવાનનું નામ લીધા કરજો.

□

## વહેવાર વ્યવસ્થા

પ્રિય બાકુભાઈ,

નડિયાદ,

તા. ૨૦-૧૨-૧૯૬૨

જત, તમારો ૧૮/૧૨નો કાગળ મળ્યો છે. સંચા લેવાની હકીકતમાં મોહનભાઈ, નટુભાઈ બધા જ સંમત થયા છે અને હાલનો મંદીનો ગાળો છે અને પરમિટ પાંચ હજારે પણ મળવી મુશ્કેલ હતી, તે ૨૫૦૦/૨૮૦૦ માં મળી શકે તેવું થયું છે. એટલે છોકરાંઓને ઠેકાણે પાડવા માટે તે લેશો. તેમાં કશો વાંધો નથી, પરંતુ કોઈની દોરવાણીથી આવાં કામ થાય નહિ. છોકરાંઓ પોતે ઉમંગ, ઉત્સાહ, ખંત, કાળજી રાખીને બધું કામ બરાબર શીખી લે અને તે કામ શીખવામાં ધગશ રાખે અને તે અંગે તમારે પણ બરાબર દેખરેખ રાખવી જોઈએ. જો છોકરાંઓ કામ શીખવામાં ધગશ, ઉત્સાહ અને કાળજી ના રાખે અને બરાબર કામ ના કરે તો સોના સાઠ પણ થાય. હાલનો ગાળો મંદીનો છે. એટલે આપણાને ખોટ જશે એમ વિચારીને આ કામ કરવાનું. પહેલેથી વિચારીને કર્યું હોય તો પાછળથી આપણાને અફસોસ ના થાય. બાકી, છોકરાંઓને ઠેકાણે પાડવાનું કરીએ તો તે ઉત્તમ. છોકરાંઓને પોતામાં ઉત્સાહ પ્રગટવો જોઈએ તે મૂળ વાત છે. એટલા માટે તમે મોહનભાઈને ખાસ પાછા મોકલ્યા તેવી તમારી ભાવનાની કદર કરું છું. હું તો તમારા કાગળનો જવાબ આજે તરત જ લખત. મને તો આ નિમિત્ત મોહનભાઈને મળવાનું થયું તે ગમ્યું. આપણા પોતાના ભાઈઓની પણ તમે સંમતિ મેળવી લીધી છે, તે સારી વાત છે.

આ વાત તેમની આગળ મૂકેલી તો ખરી જ અને તેમની પણ સંમતિ લેવી જ. જેથી માંહોમાંહે કશો ઝડપો ના ઉપજે. તમે પોતે માંદગીમાં તથા હાલના બીજા સમયમાં છોકરાંઓને ઠેકાણો પાડવાનું વિચારો છો, તે સારી વાત છે. આખરે તો છોકરાંઓમાં જેવું હીર હશે તેમ થવાનું. આપણો આપણો ધર્મ પાળવો અને છોકરાંઓને કામધંધે વળગાડવા. અને તેમ કરીને તેમને બહુ જ પ્રેમથી ને કામ પરત્વે ધગશ અને ઉત્સાહ પ્રેરાવવા માટે તેમાં પ્રગટતા રહેવું. હાલના મંદીના કાળમાં સંચા લેવા તે તો સારું પગલું છે અને તેમાં મારી સંમતિ છે.

□

નાન્દિયાદ,

મૃય બાબુભાઈ,

તા. ૮-૨-૧૯૬૮

જત, તમારો કાગળ મળ્યો છે. તમને મગજ ભારે ભારે લાગતું હતું તેમાં રાહત થઈ છે, તે જાણી રાજી થયો છું. ડોક્ટરને શરીર બતાવી આવ્યા હશો.

□

હરિસ્મરણ જળવાઈ રહે તેમ તેનો અભ્યાસ ભક્તિથી કર્યા કરશો.

નાન્દિયાદ,

મૃય બાબુભાઈ,

તા. ૮-૨-૧૯૬૮

કારખાને જવાથી તમને માથાના દુખાવાનો અનુભવ થયો તે સારું થયું. તેથી, તમને પોતાને અનુભવ થયો કે હજુ તમારું શરીર કામ કરવાને લાયક થયું નથી. ડોક્ટરને બોલાવ્યા તે પણ સારું કર્યું. ઈજેક્શન લેવાનું અને દવા લેવાનું ડોક્ટરની સલાહ પ્રમાણે કરજો. શરીરને શ્રમ ન પડે તેમ વર્તવાની ડોક્ટરે સલાહ આપી છે. એ ઉપરથી તમને સમજાશે કે જે તમને આશ્રમમાં બહાર રહેવાની ના પાડી હતી, તે કેટલું બધું

યોગ્ય હતું, કારણ કે આશ્રમમાં તો કંઈ ને કંઈ કામકાજ માટે આંટાફેરા તો થયા જ કરે. નંદરબાર જવાનું માંડી વાળ્યું, તે ઘણું સારું કર્યું. ભગવાનના સ્મરણમાં, પ્રાર્થનામાં, સદ્ગુરુચનમાં તમારો બધો સમય ગાળજો. સંસારવહેવારની વાતોમાં દિલને પરોવશો નહિ. બહારના આવનારા બીજા માણસોની સાથે પણ સંસારવહેવારની કશી વાત કરવી નહિ. સત્સંગની વાત કરવી.

□

‘મળ્યાં’નો હેતુ

પ્રિય ભાઈ,

નાયાદ,

તા. ૬-૭-૧૯૬૩

(શિખરિષ્ણી)

મળેલાં જો છીએ નિજ જીવનનો ખ્યાલ કરજો,  
 મળેલાં જો છીએ સ્મરણ કરી કરી દિલ જીવજો,  
 મળેલાં જો છીએ અવરજનનું સુખ પ્રીછજો,  
 મળેલાં જો છીએ જીવન જીવવા ટેક ધરજો  
 મળેલાં જો છીએ વિપદ દુઃખમાં યાદ કરીને,  
 હૃદેમાં મોટાને સ્મરણ કરીને ઉંઠું ભજાજો,  
 મળેલાં જો છીએ જીવન જીવવા ગ્રેમ ધરજો,  
 મળેલાં જો છીએ રસબસ થવા એક બનજો.

પ્રિય બાળુભાઈ,

તા. ૮-૧૦-૧૯૬૩

મગજ ઉપર ભાર રહ્યા કરે છે, તે તો વખત જતાં ઠીક થઈ જશે. મગજશક્તિ બરાબર ચાલતી નથી, પરંતુ આપણે શ્રદ્ધા અને આત્મવિશ્વાસ રાખી ભગવાનના સ્મરણમાં જ પરોવાયેલા રહેવું. આપણે હંમેશાં આશાવાદી રહેવું. આપણી પોતાની શક્તિ કરતાં ભગવાનની શક્તિ ઉપર વિશ્વાસ

કેળવવો. ભગવાનની કૃપાથી સૌ સારાં વાનાં થશે અને મગજમાં જે થોડોધણો યાદશક્તિનો દોષ છે, તે જરૂર નીકળી જશે, એવી આત્મશ્રદ્ધા પ્રગટાવવી. ત્યાં ઘેર બધાંની અમો વતી ખબર પૂછજો. □

પ્રિય બાબુભાઈ,

તા. ૧૭-૧૧-૧૯૬૩

આખો હિન સ્મરણ, વાંચન, ભજનમાં ગાળો છો, તે સારી વાત થઈ. ચિત્તશુદ્ધિના તમારા પ્રયત્નમાં મારી તો સહાય છે જ. તેને સફળતાપૂર્વક સ્વીકારવી એ તમારા હાથની વાત છે. □  
પ્રેમી તરફથી સ્વતંત્રતા

પ્રિય નદુભાઈ,

તા. ૨૮-૧૨-૧૯૬૩

તમે 'શ્રીહરિ સિલ્ક ફેકટરી' એવું નામ રાખ્યું છે. અને ફેકટરી રાખ્યા અંગે પોતાના તમામને માહિતગાર કર્યા હતા. છતાં કોઈના તરફથી સહકાર મળ્યો નથી, તેમ તમે લખો છો. આપણે જે પગલું લીધું છે, તે જો કાયદેસરનું છે, તો પછી આપણે ડરવાની જરૂર નથી. અને જરૂર હોય પણ નહિ. મનહરભાઈને પણ તમે બધું બરાબર સમજાવ્યું છે. આપણે બધાંનો સહકાર જરૂર ઈચ્છાવો, પરંતુ ધારો કે જો તે ના મળી શકે તો શું આપણે છોકરાંઓના હિત ખાતર કોઈ સક્રિય પગલું ન ભરવું? મારી પાસે જો તેમાંના કોઈ આવશે કરશે તો તેમની વાત નહિ સાંભળું, તેમ તો હું નહિ કરું, પણ તેમને જણાવીશ કે આ જે નવું કારખાનું લીધું તે ભાગીદારીના લખાણના કાયદાથી વિરુદ્ધ છે ખરું? આ અંગે આપણે પોતે બીજો કશો ઉહાપોહ કરવો નહિ. અને બીજા કોઈ કરતા હોય ત્યારે તો તે પરત્વે જાગું લક્ષ કરું દેવું કરવું ન જોઈએ.

બાબુભાઈને મૌનમાં બેસવાની મેં કંઈ સલાહ આપી નથી. તેમને પોતાને જ મૌનમાં બેસવાની મરજ હતી. હવે, તેમને બહાર નીકળવું હોય તો તેમાં પણ હું તો રાજ છું. તેમને વેપારમાં જોડાવું હોય અને જો ડોક્ટર રજા આપે તો તે અંગે પણ મારી ના નથી. ભાઈ બાબુભાઈએ કે તમારે કેમ વર્તવું તે તમારે નક્કી કરવાનું છે. મારી પાસે તમો નક્કી કરાવો તેનો કશો અર્થ નથી. બાબુભાઈને પણ તમે આ પત્ર વંચાવી શકો છો. અને બાબુભાઈને ફરીથી વેપારના ઉપયોગના કામમાં પ્રવેશવું હોય ને ડોક્ટર તેની રજા આપતા હોય તો જરૂર બાબુભાઈ અને તમે બધાં વિચારીને કરી શકો. તા. ૩૦મીની બપોરના અઢી વાગ્યે આશ્રમે પહોંચીને તરત મારે નિરાંતથી સાંભળવાનું બને તેવી સ્થિતિ હોતી નથી. માટે, જેને મળવા કરવા આવવું હોય તો ૩૧મી થી સવારના કોઈ પણ આવે. અને બપોરના પણ અઢી વાગ્યા પછીથી, કારણ ટપાલ લખવાનો તે સમય હોય અને સવારે અનુકૂળ હોય, પણ મંગળવારે સવારે નહિ, કારણ તે દિન મૌન છૂટવાનો હોય.

□

## સાજા થયા પછી સંભાળ

પ્રિય બાબુભાઈ,

તા. ૪-૩-૧૯૬૪

એક વર્ષ સુધી બરાબર સંભાળશો. તાપમાં જશો નહિ. શ્રમ લેશો નહિ.

સદ્ગારાંચન જારી રાખશો. નામસ્મરણ બને તેટલું વધુ કર્યા કરશો. પૂરતો આરામ લેશો.

આપણા બાબુભાઈને મગજમાં રોગ થયેલો, તે અંગે એક ડોક્ટરને પૂછતાં જાણ થઈ કે એવા રોગમાં મગજની લોહીની નસોની ધારણશક્તિ અને સહનશક્તિ ઢીલી પડી જાય છે, તે

એને કારણે જો તે ગુસ્સો કે કોધ કરે કે ઉપાધિ કે ચિંતા કરે તો તેથી મગજની લોહીની નસ તૂટી જવાની શક્યતા ખરી, તો બાબુભાઈને મારા વતી ખાસ કહેશો કે તેઓ તેમના પોતાના જ હિત માટે કોધ કરવાનું ના કરે, કારણ કે તેઓ હમણાં હમણાં ડળી જતા લાગે છે, તો એટલો સંદેશો તેમને જરૂર કહેશો.

પ્રિય ભાઈ,

નાયાદ,

II. ૧૭-૩-૧૯૬૪

જત, તમારો ૧૫/ઉનો કાગળ મળ્યો છે. જો ભગવાનને માર્ગ આગળ વિકાસ કરવામાં આપણે સમયનો પૂરેપૂરો સદૃષ્યોગ ન કરી શકતા હોઈએ, તો વેપારના કામમાં આપણે જઈએ એ કાંઈ ખોટું નથી. મારી પોતાની એવી સ્વતંત્ર મરજ નથી, પરંતુ તમે ઘર કુટુંબની હકીકતોમાં અવારનવાર પડ્યા કરો અને તેમાં મન પરોવો તે તો મુદ્દલે યોગ્ય નથી. એના કરતાં તો પેઢીમાં કોઈ રોટલાનું કામ કરો તે સારું. હું તો કોઈ પણ બોલે કે લખે તેના કરતાં તેના મનની અને દિલની ધારણા કેવી રહે છે, તેના ઉપરથી તે તે માણસની જિજ્ઞાસા અને તે પરત્વેની ઝંખનાને સમજ શરુ હું. એ જ, ખૂબ મહેનત કરજો અને મથજો. તમે મૌનમાં વધારે દિવસ બેસો તેનો મને વાંધો નથી, પરંતુ પૈસા ખર્ચ થાય છે તેનું શું ! અને ભીખુકાકાને તો મૌનમંદિર ખાલી પડ્યું હોય તો આપણાને કહે બરા, પરંતુ આપણે ખર્ચ બાબતમાં વિચારવું જોઈએ. જો તે બાબતમાં તમારે કશો વાંધો ન હોય તો મારે તો મુદ્દલે નથી. □

॥ હરિ:ॐ ॥

## સ્મરણાભાવના

(હરિગીત)

પ્રિય નામને ઉરમાં સ્મર્યાં કરશું અમે બહુ પ્રેમથી,  
પ્રિય નામને ઉરમાં સ્મર્યાં કરશું અમે બહુ રીતથી,  
પ્રિય નામને ઉરમાં સ્મર્યાં કરશું અમે બહુ ખંતથી,  
તુજ નામનો પ્રભુ તંત જરી ના છોડશું હરગિજ કદી.... ૧

જીવનતણા અતિશય કઠણ દારુણ જંજાવાતમાં,  
કે સહુ દિશે સૂર્યે નહિ એવા જીવનઅંધારમાં,  
જીવનતણી ચઢતી અને પડતીમહીં પળપળ સદા,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.... ૨

સંસારનાં કર્તવ્યમાં, વ્યવહારીઓની સાથમાં,  
સહુ કામમાં, ખાતાં, પીતાં, ઊઠતાં અને વળી બોલતાં,  
જે જે કંઈ કરતાં, બધાંની સાથ વર્તતાં સદા,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.... ૩

મુશ્કેલીમાં નડતી અમોને ને ઉપાધિમાં જગે,  
જધડા અને કંકાસમાં, દિલમાં થતાં સહુ દર્દમાં,  
દિલની અમુંજણમાં અને આવી પડેલી ગૂંચમાં,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.... ૪

મનના વિચારોમાં અને મનની બધીયે વૃત્તિમાં,  
મન વાસનામાં, પાપમાં, ચિત્નના બધા સંસ્કારમાં,  
મનની રમત ને ગમતમાં, મનના રમણ ને વલણમાં,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.... ૫

અમ શરીરથી બનતી કિયામાં, હંડ્રિયોના વિષયમાં,  
અમ શરીરકેરા રોમરોમે, હૃદયકેરા લોહીમાં,  
રગ રગમહીં, નખશિખમહીં, ને શરીરના નવ દ્વારમાં,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહૃદયમાં.... ૬

ખટ રસતણા સહુ સ્વાદમાં, મીઠી મીઠી બધી વાસમાં,  
ઉર ચેતનામાં, બુદ્ધિમાં, ચિત્ત પ્રેરણામહીં, પ્રાણમાં,  
અમ લાગણીમાં, ભાવનામાં, પ્રેમમાં, રસમાં બધા,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહદ્યમાં.... ૭

આધાર સૌ નિજનો સદા માની ઉપર જે ધારતું,  
માને અતિશય વૃહાલથી જ્યમ બાલું પોકારતું,  
વિખૂટું પડેલું મારીથી હરપળ કરે શું આરડચાં !  
તેવી રીતે તુજ નામ પ્રભુ ! તારું સ્મરાજો તાનમાં.... ૮

જીવનતણા સહુ ભંગમાં, જીવનતણા સૌ રંગમાં,  
જીવનતણા એ અટપટા આડા ઊભા સૌ તારમાં,  
મારી ગમે તેવી ભલે હો સર્વ જીવનભાતમાં,  
રસીલું વણાયાં ત્યાં કરો પ્રિય નામ તારું ભાવમાં.... ૯

સંબંધીઓ ને સ્વજનની સહુ વાતમાં ને ચીતમાં,  
સંસારના વ્યવહારમાં ને જે થતાં સહુ કાર્યમાં,  
પત્ની અને પરિવારમાં છોને પરોવાયેલ હો,  
તે તે દશામાંહે પ્રભો ! તુજ નામ પ્રિય હૈયે વસો.... ૧૦

પ્રિય નામ - સૂર્ય ઊજ્યા થકી ફીટે જીવનઅંધાર સૌ,  
એવું કૃપાથી જીવનમાં અમને કૂલવજો, ફળવજો,  
ચાનક અમોને લાગજો તુજ દિવ્ય જે પ્રિય નામની,  
પ્રગટી રહો અમ જીવન તે છાયા રૂપે તુજ પ્રેમની.... ૧૧

સારાય જીવનપટતણા તાણા અને વાણા વિશે,  
ભીજાયેલા હો રગરગે તુજ પ્રેમથી રંગાયેલા,  
તુજ નામના પ્રિય સ્મરણના ઠોકે સદા ઠોકાયેલા,  
એવું પ્રભુ-પદ હો સમર્પિત આ જીવન, હો તુજ કૃપા... ૧૨

તુજ નામનો મહિમા ઋષિઓ કેંક ભક્ત કવિ કથે,  
હું તો બિચારું રાંકડું તે શું કથી કથીને કથે ?  
જ્યમ સૂર્ય આગળ આગિયો, દરિયા કને ખાબોચિયું.

હીરા કને જ્યમ કાચ એવો સાવ હું નાદાન છું.... ૧૩

'શ્રીગંગાચરણો', પૃ. ૨૮ થી ૩૨

- શ્રીમોટા

## સાધનામભ

૧. મુખથી કે મનમાં જાગૃતપણે જપ, સાથે સાથે હદ્યપ્રદેશે ધ્યાન તથા ચેતનાના ચિંતન સહ ભાવાત્મક ભાવનું રટણ.
૨. પ્રત્યેક પળે સતત સમર્પણ, સારું તેમ જ નરસું-બંનેનું.
૩. સાક્ષીભાવ, જાગૃતિ, વિચારોની સંકળ ન છોડો.
૪. બને તેટલું વધુ વાચિક અને માનસિક મૌન રાખો, કેળવો અને ખૂબખૂબ શરણભાવ જીવનમાં ચેતનાપૂર્વકની જાગૃતિથી કેળવ્યા કરો.
૫. આગ્રહો—પ્રભુચિંતન સિવાયના સર્વ આગ્રહો છોડો, નમ્રતા કેળવો, શૂન્ય થવાનું ધ્યેય રાખો.
૬. ખૂબ ભાવપૂર્વક હદ્યસ્થ રહીને આર્દ્ર અને આર્તભાવથી પ્રાર્થના કરો, ભગવાનને સર્વ સુખદુઃખ જાણાવતા રહો, તેની સાથે આત્મનિવેદન દ્વારા અંગત ખૂબ ગાઢો સંબંધ બાંધો, મનમાં કશુંધે ઘોળાવા ન દો. ખાલી રહો.
૭. આવી પડતાં કામો પ્રભુનાં સમજો, જરાયે કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો. પ્રત્યેક પ્રસંગ-બનાવ આપણા કલ્યાણ અર્થે જ છે અને પ્રત્યેક પ્રવૃત્તિ આપણા પોતાના જ વિકાસાર્થ થવી ધટે. પ્રત્યેક પ્રસંગ પાછળ પ્રભુનો ગૂઢ, શુભ સંકેત રહેલો છે.
૮. આત્મલક્ષી-અંતર્મુખી થાઓ, માત્ર પોતાની દુનિયામાં વસો. જાણી-જોઈને જાતને સંડોવવા દો નહિ.
૯. પર (પારકાંની) સેવા પ્રભુની સેવા સમજો, સેવા લેનાર, સેવા દેનાર ઉપર, સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે. રામે આચ્યું છે અને રામને દઈએ છીએ, ત્યાં ‘મારું મારું’ ક્યાં રહ્યું? તારું આ જગતમાં છે શું?
૧૦. પ્રત્યેક કાર્ય, પ્રત્યેક વાતચીત, વ્યવહાર આપણા ધ્યેયને વેગ આપે એવા ખાસ હેતુસર, હેતુનું લક્ષ જવતું રાખીને કરવાં. વાંચતી-લખતી વખતે અને પ્રત્યેક કર્મ કરતી પળે ભાવની સ્મરણ ધારણાનો અભ્યાસ કેળવ્યા કરો.
૧૧. વૃત્તિનું મૂળ શોધો, તેનું પૃથક્કરણ કરો. તેમાં ભેળવાયા વિના તેને તટસ્થતાપૂર્વક અને સ્વસ્થતાપૂર્વક નિહાળો.
૧૨. પ્રભુની પ્રત્યેક કળા, સૌંદર્ય, રમ્યતા, વિશુદ્ધતા આદિ પ્રસાદીઓમાં

રહેલા ભાવનું, તેને તેને અનુરૂપ ભાવનું, આપણામાં ત્યારે અવતરણ થવા પ્રાર્થના કરવી.

૧૩. ઊર્ભિ, આવેશ અને લાગણીને એમ ને એમ વહી જવાન દો, તેમજ તેમાં બેળવાઈ પણ ન જાઓ. તેનો સાધનામાં ઉપયોગ કરો, તાટસ્થ્ય કેળવો.
૧૪. જમતી વખતે અને પાણી પીતી વખતે જીવનમાં ચેતનશક્તિના અવતરણ-ભાવની પ્રાર્થના કરવી, શૌચ, પેશાબ આદિ કિયાઓ સમયે વિકારો, નબળાઈઓ ઈત્યાદિના વિસર્જનભાવની પ્રાર્થના કરવી.
૧૫. સ્થૂળનો ઘ્યાલ ત્યજને સૂક્ષ્મતત્ત્વને નજર સામે રાખો. વૃત્તિની શુદ્ધિ કરો, ભાવની વૃદ્ધિ કરો.
૧૬. પ્રભુ સચરાચર છે. આત્મવત્ત સર્વભૂતેષુની ભાવના કેળવો.
૧૭. પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુની ઊજળી બાજુ જુઓ. કોઈનાય કાળ ન થાઓ, કશાય ઉપર ઝટ અભિપ્રાય ન આપો, વાદવિવાદ ના કરો, પોતાનો આગ્રહ ન રાખો, બીજાઓમાં શુભ હેતુઓનું આરોપણ કરો, માનસિક અને સાર્વત્રિક ઉદારતા જીવનમાં પ્રગટાવો, ખૂબ પ્રેમભાવ કેળવો, પ્રકૃતિનું રૂપાંતર કરવાનું છે, તે લક્ષ્યમાં રાખીને પ્રકૃતિવશ ન થતાં કર્મોની ઉપરવટ વર્તો. ફળની આસક્તિ છોડો. પોતાને થતા અન્યાયો-આવી પડતાં દુઃખો-આદિનું મૂળ પોતામાં જ છે એમ દઢાવો, ગુરુમાં પ્રેમભક્તિભાવ દઢતર કર્યા કરો. અભીષ્ટા, ઈન્કાર અને સર્મણાનો ત્રિવેણીસંગમ ઉદ્ભવાવો, સદાય પ્રસન્નતા પ્રવર્તાવો, કૂપા અને પુરુષાર્થના યુગલને જીવનમાં ઉતારો, પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો, મન નિઃરૂપદ કરો, રાગદ્વેષ નિર્મળ કરવાની જગૃતિ રાખો, થયેલા આધ્યાત્મિક અનુભવો પ્રત્યક્ષ રોંઝિદા વહેવારમાં જીવતા કરો, ક્યાંયે કશામાંથી ભાગવાનું ના હોય, યદ્યચ્છા જે આવી મળે તે પ્રભુપ્રસાદી ગણીને તેને વધાવી લો. ક્યાંયે કોઈની સરખામણી ના કરો, અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ એ મનની ભ્રમણા છે, જીવનસાધના સારુ સર્વ કંઈ સાનુકૂળ જ હોય છે, પ્રભુપ્રય-તેના મૂક યંત્ર-થવાની જ બસ એક ઉતેજના હવે જીવનમાં રાખો.
૧૮. કર્મમાં, કર્મનું મહત્ત્વ નથી, પરંતુ જીવનના ભાવનું સતત એકધારું, જીવનું ચિંતન રહ્યા કરે એ સવિશેષપણે મહત્ત્વનું છે. તેવો જીવતો અભ્યાસ કર્મ કરતી પળે કેળવવો.

- શ્રીમોટા

॥ હરિ:ઊ ॥

## પૂજય શ્રીમોટાના જીવનની મહિંસની તવારીખ

જન્મ : તા. ૪-૬-૧૮૮૮, ભાડરવા વદ ચોથ, સંવત ૧૮૫૪

સ્થળ : સાવલી, જિ. વડોદરા, નામ : ચુનીલાલ,

માતા : સૂરજબા, પિતા : આશારામ, અટક : ભાવસાર.

૧૮૧૬ : પિતાનું અવસાન.

૧૮૦૫ થી ૧૮૧૮ : તૂટક અભ્યાસ-સાથે આકરી મજૂરી.

૧૮૧૯ : મેટ્રિક પાસ.

૧૮૧૯-૨૦ : વડોદરા કોલેજમાં.

તા. ૬-૪-૧૮૨૧ : કોલેજ ત્યાગ.

૧૮૨૧ : ગુજરાત વિદ્યાપીઠ.

૧૮૨૧ : વિદ્યાપીઠનો ત્યાગ. હરિજન સેવાનો આરંભ.

૧૮૨૨ : ફેફદુના રોગથી કંટાળીને ગરુડેશ્વરની ભેખડ ઉપરથી આત્મહત્યાનો પ્રયાસ, દૈવી બચાવ, 'હરિ:ઊ' જપથી રોગ મટાડવાનો સફળ પ્રયોગ.

૧૮૨૩ : 'તુજ ચરણે' તથા 'મનને'ની રચના.

૧૮૨૩ : વસંતપંચમીએ પૂ. શ્રીબાળયોગીજી દ્વારા દીક્ષા. શ્રીકેશવાનંદ ધૂણીવાળા દાદાનાં દર્શને - સાંઈઝડા ગયા. રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર પ્રભુપ્રીત્યર્થે હરિજન સેવા.

૧૮૨૬ : લગ્ન-હસ્તમેળાપ વખતે સમાધિનો અનુભવ.

૧૮૨૭ : હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ-પરિણામે 'હરિ:ઊ' જપ અખંડ થયો.

૧૮૨૮ : 'તુજ ચરણે' ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.

૧૮૨૮ : પહેલી હિમાલય યાત્રા.

૧૮૨૮ : સાકોરીના પૂ. શ્રીઉપાસનીબાબાનું નિયાદમાં આગમન, એમના આદેશ મુજબ સાકોરી જવું-ત્યાં મળમૂત્રની પથારીમાં સાત દિવસ.

૧૮૩૦ : મનની નીરવતાનો સાક્ષાત્કાર.

૧૮૩૦ થી 'ઉર દરમિયાન સાબરમતી, વીસાપુર, નાસિક અને ધરવડા જેલમાં. હેતુ-દેશસેવાનો નહિ, સાધનાનો. સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ-મૌન. વિદ્યાર્થીઓને સમજાવવા વીસાપુર જેલમાં સરળ ભાષામાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું વિવરણ લખ્યું-'જીવનગીતા'

૧૮૩૪ : સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર.

૧૮૭૪થી ૧૮૭૮ દરમિયાન હિમાલયમાં અધોરી ભાવા પાસે જવાનું બન્યું, ધૂવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં ૨૧ છાણાંની ૨૧ ધૂણી ધખાવી નર્મદાકિનારે ખુલ્લામાં શિલા ઉપર નજી બેસીને સાધના, શીરડીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અંતિમ તબક્કાનું માર્ગદર્શન.

૧૮૭૯ : તા. ૨૮-૩-૧૮૭૯ : રામનવમી, સંવત : ૧૮૮૫ કાશીમાં નિર્ગૃષ બ્રહ્મનો સાક્ષાત્કાર. હરિજન સેવક સંઘમાંથી રાજીનામું. ‘મનને’ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.

૧૮૮૦ : (તા. ૮-૮-૧૮૮૦) વિમાનમાર્ગ અમદાવાદથી કરાંચી જવાનો ગૂઠ હુકમ.

૧૮૮૧ : માતાનું અવસાન.

૧૮૮૨ : હરિજન સેવક સંઘમાંથી ધૂટા થયેલા, છતાં હરિજન કન્યાધાત્રાલય માટે મુંબઈમાં ફાળો ઉધરાવ્યો. બે વખત સખત પોલીસમાર-દેહાતીત અવસ્થાના પુરાવા.

૧૮૮૩ : ૨૪, ફેઝુઆરીમાં ગાંધીજીના પેશાબના ઝેરી જંતુઓનું પોતાના પેશાબમાં દર્શન. નૈમિત્તિક તાદાત્મ્યનો અનુભવ.

૧૮૮૪ : હિમાલયની યાત્રા-અદ્રભૂત અનુભવો.

૧૮૮૬ : હરિજન આશ્રમ, અમદાવાદ મીરાંકુટિરમાં મૌનએકાંતનો આરંભ.

૧૮૮૦ : દક્ષિણ ભારતના કુંભકોણમ્ભૂમાં કાવેરી નદીને કિનારે હરિઃ ઊં આશ્રમની સ્થાપના.

૧૮૮૪થી સુરતના કુરુક્ષેત્રમાં એક ઓરડીમાં મૌનએકાંતનો આરંભ.

૧૮૮૫ : (તા. ૨૮-૫-૧૮૮૫) નડિયાદ, શેઢીનદીને કિનારે હરિઃ ઊં આશ્રમની સ્થાપના.

૧૮૮૬ : (તા. ૨૩-૪-૧૮૮૬) સુરત, કુરુક્ષેત્રમાં હરિઃ ઊં આશ્રમની સ્થાપના.

૧૮૮૨થી ૧૮૭૫ : શરીરના અનેક રોગો-સતત પ્રવાસ સાથે ઉદ્ય અધ્યાત્મ-અનુભવ ગ્રંથોનું લેખન-પ્રકાશન.

૧૮૭૬ : ફાજલપુર-મહીનદીના કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા. ૨૩-૭-૧૮૭૬ના રોજ માત્ર છ જણાની હાજરીમાં આનંદપૂર્વક દેહત્યાગ. પોતાનું ‘ઈટ-ચુનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ નિમિત્ત મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધાવવાના લોકફાળામાં કરવાની સૂચના.

॥ હરિઃ ઊં ॥

॥ હરિઃઊં ॥

## આરતી

ॐ શરણચરણ લેજો, પ્રભુ શરણચરણ લેજો,  
પતિત ઉગારી લેજો (૨) કર ગ્રહી ઉર લેજો. ... ઓં શરણ.

મનવાણીના ભાવો, કર્મ વિષે ઉતરો, પ્રભુ (૨)  
મન, વાણી ને દિલને (૨) કૃપાથી એક કરો. ... ઓં શરણ.

સર્વ મળેલાં સાથે, દિલ સદ્ગ્રાવ ઉગો, પ્રભુ (૨)  
છો અપમાન થયાં હો (૨) ત્યાંયે ભાવ બઢો. ... ઓં શરણ.

નિભ પ્રકારની વૃત્તિ, ઉર્ધ્વગમન કરવા, પ્રભુ (૨)  
પ્રભુકૃપાથી મથાજો (૨) ચરણશરણ ગ્રહવા. ... ઓં શરણ.

મનના સકળ વિચારો, પ્રાણતણી વૃત્તિ, પ્રભુ (૨)  
બુદ્ધિતણી સૌ શંકા (૨) ચરણકમળ ગળજો. ... ઓં શરણ.

દિલમાં કંઈક ભર્યું હો, તે થકી બીજું ઉલટું, પ્રભુ (૨)  
કદી પણ મુજથી ન બનજો (૨) એવી મતિ દેજો. ... ઓં શરણ.

જ્યાં જ્યાં ગુણ ને ભાવ, દિલ ત્યાં મુજ ઠરજો, પ્રભુ (૨)  
ગુણ ને ભાવની ભક્તિ (૨) દિલ મુજ સંચરજો. ... ઓં શરણ.

મન, મતિ, પ્રાણ પ્રભુ ! તુજ ભાવ થકી ગળજો, પ્રભુ (૨)  
દિલમાં તુજ ભક્તિની (૨) છોળો ઉછળજો. ... ઓં શરણ.

-શ્રીમોટા

## पूर्ण श्रीमोटाना पुस्तक

१. मनने (पद्य)	२२. ओपनपेक्ष (पत्रो)	४४. ओपनसैरब (पद्य)	६७. कर्मउपासना (पद्य)
२. तुझ अरेहे (पद्य)	२३. आपूपिकर (ग्राथना)	४५. ओपनसंवरश साधना (पद्य)	६८. भौनभेंकरतनी कुडीमे (प्रवचन)
३. हृष्टपूकर (पद्य)	२४. उरिजन संतो (गध-पद्य)	४६. ओपनरंगत (पद्य)	६९. भौनमंदिरनु छरिकर (प्रवचन)
४. ओपनपेले (पद्य)	२५. Life's Struggle ('ओपनसंग्राम' नो अनुवाद)	४७. ओपनमथमध्य (पद्य)	७०. भौनमंदिरतनी भर्म (प्रवचन)
५. श्रीगंगावरेहे (पद्य)	२६. ओपनमंथन (पत्रो)	४८. दुमा (पद्य)	७१. भौनमंदिरमां अल्यु (प्रवचन)
६. त्रिशवरशकमठी (पद्य)	२७. ओपनसंशोधन (पत्रो)	४९. स्वार्थ (पद्य)	७२. भौनमंदिरमा ग्रामप्रतिष्ठा (प्रवचन)
७. क्रमिंगाथा (पद्य)	२८. नर्मदापृष्ठ (पद्य)	५०. श्रीसद्गुरु (पद्य)	७३. शै-पुरिश (संतंग)
८. प्राप्तमत्राप (पद्य)	२९. ओपनदर्शन (पत्रो)	५१. ओपनकरनी (पद्य)	७४. जन्म-पुनर्जन्म (संतंग)
९. पुनित मेमगाथा (पद्य)	३०. ओपनपचाचा (संतंग)	५२. ऐम (पद्य)	७५. तदूप-स्वरूप (संतंग)
१०. ओपनसंग्राम (पत्रो)	३१. ओपनसंदेश (पद्य)	५३. ओपनसंदेशन (पद्य)	७६. अंग्रेता-आंग्रेता (संतंग)
११. ओपनपंथ (पत्रो)	३२. ओपनपंथ (पद्य)	५४. भोज (पद्य)	७७. औजाहेड (संतंग)
१२. ओपनपंथय (पत्रो)	३३. ओपन अनुभव गीत (पद्य)	५५. गुणविभर्ण (पद्य)	७८. अन्ध-अम्बन्ध (संतंग)
१३. AT THY LOTUS FEET ('तुझ अरेहे' नो अनुवाद)	३४. ओपननलक (पद्य)	५६. ओपनपुण्डरी (पद्य)	७९. श्रेष्ठाश्वास (संतंग)
१४. ओपनपंशु (पत्रो)	३५. ओपनलहरि (पद्य)	५७. ओपनकुमी (पद्य)	८०. एमिक्रशु-समीक्रशु (संतंग)
१५. TO THE MIND ('मनने' नो अनुवाद)	३६. ओपनसंरश (पद्य)	५८. ओपनचंतर (पद्य)	८१. पगले पगले ग्राकाश (पत्रो)
१६. ओपनपंशु (पत्रो)	३७. श्रङ्खी (पद्य)	५९. ओपनधरतर (पद्य)	८२. कन्सरनी सामे (पत्रो)
१७. ओपनपाथी (पत्रो)	३८. भौव (पद्य)	६०. भावकलिका (पद्य)	८३. धननी धोण
१८. ओपनमंत्राश (पत्रो)	३९. ओपनसंसाधन (पद्य)	६१. भावरेषु (पद्य)	८४. भुक्तात्मानो भ्रमस्पर्श (पत्रो)
१९. ओपनप्रवेश (पत्रो)	४०. निमिता (पद्य)	६२. लालचुपती (पद्य)	८५. संतहरू (पत्रो)
२०. ओपनप्रवेश (पत्रो)	४१. चाँगोहेष (पद्य)	६३. लालचुपत (पद्य)	८६. समय साथे समाधान (पत्रो)
२१. ओपनगीती (गध-पद्य)	४२. ओपनआळहाट (पद्य)	६४. लालचुपत (पद्य)	८७. उपरंत उपरन्त पुस्तकीमंथी थमेलं १५ संकलनी.